

ਪ੍ਰਕਾਸ਼

स्थापना वर्षः १८६०

q&gt; : >

જૂન : ૨૦૧૦

અંક : ૧૨

ભગવતીકુમાર શર્મા  
પ્રમુખ

ભોળાભાઈ પટેલ  
વરિષ્ઠ કાર્યવાહકસમિતિ સં

પ્રકુલ્પ રાવલ  
પ્રકાશનમંત્રી

ੴ ਸਤਿਗੁਰ

યોગેશ જોખી

સહતંત્રી

ਪ੍ਰਕੂਲਲ ਰਾਵਲ



## ગુજરાતી સાહિત્ય પરિષદ

મેઘાદુરી શાનપીઠ m ક. લા. સ્વાધ્યાયમંહિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનમંડળ, આશ્રમ માર્ગ,  
‘યાદીમુખ’ પાછળ, નાદીકિનારે. અમદાવાદ-૩૮૦ ૦૦૬

ફોન. : ૨૬૪૮૭૯૮૭

ਪੁਰਖ

ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

- v ‘પરબ’ દર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.
  - v ‘પરબ’ના આહક તથા પરિષદ્ધના સભ્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.
  - v ‘પરબ’નું વાર્ષિક લવાજમ રૂ. ૧૫૦ છે.
  - v વિદ્યાર્થીઓ માટે ‘પરબ’નું વાર્ષિક લવાજમ રૂ. ૭૫ છે, પ્રમાણપત્ર સાથે બીડવું.
  - v ગુજરાતી સાહિત્ય પરિષદ્ધના વાર્ષિક તેમજ આજીવન સભ્યપદના શુલ્કમાં ‘પરબ’ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.
  - v પરિષદ્ધના વાર્ષિક વ્યક્તિગત સભ્યપદનું શુલ્ક રૂ. ૨૦૦ તથા સંસ્થાગત સભ્યપદનું શુલ્ક રૂ. ૩૦૦ છે.
  - v પરિષદ્ધના આજીવન સભ્યપદનું શુલ્ક રૂ. ૨,૦૦૦ છે તથા સંસ્થા આજીવન સભ્ય ફી રૂ. ૩,૦૦૦ છે. (વિદેશવાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)
  - v ‘પરબ’ લવાજમ તથા પરિષદ સભ્યપદ શુલ્કની રકમ મનીઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના નામે જ મોકલવી.

લેખકોને :

- v ‘પરબ’માં પ્રગટ થતાં લખાડોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.
  - v લેખકોએ પોતાનું લખાણ ફૂલસકેપ અથવા DCL સાઈઝના કાગળની એક બાજુએ, સુવાચ્ય અક્ષરે લખી મોકલવું. પોસ્ટકાર્ડ, ઇનલેન્ડ કે ચબરનીઓમાં કૃતિ મોકલવી નહીં. પ્રત્યેક કૃતિ નીચે પૂરું સરનામું લખવા તથા એક નકલ પોતાની પાસે રાખીને જ કૃતિઓ મોકલવા વિનંતી.
  - v સ્વીકૃત કૃતિની જાણ કરશે. ટ્પાલ-ટિકિટે ચોંટેલું કફર મોકલ્યું હશે તો અસ્વીકૃત કૃતિ પરત કરવામાં આવશે, અન્યથા કૃતિ રદ ગણવી. પોસ્ટકાર્ડ મોકલ્યું હશે તો અસ્વીકૃતિની જાણ કરશે.
  - v પત્રવ્યવહારનું સરનામું : તંત્રી, ‘પરબ’ ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવધનભવન, આશ્રમમાર્ગ, ‘ટાઈમ્સ’ પાછળ, નદીકિનારે, પો.બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

२-१२९५ : भिंडप्रदेश@अन्वय.गोप

**అనుమతి:** తితిత.యాచిటదిబణ్ణయూర్ ధిచితిచిన్నిటజ.ఎంతితిత.యాచిటదిబణ్ణయూర్ ధిచితిచిన్నిటజ.ధిం

ફોન અને ફોક્સ : ૨૬૮૮૭૯૪૭

ISSN 0250-9747 ਪੰਜਾਬ

ପ୍ରକାଶ କ୍ଷେତ୍ର ୩. ୨୦/-

**માર્ગિક :** ગુજરાતી સાહિત્ય પરિષદ વર્તી મુદ્રક અને પ્રકાશક : પ્રકૃત્તલ રાવલ (પ્રકાશનમંત્રી), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'ઘરીએમ્સ' પાછળ, નાદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૮ S તંત્રી : યોગેશ જોધી S મુદ્રણસ્થાન : શારદા મુદ્રણસ્થાલય, ૨૦૧, તિલકરાજ, પંચવડી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૬ & ૨૬ પદ્મરાજનગર

## આ નુંક મ

### પરિષદ-પ્રમુખનો પત્ર

કવિતા

અનુવાદનો વ્યવહાર દ્વિમાર્ગી બનવો જોઈએ • ભગવતીકુમાર શર્મા ૪  
બદલાય - બદલાતું રહે • રાજેશ વ્યાસ 'મિસ્કીન' 6, પરંતુ... •  
રાજેશ વ્યાસ 'મિસ્કીન' 6, જોયું... • રાજેશ વ્યાસ 'મિસ્કીન' 7,  
સ્મરણ... • રાજેશ વ્યાસ 'મિસ્કીન' 7, બહુરાંદર • રાજેશ વ્યાસ  
'મિસ્કીન' 7, શીખ • રામચન્દ્ર પટેલ 8, - તો જાણું • રામચન્દ્ર પટેલ  
8, પરી • દેવેન્દ્ર દરે 8, ગજબની પલંડી... • મનોજ જોશી 'મન' 8,  
સેહનું બળ • વિષ્ણુ પટેલ 9, આ નદી • મંગળ રાઠોડ 9, મારે બધાંની  
સાથે ખુલાસા... • ઈન્દ્ર પુવાર 10, બે તાંકા • પરાગ નિરેદી 11

વાર્તા

ગંગા નાન્યાનું પુષ્ય • પ્રવીષારસિંહ ચાવડા 12

વધુકથા

મૂરી • જ્યે ગજજર 19

પદ્ધનાટક

મહાપ્રસ્થાન • યજેશ દરે 20

નિબંધ

કૂવો • કિશોરસિંહ સોલંકી 31

આસ્વાદ

પાંચ પે'ગમાં દરિયાસવનું કાવ્યરસપાન ! • રાધીશયામ શર્મા 37,  
નવતર ગજલની મુદ્રા અંકિત કરતી રચના • ભાનુપ્રસાદ પંડ્યા 41

ભારતીય સાહિત્ય

તું તો અભિનિશિખા • મીરાં તારણેકર, અનુ. કાજલ ઓઝા વૈદ્ય 45

અભ્યાસ

કવિ કલાપીના જીવન-કવનની સર્વાંગ છબી રાજીવી કવિ કલાપી •  
ગંભોરસિંહ ગોહિલ 47

વક્તવ્ય

કવિતા અને દર્શન • ભોગાભાઈ પટેલ 54, ગુજરાતી સંતસાહિત્ય :  
મૂળ અને કુળ • નરોતમ પવાણ 69

સાહીક્ષા/ગ્રંથાવલોકન

વર્ષ ૨૦૦૬ની ગુજરાતી કવિતાનો ચહેરો • સિલાસ પટેલિયા 73,  
સુધન અભ્યાસનો પ્રસાદ : 'ગિરનાર' • ભારતી રાણે 76

પત્રસેતુ

ભોગાભાઈ પટેલ, નરેન્દ્રસિંહ વી. રાઠોડ 79

પરિષદવૃત્ત

સંકલન : રાજેન્દ્ર પટેલ 81

સાહિત્યવૃત્ત

સંકલન : પ્રકૃત્યલ રાવલ 85

આ અંકના લેખકો

89

આબરમતી મધ્યરથ જેલના કેદીઓ

### પરિષદ-પ્રમુખનો પત્ર

#### અનુવાદનો વ્યવહાર દ્વિમાર્ગી બનવો જોઈએ

બંગાળી નવલકથાકાર શરદબાબુ અને મરાઠી નવલકથાકાર વિ. સ. ખાંડેકરની  
લોકપ્રિયતા પરમ સીમાએ હતી ત્યારે તેઓની બધી નવલકથાઓ ગુજરાતીમાં અનુવાદ  
પામી હતી અને તે એટલે સુધી કે 'શરદબાબુ અને ખાંડેકર ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય  
નવલકથાકારો છે' તેવી સ્વીકૃતિ લોકોક્ષિત પ્રચલિત થઈ હતી.

બીજી ભાષાની કૃતિઓને ગુજરાતીમાં ઉત્તરવા બાબત ગુજરાતે પ્રશસ્ય ઔદ્ઘાર્ય  
દાખલ્યું છે. ભારતીય ઉપરાંત વિદેશી ભાષાઓની ગજનાપાત્ર કૃતિઓ પણ ગુજરાતીમાં  
મોટી સંખ્યામાં અનૂદિત થઈ છે. નગીનદાસ પારેખ, રમશલાલ સોની, જયંતી દલાલ,  
ભોગીલાલ ગાંધી, મહાદેવભાઈ દેસાઈ, ડૉ. સુરેશ દલાલ વગેરે આપણા સંનિષ્ઠ અનુવાદકો  
પણ રહ્યા છે. ગોપાળગાવ વિદ્વાંસની અનુવાદ-સેવાને પણ કેમ ભૂલી શકાય ? ટોલ્સ્ટોયની  
મહાનવલ 'વોર એન્ડ પીસ'ના ગુજરાતી અનુવાદનું જ્યંતી દલાલનું કામ એક યજ્ઞકાર્યથી  
લગીયે ઉત્તરતું ન લેખાય.

પરંતુ અનુવાદનો આ વ્યવહાર કેટલેક અંશો એકમાર્ગી રહ્યો છે તેનો કંઈક વસવસો  
પણ આપણા મનમાં હોય જ. ઉત્તમ ગુજરાતી સાહિત્યકૃતિઓ પણ જે પ્રમાણમાં અન્ય  
ભાષાઓમાં પહોંચયેલી જોઈએ તે પ્રમાણમાં નથી પહોંચી શકી એ એક વાસ્તવિકતા છે.  
એનાથી પરભાષી વાચકો ગુજરાતી સાહિત્યથી વંચિત રહ્યા તે તો ખરું જ, પણ તે સાથે  
ગુજરાતી સાહિત્ય જે માત્રામાં રાષ્ટ્રીય ફલક પર મુકાવું જોઈએ તેમાં ન્યૂનતા વર્તાય છે.  
એવા પ્રયત્નો નથી થયા એમ ન કહી શકાય. નહીંતર મુનશીની નવલકથાઓથી માંડીને  
રાજેન્દ્ર શાહની કવિતાઓ સુધીની ગુજરાતી કૃતિઓએ પરભાષાનો પ્રકાશ ન જોયો હોત,  
પણ આ પ્રવૃત્તિમાં વેગ આશવાની તીવ્ર આવશ્યકતા છે જ. કેન્દ્રીય સાહિત્ય અકાદમી,  
'ભારતીય શાનપીઠ', 'નેશનલ બુક ટ્રસ્ટ' જેવી રાષ્ટ્ર કક્ષાની સાહિત્યસંસ્થાઓ દ્વારા આ  
દિશામાં ધીમું પણ કેટલુંક કામ થયું છે અને થાય છે, જેથી કેટલીક ગુજરાતી કૃતિઓ હિન્દી,  
અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની અનુવાદપ્રવૃત્તિ પણ વિસ્તરતી  
જાય છે. પ્રદીપ ખાંડવાલાએ ઉત્કર્ષ સાહિત્યકારોએ ચૂંટેલાં ગુજરાતી કાવ્યોના અંગ્રેજી  
અનુવાદો પ્રગટ કર્યા છે. તેમણે અનુવાદ પ્રવૃત્તિ માટે 'સાહિત્ય પરિષદ'ને મોટું દાન પણ  
આપ્યું છે.

આ ઉપરાંત ગુજરાતી સાહિત્યકૃતિઓને બીજી ભાષાઓમાં પહોંચાડવાના સ્તુત્ય  
પ્રયત્નો વ્યક્તિગત સ્તરે અને એકાદ પ્રકાશનગૃહ તરફથી થયા છે. સુરતની પ્રકાશનસંસ્થા  
'સાહિત્ય સંગમ'ના સંચાલક નાનુભાઈ નાયક મિશનની ભાવનાથી પાંચ ગુજરાતી પુસ્તકોના  
હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં અનુવાદ કરાવીને તેના પુસ્તકો પ્રગટ કર્યા છે.

વ્યક્તિગત પ્રયત્નોની વાત કરું તો મુંબઈના નવલકથાકાર દિનકર જોશીનું નામ અને  
કામ સ્મરણો ચેઢે છે. સંપર્કના નેટવર્ક અને કૃતિઓના સત્તવ વડે એમનાં પોતાનાં પુસ્તકો  
ટીકીટીક સંખ્યામાં બીજી ભાષાઓમાં પહોંચ્યાં જ છે. તેમની બહુચાર્યિત નવલકથાનો

તાજેતરમાં જર્મન ભાષામાં અનુવાદ પ્રગટ થયો છે. આ ઉપરાંત એમણે ઉત્તમ ગુજરાતી પુસ્તકોના બીજી ભાષાઓમાં અનુવાદો કરાવી તેને ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવાનું કામ હાથ ધર્યું છે. શ્રેષ્ઠીઓ અને ધર્મપૂરુષોના સહયોગથી આ સ્તુત્ય કામ વેગપૂર્વક આગળ વડી રહ્યું છે. આ ઉપરાંત પંડિત સાતવલોકરજી સંપાદિત 'મહાભારત'નો ગુજરાતી અનુવાદ ગુજરાતના સંસ્કૃત શાનીઓ પાસે કરાવીને તેના દળદાર ગ્રંથો હાલમાં પ્રકાશિત કર્યા છે.

સફ્ટબ્લોઝ યુનિવર્સિટી-શિક્ષણના પ્રસારને કારણે હવે ગુજરાત-મુંબઈમાં બહુભાષાવિદો કેટલાક પ્રમાણમાં ઉપલબ્ધ છે. હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભગીની ભાષાઓ ઉપરાંત અંગ્રેજીમાં ઉત્તમ ગુજરાતી સાહિત્યકૃતિઓને પણોચાડવાનું કામ હવે પહેલાં જેટલું મુશ્કેલ ન ગણાવું જોઈએ. આવશ્યકતા છે અનુવાદકો, સાહિત્યશિક્ષણની સંસ્થાઓ, પ્રકાશનગૃહો વગેરેની વિશેષ સહિત્યતાની. બને તો અનુવાદના એકમાર્ગી વ્યવહારમાંથી ગુજરાતી સાહિત્યને ઉગારી શકાય.

ભગવતીકુમાર શર્મા

### પ્રક્રિયા

(૧૦૨) વિદ્યાનાં વિત-સંવિત : ડૉ. મોહનભાઈ પંચાલ, ૨૦૦૮, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦+૨૮૬, રૂ. ૧૮૫/-  
 (૧૦૨/એ) શિક્ષણ અને સાહિત્યનો સમન્વય : સંપા. ડૉ. બહેચરભાઈ પટેલ, ૨૦૦૮, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૨+૪૬૪, રૂ. ૩૦૦/- (૧૦૩) સાક્ષરનો સાક્ષાત્કાર-૧૪ : રાધીશયામ શર્મા, ૨૦૦૮, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૮+૩૮૨, રૂ. ૩૦૦/- (૧૦૩/એ) પ્રેમ અને પ્રસન્નતાનો પ્રવાહ : શિધર વગ્નિસ પોલ, ૨૦૦૮, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮+૧૩૬, રૂ. ૭૦/-.

### આત્મકથા

(૧૦૪) સૂરત મુજ ઘાયલ ભૂમિ : ભગવતીકુમાર શર્મા, ૨૦૦૮, સાહિત્યસંગમ, સૂરત, પૃ. ૩૬૮, રૂ. ૫૦૦/-.

### નાટક

(૧૦૫) માશસાઈના દીવા : જવેરંદ મેઘાળી, નાટ્યરૂપાંતર : ભરત યાણીક, ૨૦૦૮, પ્રવીણ પલ્બિકેશન, રાજકોટ, પૃ. ૮૬, રૂ. ૭૫/- (૧૦૬) સંવેદનાનું સપ્તક : લવકુમાર મ. દેસાઈ, ૨૦૦૮, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮+૨૨૦, રૂ. ૧૩૦/- (૧૦૭) ભાત ભાતકે લોગ : જીયંતિ ડૉ. શાહ, ૨૦૦૮, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૬+૨૬૫, રૂ. ૧૩૫/- (૧૦૭/એ) મા છિન્ન મસ્તા : ડૉ. કનેયાલાલ ભંડ, ૨૦૦૮, સાહિત્યસભા, હિમતનગર, પૃ. ૬+૪૮

## કવિતા

### બદલાય - બદલાતું રહે | રાજેશ વ્યાસ 'મિસ્કીન'

બદાર - ભીતરનું ચલણ બદલાય - બદલાતું રહે,  
રોજ ઊરીને શરણ બદલાય - બદલાતું રહે.

સૌ ચહે છે ક્રાંક જંપી સ્થિર થે જાવા અહીં,  
ને જીવન પ્રત્યેક કષણ બદલાય - બદલાતું રહે.

થાય છે ઘરઘરાં મુખદુઃખની જરા વધઘટ અને,  
વિશનું વાતાવરણ બદલાય - બદલાતું રહે.

બેઠ જણ છે એ જ અના એ જ સંબંધો છતાં,  
બેઠના મનનું વલણ બદલાય - બદલાતું રહે.

કેંકની ત્યાં બાદબાકી કેંક ઉભેરાય ત્યાં,  
હરવખત સૌનું સ્વરણ બદલાય - બદલાતું રહે.

પિંજરાનું ને એ જંગલનું જીવન કેવો ફરક ?  
હરપણે ભોળું હરણ બદલાય - બદલાતું રહે.

ક્રાંયથી દરિયાને બદલાતું જરી પોસાય ના,  
એક નાનકું જરણ બદલાય - બદલાતું રહે.

### પરંતુ... | રાજેશ વ્યાસ 'મિસ્કીન'

બચપણથી તે આજ લગી કેંકેટલા મણ્યા પરંતુ...  
એકબીજાના શબ્દ-મૌનને અક્ષરશાસ્ત્ર કેંક કણ્યા પરંતુ...

દૂધ અને સાકરની માફક એકબીજામાં ભણ્યા પરંતુ...  
અને દેહનું કરી કોરિયું કેંક રાત જળહળ્યા પરંતુ...

આશા જેવું સપના જેવું સાવ અચાનક ફૂલ્યા પરંતુ...  
પ્રચંડ ધોધ સમું ધસમસત્તા દસે દિશા ખળભળ્યા પરંતુ...

કદી એક ટીપાની ખાતર રણ જેવું ટળવળ્યા પરંતુ...  
કદીક તળિયાં તોડીને પાતાળેથી ખળભળ્યા પરંતુ...

સઘણું નક્કર છતાંય પોલું બધી હકીકત સપના જેવી,  
હીરાની માફક ઘોંદે જઈ પાછા અંતે વળ્યા પરંતુ...

## જોયું.... | રાજેશ વ્યાસ 'મિસ્કીન'

સાવ બેફિકર હસતું-રમતું બચપણ જોયું,  
બળ્યું-જળ્યું ને ઠોકર ખાતું ઘડપણ જોયું.  
બદલાતા ચહેરા બદલાતું મન પણ જોયું,  
મૌન રહી વરસોથી જોતું દર્દ્દણ જોયું.  
કેટકેટલા પ્રસંગ સુખદુખના આંખોમાં,  
ઉભરાતું - સૂનું થઈ જાતું આંગણ જોયું.  
સાત જનમનું લાગ્યું-તું નિસ્વાર્થ બરેલું,  
એક ઝાટકે એ જ તૂટતું સગપણ જોયું.  
બધાર દીધા ઉપદેશ ભલભલી ગુંચ ઉકેલી,  
ઘરમાં મૂઝાઈને મરતું ડહપણ જોયું.  
હતો આંખની સાથે મનને સંબંધ ક્યારે,  
બંધ આંખથી બમણું-તમણું-કેં પણ જોયું.

## સ્મરણ... | રાજેશ વ્યાસ 'મિસ્કીન'

....ને પરોઢે પંખીઓ - આકાશ ને વાદળ સ્મરણ,  
સ્નાન કરતાં જળ અડે ત્યાં દેહમાં ખળખળ સ્મરણ.  
અર્થ આપું સૂર્યને એ જળ અને એ પળ સ્મરણ,  
કેટલા સંદર્ભ તાજા આપતું ઝકળ સ્મરણ.  
મંત્ર-પૂજા-કૂલ-દીવો-ધૂપ-ચંદ્ર ગોખમાં,  
બધાર-લીતર આરતીની જોતે ને ઝણહળ સ્મરણ.  
ક્યાંક થઈ મધ્યાક્રમેણ સાંજ વેળા ક્યાં હશું ?  
થાય, ક્યાં ક્યાં કઈ દિશામાં લઈ ગયા અંજળ સ્મરણ.  
ને પછી સંધ્યા પછી જાલર જ્યાં રણગણતી શામે,  
આભના ગરબે ટમકતાં જોઉ કેં હરપળ સ્મરણ.  
આ જમે છે - આ સુઅ છે - ને ઉઠે છે કોણ આ ?  
હોઉં છું મિસ્કીન ક્યાં હું હોય છે કેવળ સ્મરણ.

## બહાર-અંદર | રાજેશ વ્યાસ 'મિસ્કીન'

એક પળમાં બધું જ દેખાડે,  
એક પળમાં બર્ધું જ સંતાડે,  
પારકું કોઈ નથી, મન પોતે,  
બહાર-અંદર સદાય રંઝાડે.  
  
ખોંચયું એટલું નથી અધારું,  
શોભાનું - ટકાનું ખૂબ અધારું છે,  
મહેલ ઊંચા ઘણાયના જોયા,  
હોય જેનું ગયું જીવન ખાડે.  
  
પ્રેમને તો હતું વિકસવાનું,  
ગૌણ છે ધર્મ મુખ્ય છે શ્રદ્ધા,  
એક સગપણ છે વેલ જેવું આ,  
વૃષ પર કે પછી ચહે વાડે.  
  
ક્યાંક મા-લાપ ક્યાંક એ જીવ્યા,  
ગાઢ અંધારમાં પરમતેજે,  
આ જગતને કર્યું સહજ જળહળ,  
કેંક વશકર-કસાઈ-ભરવાડે.

કેંકને માર્જાં ઠેઠનો ચીંદ્યો,  
કેંકને ઘર અને જીવન આપ્યા,  
એ જ મિસ્કીન રજણતો જીવ્યો,  
એક ખોલીમાં એય તે ભાડે.

## શીખ | રામચન્દ્ર પટેલ

ને ઉપદ્યો ચણા લઈ, વળી ભાથું થાનનું  
કોઈ ન આવતું-જતું સ્થુમસામ રસ્તો -  
એમાં ફરે તિમિર એકલું આણું આણું...  
ખૂલે ઉઘાડ, તડકો પકડી લઈને  
નાખ્યા અનાજકણા : પંખગણો વધાવતાં  
હંમેશ જેમ સુકરી કહી બૂમ પાડું...  
  
આવી નહીં નીકળું આગળણ... થાનમાદા  
જોઈઃ કૂઝે ગલૂડિયાં ત્રણચાર ધાવે...  
ને એ સ્વયં દૂધનું દેગંદું !! મૌનમગના.  
કર્યો વિવેક દુકડા કરી રોટલાના  
મોંએ ધર્યા, મુખ પહોળું કરી ન દેખ્યું કે  
બેચિતા ના શુનકી બની અન્ન ખાવા.  
લાગ્યું ઘડી શીખ મને મળી જીવવા વિશે,  
સાચું સવાયું તપે વાયુ-પ્રકાશનું દીસે.

## - તો જાણું | રામચન્દ્ર પટેલ

વાદળ પર ઈશ્વર નામ લખ તો જાણું,  
તડકા વડે રંગી લે નખ તો જાણું.  
ચોફેર પથરાઈ પડી છે લીલોતરી  
નીરખી લે માંદીને ચખ તો જાણું.  
ગંડકી અને ધુમાડો બેઉ સહોદર  
જરા અળગાં રાખી પરખ તો જાણું.  
આપું તાનપૂરો ને દઉ ચિત્તોડગઢ  
મીરાંની જેમ પી લે વખ તો જાણું  
ધૂળ, ધરો-કૂલ, પશુપંખી ને ખાજો,  
બાંધી જો જીવ સાથ અેળખ તો જાણું  
ધરા પર કેટલું બધું વરસે ચોમાસું  
અંકુર ફૂટે એટલું ફૂટે દખ તો જાણું.

## પરી | દેવેન્દ્ર દવે

પ્રવેશી હેરી શી ! રહી નીરખી : એકાગ્ર મનથી  
પરોવાયેલો હું ગડમથલમાં કાલ્ય રચવા !  
છવાયેલી શાંતિ સ્વભાવિત થઈ એનાં કથનથી :  
“ચલો, દાદા ! આપો કલમ મુજને કાં'ક લખવા !”  
દઉ હું જ્યાં બીજી કલમ... હડસેલી કર કહે :  
“તમારી દો કાળી !” કશમણત દેતો, જનમથી  
પડે વાંકું જેને રડમસ મુખે કાગળ ચહે !  
  
ધર્યો જ્યાં પાસેનો લઘુક દુકડો, ત્યાં જ ઉિછળી :  
“નહીં, કોરો મોછો !” ગણગણું : ‘કશુંયે નવ થશે -  
રચાશે શો કાલ્યો ?’ બડબડું : ‘બલા કાલ્યા અર્દી ટળી ?!  
દગો એ તોણાની ગઈ વરતી : ‘ગુસ્સો અવ થશે !’  
“જુઓ, દાદા ! કેવો જડપથી ‘ક’ને મસ્ત લખિયો...”  
નર્યા તાજ્યા લીટા (ધગશ ઢબુની !) રીસ વીસરી  
લઈ તેડી, ચૂમું... વળગી પડતી પાગલ પરી !

## ગજબની પલાંઠી... | મનોજ જોશી ‘મન’

ગજબની પલાંઠી લગાવીને બેઠો !  
વિચારોની વચ્ચે તું આવીને બેઠો !  
ઘટાટોપ ઠચાઓ ધેરાણી અહીંયાં,  
અહીં કયાં તું ધૂણી ધમાવીને બેઠો !  
કદી ભાર નીકળી શક્યો ના ધુમાડો !  
આ કેવી ચલમ તું લગાવીને બેઠો ?  
તૂટ્યું તર દઈને કશ્યું કયાંક અંદર !  
બલે તું કહે ઘા ચુકાવીને બેઠો !  
સમયસર તને ચેતબ્યો’તો છતાં તું,  
ફરીથી કલમને ઉઠાવીને બેઠો !

## સ્નેહનું બળ | વિષ્ણુ પટેલ

આ ચશમાં, ને ડેન્યર, ને ચહેરાના સળ જો !  
નથી લાગતું વહી ગયાં ખૂબ જળ જો ?!  
શરીરોને ઉમર નથી છોડવાની;  
પ્રિયે, પણ, આ કેવી ધબકતી છે પળ જો !  
અહીં આવ, ને બેસ મારી સમીપે:  
રચે સૂર્ય ત્યાં ‘સાંજ’ કહેવાતું છળ જો !  
નથી હેર એને તો પડવાનો કોઈ,  
જૂએ સાંધ્ય સૂરજમાં તું પકવ ફળ જો.  
સ્વજન સાદ દેતું ક્ષિતિજેથી કોઈ,  
કરી સ્નેહનું નેજવું ને એ સ્થળ જો !  
કરી દે સખી આજ સૂરજનો ‘થખ્યો’ :  
અને કાલ તારા આ થખ્યાનું ફળ જો !  
ઉચાટો ખૂણો હંસ્તા થાકી-થારી !  
પ્રિયે આપણા સ્નેહનું જો, તું બળ જો !

## આ નદી | મંગળ રાહોડ

એક  
આખોય તાકો  
કોઈએ ફેલાવી દીધો હોય  
મારી આગળ  
ઓમ હરરોજ વહી જાય છે આ નદી.  
એક આખોય તાકો !  
એ મારા શરીરની  
લંબાઈ કરતાં વધારે છે  
અને મારી તરસ કરતાં  
ટૂકો છે.  
એ કેમ કરીને તને સમજાવું ?  
કે અહીંથી મૂક કાપ  
ને આટલો ટુકડો મને આપ.  
ઓમ એક આખોય તાકો  
કોઈએ ફેલાવી દીધો હશે  
મારી આગળ  
એમ આ નદી  
વહી જાય છે હરરોજ  
મારી આગળ.  
તેના વળાંકો પર રેશમી હું ઊભો છું  
ને જોયા કરું છું.  
એ મારી આંખોનો વિષય બની શકે છે  
પણ નથી બની શકતી  
એ મારા સ્પર્શનો વિષય.  
એ હું તને  
કેમ કરીને સમજાવું ?  
આપણી વચ્ચે અહિનિશ  
વધા કરે છે એક નદી....!  
હરરોજ, હરકષ્ણો  
તરસ્યા કરે છે માશસ.  
કેમ કરીને ઓળંગું એ જળરેખા ?  
હું તેના કમનીય વળાંકો પર ઊભો છું  
ને જોયા કરું છું  
કે હર ક્ષણો ખોયા કરું છું આ નદી ?

## મારે બધાની સાથે ખુલાસા... | ઈન્ફુ પુવાર

મારે બધાની સાથે ખુલાસા કરવા પડે એવા  
 સમયના - ફિનોમિનાને ગિલ્ટી-દંડાની રમતમાં  
 પરિવર્તિત કરી રહ્યો છું, વક્ત, રેટ, મૂઠ, નાર...  
 આ શર્જદી મારીકોશમાં શોધ્યા કેમ જડતા નથી વારુ ?  
 માણસની ગરિમાનાં પાટિયાં હાથમાં પકડી ઉભા રહેલા  
 સમયને સંતરાની ચીરી આપો જેથી એને ડહાપજાની દાઢ ફૂટે.  
 સ્વાદથી તરબતર, ડેસ્ટિનેશન વગર વાતા પવનને  
 પરિકમાનો ચમત્કાર કરવાનું સૂજે ત્યાં સુધી તમે બધા  
 સ્થાપિત કરો ગિલ્ટીને - દંડાને - રમતને - સંબંધને - હાથને  
 - હૈયાને ! ખુલાસા નામક વૃક્ષને જીલવા ઝૂલવા દી  
 ગાવા દી કોણ અં, કોણ અં એમ બોલે ! સાથે  
 ચાલનારા તમે બધા આરબનું ઊંટ થઈ કયાં ભાગી ગયા ?  
 સમયના - ફિનોમિનાને, ગિલ્ટી-દંડાને, અહકો દંડકો  
 દળી દુકોની રમત માંડી છે રાઈટ ? તમને લાગે કે  
 જોડાવું છે તો જોડાઈ જાવ નહીંતર, લાંબુડીનાં પાન  
 લીલાં કે પીણાં, નાનાં બાળકોની તારી મારી કીદા જેવું  
 આ બધા પર ભાષ્ય રચવાની પ્રેરણ મળતે તો ઠિક છે  
 નહીંતર દાવ કહો કે ભાત કહો માણસ છે ભરી માણસ  
 સમજ્યા તમે બધા તુધલખના તું ?  
 હું ખુલાસાને ભૂકહું છું, ધેંદસ ઈટ !

## બે તાંકા | પરાગ નિવેદી

(૧)	(૨)
ધોમ ધખતો	જાદુગરજી
તપ : વૃક્ષઘટયમાં	મેઘરાજાને કેવી-
કોયલરાશી.	મચાવી ધૂમ -
નીતરતા પાનેથી	ક્ષણમાં જ કરતા
ટહુકા, બીજે પથી.	ગિરિવરને ગુમ !

## વાર્તા

## ગંગા નાહ્યાનું પુષ્ટું

પ્રવીજાનીંહ ચાવડા

અમેરિકાએ ચંદ ઉપર માણસ મોકલ્યો તે આખી દુનિયાએ માન્યું પણ અમારા બળવંતકાકા એ વાત સાંભળીને ખૂબ કડવું હસ્તા. રેડિયો ઉપર સમાચાર સાંભળીને એકબીજાને વધાઈ આપતા અને દોડીને લેટા માણસોને જોઈને એ દુખી થઈ ગયા. બીજે દિવસે ધાપામાં ઝોટા આવ્યા ત્યારે એમકો એની તરફ જોવાનો પણ ઈનકાર કર્યો. ઝસિઓ સંદર્ભે બ્રાંંડમાં વિચરે તે સમજી શકાય, પણ મગતસું માણસ ? ચંદ, સૂર્ય તથા અન્ય આકાશી પદાર્થો વિશેની એમની સમજ પુરાણો ઉપર આધારિત હતી. સવારસાંજ મોટેભાગે એમની ઓસરીમાં એ બેઠેલા જોવા મળતા. પવાંઠીનું આસન સિદ્ધ કર્યું હોય અને સામે બાજાર ઉપર દળદાર ગ્રંથ પડ્યો હોય.

એમનું ઘર શેરીની વચ્ચે એવી વ્યૂહાત્મક રીતે ગોડવાયેલું હતું કે ઘેરઘેર ચાલતી નાનીમોટી પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવી હોય તો રહી શકે, પણ બળવંતકાકાની આંખો એવા કામ માટે નહોતી. થોડું વાંચતા અને વધારે વખત આંખો બંધ કરીને બેસી રહેતા. પુસ્તકો સિવાય આંખો બીજું કશું જોતી જ નહોતી એમ પણ કહી શકાય નહીં. દાખલા તરીકે શેરીની વચ્ચે રમતાં બાળકો. અમે સંસ્કૃતના શ્લોકો હોઈએ એમ એ અમારી ઉપર નજર ફેરબા કરતા.

એમને મારી ઉપર વિશેષ ડેત હતું એમ હું માનતો અને ક્યારેક બધાથી છૂટો પડીને એમની પાસે જઈને ઉભો રહેતો. કાકા જ્યારે સૃષ્ટિના સર્જનનું શિત્રાત્મક વર્ણન કરે ત્યારે મોઈંડાના અન્ય ઐલારીઓ પણ ધૂળભર્યા હાથ ચક્કી ઉપર લૂછાતા હાજર થઈ જતા. મેરુપર્વત, ક્ષીરસાગર, શેષનાગ અને જળપ્રલય વિશેનું શિક્ષણ અમને બળવંતકાકા પાસેથી મળેલું. નિશાળના શુષ્ક પાઠ ક્યાં અને મગજના કોષોમાં વિસ્ફોટ કરતી એમની વાતો ક્યાં ! ઉંઘતાંજાગતાં મારી ઉપર એની અસર રહેતી. આ લોક અને પરલોકની વચ્ચે વિનારોકટોક આવ-જ કરતા નારદમુનિ અણધાર્યા કદાચ મારી શેરીમાં ઉત્તરી પડે - એવા વિચારે રમતાં રમતાં હું આકાશ સામે જોઈ લેતો. કારણ વગર ગૃહત્યાગ કરી વનમાં જવાની અને તપ કરવાની લાલચ પણ મને થતી.

ચંદવિજયના બીજા દિવસે સ્ફૂર્લેથી છૂટીને હું ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે એક હાથ લાંબો થયો, ‘આવો, આવો.’

હું જઈને ઓટલા પાસે ઉભો રહ્યો.

‘આજે તો નિશાળમાં ખૂબ મજા આવી હશે.’

મેં કહું, ‘હોવે.’

‘માસ્તરો બધા ભેગ થઈ વિચારના રસડા લેતા હશે.’

‘સૂર્યમંડળના નકશામાં, કાકા –’

‘બધાનો માન્યું એટલે તેં પણ માન્યું ?’

બગવતમાં દફ્ટર દાખતાં મેં કહ્યું, ‘પણ કાકા, છાપામાં –’

‘છાપાવાળાઓને તો કોઈ ધ્યાન નથી. અને ઝોટા આવ્યા તેથી શું થયું? ઝોયમાં હોય તે બધું સાચું? આંખોને ઢેખાય તે હંમેશાં માની લેવાનું?’

એમની જેમ હું પણ, અલબાત નાના કદનો, પુસ્તકિયો કીડો હતો. ફેર એટલો કે સૂર્ય, ચંદ અને તારાઓ એમને માટે હિંદ્ય આત્માઓ હતા જ્યારે હું તો પરીકથાઓની સાથે સાથે વિજ્ઞાનાં વહેણ પણ વાંચતો. આમ, બે વિદ્વાનો વચ્ચે મતભેદ માટે અવકાશ હતો. તેમ છતાં, તે હિંદ્વસે એમના ચહેરા ઉપરનો વિષાદ જોઈને હું ચુપ રહ્યો. હું આટલો ડાઢો અને હોશિયાર, એમનો માનીતો, છતાં સામી ઠોળીમાં ભજી ગયો એનું એમને દુઃખ હતું.

બીતાં બીતાં હું માત્ર આટલું બોલ્યો, ‘તો પછી –’

‘એ બધું તમારા વિજ્ઞાનનું તરકટ.’

પરિણામે, બીજે જે હોય તે, અમેરિકાની સિદ્ધિ અમારી શેરી માટે ગૌણ બની ગઈ અને વિજ્ઞાનાં પવનચક્કાની સામે કટાયેલી તલવાર લઈને ઝૂઝ્યો વિદ્વાન સહુના આકર્ષણનું કેન્દ્ર બની ગયો.

થોડા હુકાનદાર, ચાર-પાંચ કારકુનો અને મોટા ભાગના ખેડૂતો – એવી અમારી વસ્તી હતી. ઉપર વર્ણવ્યા એવા અપવાદરૂપ પ્રસંગોને બાદ કરતાં એ સહુ બળવંતકાકાને ખૂબ માન આપતા. વાચને એમને થોડી વિચિત્રતાઓની સાથે બીજી પણ એક બેટ આપી હતી – સત્ય ઉપર અચળ શ્રદ્ધા. કૈટુંબિક વિવાદમાં કોઈ એમને તલવાટ તરીકે તેડવા જાય તો એ રોકડું કહેતા – આવું, પણ રકાબી ચાચે પીશા નહીં અને મને સાચું લાગે તે કહીશ. તને પરવરતું હોય તો લઈ જા. તું તેડવા આવ્યો એટલે એવું ના માની લેતો, ભાઈ, કે હું તારે પાટલે બેસી જઈશ.

કટોકટીના એકાદંબે પ્રસંગે મેં એમને આકાશ તરફ તર્જની કરીને ઘોષણા કરતા સાંભળ્યા હતા – સત્ય! અસત્યની ગદ્ધીની તાકાત છે કે સત્યની સામે ઊભું રહી શકે? સત્યમાં તો હજાર સૂર્યનું તેજ છે. આ શાબ્દો સંભળીને મારી આંખો અંજાઈ જતી અને મગજને વીધીને વીજળીનો પ્રવાહ નીકળી ગયો હોય એવું લાગતું. એટલા તાદૃશ વર્ણન પછી પણ સત્યના ભૌતિક સ્વરૂપનું દર્શન તો હું કરી શક્યો નહીં પરંતુ પૂછ્યો દબાવીને ભાગતા, રૂંછાવાળા ઊભકા આવે એવી ગંધ હોડતા પ્રાણી તરીકે અસત્ય મને સ્પષ્ટ રીતે દેખાયું.

S

સુખાસનમાં બેસીને ગ્રંથના અક્ષરો વીણતા માણસનું દશ્ય શુષ્ણ લાગે તો પ્રેક્ષકોનો કંટાળો દૂર કરવા માટે બારણું પછાડીને ક્યારેક પ્રભાકારી ઓસરીમાં આવતાં અને હાથ લાંબા કરી, શરીરને ખૂબ ડોલાવી, હાસ્ય અને રૂદનની વિવિધ છટાઓ બતાવી પાછાં ઘરમાં ચાલ્યા જતાં. ઊંચી વિજ્ઞાન ઓસરી તે સ્ટેજ. પ્રેક્ષકો શેરીની વચ્ચે હરતાફરતા. ખુરશીમાં બંધાઈ જવાની કે સમય બગાડવાની જરૂર નહીં. પોતપોતાને ઘેરથી પસંદગીનાં દશ્યો જોઈ લેવાની અને મહત્વના સંવાદો સંભળી લેવાની અનુકૂળતા.

ગ્રોફ પુરુષ અને જીવાન પત્નીએ તો દેશી નાટકના ફારસની અમર જોડી. અમારાં

જૂનાં કાકીના મરણ પછી કાકા નવાંને લાવ્યા હતા. એકાદંબે મર્યાદાઓની વાત કરતાં પહેલાં એ સ્પષ્ટતા કરવી જોઈએ કે તુપની શોભા વધારે એવાં પ્રભાકાકીનાં વાણીવર્તન હતાં. સાજેમાંદે પોશામાં કોઈને પણ વેર એ વગરબોલાવ્યે જઈને ઊભાં રહેતાં. નાનામોટાની મર્યાદા રાખતાં. મોટા ઘરનો મોભો, છતાં સાવ હળવાં અને સદયે હસતાં. અમે રમતા હોઈએ ત્યાંથી નિકળે તો તાળી પારીને ફૂદ્યીયે ફરી લે. બળવંતકાકા પ્રતિષ્ઠિત માણસ. એમને મળવા આવનારા પણ ઘણા. એવા પ્રસંગે સરભરામાં ઊણપ રહેતી નહીં. સમાનધર્મીઓ વચ્ચે મોડી ચાત સુધી સત્સંગ ચાલે ત્યારે થોડા થોડા સમયે ચા-પાણી આવ્યા કરતાં.

સહધર્મચારિણીનું આ એક સ્વરૂપ હતું. બીજું બહુ ઓફી વાર, પણ જોવા મળતું ખરું. કાકા ઊંઘું ઘાલીને વાંચતા હોય કે સૂક્ષ્મ રહસ્યોના આકારો ઉપસાવવા જમણા હાથની તર્જની વેર હવામાં લીલીઓ દોરતા હોય ત્યાં કાકી આવીને ઊભાં રહે અને કમરે બે હાથ ગોઠવી ચુપચાપ જોયા કરે. પછી અક્ષર પણ બોલ્યા વગર પગથી હડસેલો મારે અને વિષ્ણુપુરાશ કે શિવપુરાશ શેરીની વચ્ચે જઈને પડે.

ગ્રંથ ખસી જવાને કારણે રચાયેલા અવકાશ ઉપર આંખો માંડીને બળવંતકાકા બેસી રહેતા.

પછી મોં ઊંઘું કરીને હળવેથી પૂછ્યતા, ‘તમે આમ કેમ કરો છો ?’

‘આખો દા’ડો વેર ચોંટી રહો છો માટે.’

‘તો કંયા જાઉં, શું કરું ?’

‘મલકમાં ફારે ત્યાં જાઓ, કાંક કામ કરો, એ ના કરવું હોય તો બાવા થઈ જાઓ, પણ અહીંથી ટળો.’

બાધામાં મર્યાદા રહેતી નહીં અને કાકા માટે ક્યારેક તુંકારો નિકળી જતો. જોનારાં સહુ શરમનાં માર્યા ઘરમાં પેરી જતાં. ધીમે ધીમે ક્ષોભ ઓછો થયો તે બળવંતકાકાને કારણે. પત્નીના આવા વર્તનને એ હસી કાઢતા. એમને હસતા જોઈને પ્રેક્ષકો સમજ્યા કે બીજાં તત્ત્વો ગાળી નાખી દશ્યને શુદ્ધ શરસ તરીકે પણ જોઈ શકાય.

S

થોડે દૂર સ્થાપવામાં આવેલી સ્ટેજની એક શાખામાં ભજવાતા નાટકને શરસ ગણી હસી કાઢવાનું શક્ય નહોતું.

ત્યાં પંડુપંડુ થતા ધાપરા નીચે સૂરજમા રહેતાં. પ્રભાકાકીના આગમન પછી નવો વહીવટ ગોઠવાયો એમાં એમને જુદાં કાઢી સ્વતંત્રતા આપવામાં આવી હતી. ધીમેધીમે સંકોચાઈને સાંકડી થની શેરીના ખૂઝે આવેલા એ ઘર વિશે અને એના સંચાલન વિશે મને ખૂબ જિજ્ઞાસા રહેતી. તૂંઠી ખાટલીમાં પડી રહેતી અને ધૂજીતા હાથે રોટલા કૂટતી ઔંશી વર્ષની તોશીનો વિચાર મેરુપર્વત અને ક્ષીરસાગરમાંથી ચિત્તને ચલિત કરી દે તેવો હતો. એ ઘર તરફ જોવાનો બળવંતકાકાને પ્રતિબંધ હતો પણ પ્રભાકાકીએ પોતાને માટે એવાં બંધન સ્વીકાર્યો નહોતાં. અઠવાડિયે – પંદર હિંદ્વસે એ ત્યાં પહોંચી જતાં અને નિરાંતે, મનમાં આવી એવી ગાળો સાસુને સંભળવીને પાછાં આવતાં.

મારી વિચિત્રતાઓ એવી નહોતી. પુત્રના જ્ઞાનમાં હતો એટલો જ રસ મને વૃદ્ધાની

એકલતામાં હતો તેથી એ ઘેર પણ ક્યારેક જઈ ચડતો. મારી આવી નીતિને કારણે ટીકાકારો મને અડુક્યો-દડુક્યો કહેતા. દસકાઓથી બંધ પડી રહેલા એ ખંડેરને માજુ ખૂબ ચોખ્યું રાખતાં. આંખે ઝાંખું દેખાય, હતાં જ્યારે જોઉં ત્યારે આપટાં હોય કે લીંપણ ઉપર સાવરણીનું હુંકું ઘસતાં હોય. મારે બીજું કોઈ કામ નહીં તેથી એમની તૂટેલી ઢોઈણી ઉપર બેઠો બેઠો ડાફિરિયાં મારતો અને ગણતો - પિતાની એક થાળી, તાંબાની ગાગર અને ઓલ્યુમિનિયમની ગોબાળી બે તેપેલીઓ : આટાં વાસણ ઘાતુનાં અને બાડીનાં મારીનાં. વીજણીનું દોરદું એ ખૂણા સુધી પહોંચ્યું નહોંતું તેથી કાચના ખડિયામાં દોરીનો કકડો ગોડવી પ્રકાશ મેળવવાની જુગતી રચવામાં આવી હતી.

આ સિવાય પણ એ ઘેર મને બીજું ઘણું જોવા મળતું, એક દિશા બંધ થઈ તો બીજુ અનેક દિશાઓમાંથી સરવાણીઓ વહેતી આવતી. પુરુષો ભવે બળવંતકાળી જેમ બીતા હોય, શેરીની અમૃક સ્ત્રીઓ કોઈની સાડાબારી રાખે એવી નહોતી. ગરબો લીધો હોય એમ બેડાના ભાર નીચે ડોલતી કોઈ પનિખારી સવારે સવારે સૂરજમાના આંગણામાં જઈને ટહુકો કરતી - ચા પીધો, માડી ! હાથ નવરા હોય તો જરીક લાવજો તમારું માટલું. દ્વિવાળી દુકડી આવે અને ઘેરઘેર તૈયારી ચાલતી હોય ત્યારે કોઈ છોડીને એની મા મોકલતી - આટાં છાણમારી વધ્યાં છે તે જા, સૂરજમાના ઘેર લીંપણ કરી આવ. બાર મહિને મણ ઘણું અને મરચ્યું-હળદર એવું સીધું બાંધિલા ધોરણે પુત્ર તરફથી મળતું હશે, પણ તેથી કંઈ ચાલે ? ડોશીને તો દાંતે ઘસવા છીંકણી જોઈએ. વાંધો નહીં, એની ચિંતા કરનારાં પણ હતાં. કોઈ નિશાળ્યો ચહીના જિસ્સામાં સંતાડીને છીંકણીનો પડો મૂકી આવતો - મારી બા કે', જા, આલી આય.

છોકરું રમતુરમતું ઘરયાં આવ્યું. એને કંક આપવું જોઈએ એમ માનીને સૂરજમા મને થોડો ગોળ આપતાં. જાઓ બેટા. કાળો લૂગદી જેવો ગોળ હું ચોકલેટની જેમ ચગળતો. માટલું પાણી આપવા કોઈ આવે કે નાનુંમોદું ટાંપું કરી જાય, પણ કામ વગર જઈને બેસનારું મારા જેવું બીજું કોણ નવરું હોય ? મને જોઈને ડોશી ખૂબ હરભાતાં. પુત્ર અને પુત્રવધૂના જાસૂસ તરીકે એ મને નહીં જોતાં હોય ! વહાલમાં બહુવચન નીકળો. તમારાથી નીચે નોં બેસાય. ઢોઈણી ઉપર બેસો, ભર્ય. છોકરાનું મહું ગાંધું કરાયું; હવે એને રમવા શું આપવું ? કંક કરું, કંક કરું એમ થાય. તેવા સમયે તાંબાની ગાગર નીકળતી. એના સાંકડા મોઢામાં હાથ નાખીને સૂરજમા કરીકરી કાઢતાં - લાલકણા દોરાઓનાં ગૂંચળાં, તૂટેલાં બટન, ચાણોટીઓ, લાખની બંગડીઓના કકડા, કશાકનાં બી, માદળિયાં, હરણનું શીગરું -

ઘર વચ્ચે જાહુની આવી ઢગતી કરી સૂરજમા મને કહેતાં - તમારે જોઈનું હોય તે લઈ જાઓ, ભર્ય. રમજો.

અને વાતો, કિસ્તેર વર્ષ પહેલાંના એમના બાળપણની વાતો. અમારું ગોંમ તો ભઈ મુખઈનું બચ્યું. શેઠિયા દરિયાપાર વસેલા એમની કેવીકેવી હવેલીઓ ! જોરાવર પિતા અને બળિયા કાકાઓ. એક કાકાની પ્રવૃત્તિઓ કેવી હશે તે સ્પષ્ટ નહીં થયેલું પણ એ પોલીસની ગોળીથી વાંચાઈને મરેલા. અજવાળી રાતોમાં ગોઠણોની સાથે ગવાયેલાં ગણણાં. બીક લાગે એવા ધૂજતા સ્વરે ડોશી એ ગાણાં ગાતાં. સમાપન અનિવાર્ય રીતે યુદ્ધથી થતું - ગાયકવાડ કેવો ઝોજ લઈને આવ્યો, તોપો કયાં ગોડવી અને ગામને કેવી રીતે ફૂટી બાંધ્યું. એટલા

મોટા વિનાશનો સાર બે જ શબ્દોમાં - ફૂટી બાંધ્યું !

મને થતું - ઘાઘરીપોલહું પહેરેલી આ છોકરી વેરણછેરણ લાશોની વચ્ચે ઊભીઓભી રે છે, એને હાથ જાલીને બેંચી લઇ -

પિયરથી કદાચ ઓછું, સૂરજમાને સાસરીનું ગૌરવ પણ હતું. મૃત સસરા અને જેઠની વાત કરતાં ડોશી સાલ્વાનો ફાટેલો છેડો બેંચીને કપાળ ફાંકતાં. નોકરોની ઝોજ હતી.. સસરા જીરું-વરિયાળી અને રૂનો વેપાર કરતા. બજારમાં અડધોઅધ હુકાનો અને વખારોની માલિકી એમની હતી.. નાની ઉમરે વિધવા થયાં હતાં, પટિની સ્મૃતિઓ હશે જ, પણ જીવનનો એ પવિત્ર ખંડ ક્યારેય ઉઘાડવામાં આવતો નહીં.

રહ્યો પુત્ર. એથી વધારે વાતો થતી નહીં. કોઈ વાર નામ લીધા વગર માત્ર આટલું કહેતાં - મોટા ગનાની છે. આખા મલકની ચોપડીઓ વાંચી છે.

ફરિયાદ ગણો તો આટલી.

અક્ષિયન ડોશીના ઘરનું આંગણું ક્યારેક સંગીતથી છલકાઈ જતું. કોઈ આંધળો ગાયક કે ભરથરી આખા ગામમાં ભટકીને છેવટે બપોરના તડકામાં એ ઘરનાં નેવાં નીચે જઈને બેસતો. ડોશીને એક મૂંજવણ - મારા ઘરમાં તો કશું નથી. તને શું આંધું, ભર્ય ? પણ એક કામ કર; થોડી વાર બેસ. તને એક રોટલો ઘડી દઉં. ક્યાંકથી સાયણું માગી લાવીશ. અંદર રોટલા ઘડાય છે, બપોરની સ્તરભાતામાં યાચક એના રાવણહથ્થાને રમાડતો બેઠો છે. એ સ્વરૂપમાં સૂરજમાના આંગણે ન જોયા હોત તો ભરથરી મારા મનમાં આટલા ન વસ્યા હોત. એને બિખારી તરીકે સ્વીકારવાનું અધરું હતું. એકલો એકલો વાદ ઉપર હળવો હાથ ફેરવે અને ગાય - કાયા ને કાયની પૂતળી, વણજારા ! મોટેથી ગાવાની જરૂર નહોતી કરાણ કે કોઈને રીજવવાનું નહોંતું. એનો ટંક તો ઉકલી ગયો હતો. તેથી, તે માત્ર પોતાને માટે જ ગાતો હોય એવું લાગતું. રૂપાળો જુવાન, માગેલા પણ ધોઈને સ્વચ્છ રાખેલાં ધોતિયું અને પહેરણ, ખલે ખેસ, માથે સફાઈદાર ભગવો સાઝી, પાતળી મૂછ, એવી જ પાતળી પણ બેજવાળી આંખો અને સ્વરમાં સો પેઢીઓથી ઝીમીઝીમિને એકદું થયેલું આજર્વ.

મારીના છાલિયામાં રોટલો-કઠી ખાઈ, ચણું કરી ભરથરી બેંચી ધારે પાણી પીએ ત્યારે મને ઘરવ શબ્દનો અર્થ સમજાતો.

S

કોઈ પાણીનો ઘરો આપી જાય, કોઈ ગાળો ભાંડી આવે; એક બેંદુબેંદું ચોપડી વાંચે અને બીજું ટૂટેલી ખાલીમાં હીચતાં બાળપણનાં ગીતો ગાય - આ રમત લાંબું ચાલે તો કંટાળજનક બની જાય. એમાં વિકાસ જરૂરી હતો અને તે સૂરજમાએ કરી બતાવ્યો. રોટલા ઘડતા અને સંજવારી ફેરવતા હાથ ધીમેધીમે મંદ પડી ગયા અને એક દિવસે ડોશીએ ખાલો પકડ્યો.

આ માંદગીનો અર્થ સ્પષ્ટ હતો. ઠોકર વાળી, પડચાં અને ટપુ જીવ નીકળી ગયો - એ રીતે અંત આવી શક્યો હોત, પણ એવું ન બન્યું. વિધાતાએ ડોશીને એક રમત કરવાની તક આપી. ડોશીએ મૃત્યુનો એક કોયડા તરીકે ઉપયોગ કર્યો - મેં પાસો ફેંક્યો; હવે જોઉં, સામેવાળાં કેવી ચાલ ચાલે છે ! પડોશીઓ સર્તક બની બંને ઘર તરફ વારાફરી જોવા લાગ્યાં. હવે શું થશે ? પેલાં લોકો શું કરશે ? બે-ત્રણ દિવસ પછી ડોશીના ઊહકારા

વધ્યા. એ સ્પષ્ટ થઈ ગયું કે ડોશીની ચતુરાઈ ચાલવાની નથી, પેદે ઘેરથી કોઈ એનો ચાકરી માટે જવાનું નથી.

અને અમારી શેરીમાં નવી હવાનો સંચાર થયો. બોલવાનું ઓછું થઈ ગયું અને આંખો એકબીજાના ચહેરાને પ્રશ્નોથી તપાસવા લાગી. શેરીનો મધ્યયુગી આત્મા સણવળી રહ્યો હતો. એમાં, ચોથા દિવસે ભરબપોરે એક સ્ત્રી ફડક્ક કરતી નીકળી. પોતાના ઘરના બારણા બહાર ઊભી રહી એ મોટેથી બોલી – મને ફંસીએ ચડાવવી હોય તો ચડાવી ઢેઝો, પણ ડોશીને એકલી મરવા દેવાય નહીં. ઓઝે જઈને માખીઓ ઉડાડી અને ચાંગળું પાણી હોઈ વચ્ચે રેકચું.

પછી તો કોઈ રાબ લઈને આવ્યું, કોઈએ લૂગડાં બદલાવ્યાં. ધીનો દીવો કર્યો. સ્ત્રીઓ-એ એમનું સ્થાન સંભાળી લીધું. પછી રહ્યા પુરુષો. એમનામાં ગુસ્પાસ થઈ, ઈશારા થયા.

એક વડીલે કહ્યું, ગાડીભાડાના પૈસા હું આવ્યું.

એક મોટિયાર હડક્ક દઈને ઊભો થયો, કે'તા હો તો હું ઉપડું.

બંડીના જિસ્સામાં દસની નોટ પડી એ સાથે મોટિયારના પગમાં ગરમી આવી. રાતના અંધારામાં એ નીકળ્યો. ટ્રેન અને બસનો જમાનો આવી ગયો હતો પણ ગામની બહાર નીકળ્યા પછી કદાચ એને વિચાર આવ્યો હશે કે અમનું ગાડીભાડું શું કરવા બગાડવું, આટલામાં તો મારાં છોકરાની દિવાળી થાય, તેથી અડવાણે પગે નદીનાળાં વટાવતો, કાંટા ભાગતો, અનિવાર્ય હશે ત્યાં મગરની પીઠ ઉપર ચરીને કે સિંહની સવારી કરીને એ દુગરોની પેલી તરફ પહોંચ્યો અને બીજી રાતે તો કમુજોઈને તેડીને પાછો આવી ગયો. સંતાતાં, શરીરને સંક્રિતાં કમુજોઈ ખૂબણાના ઘરમાં પેસી ગયાં અને પાંગથે બેસી માનાં સૂકાં હાડકાં ઉપર હાથ ફેરવવા લાગ્યાં.

આ રીતે, શેરીનાં માણસો તો ખડે પગે હાજર હતાં જ પણ ચાકરી કરનારું ડોશીનું પોતાનું માણસ આવી ગયું, અંશી વર્ષની મા અને બાસાઈ વર્ષની દીકરી. બનેને નાની ઉમરે રંડાપો આવેલો, બને સુકાઈને બંઠ થઈ ગયેલી, એકેના મોઢામાં દાંત નહીં અને છતાં, પછીના દિવસોમાં એ ઘરમાં જે બન્યું તેનું વર્ષની કરવા માટે બે શબ્દોનો ઉપયોગ તો કરવો જ પડે – ઉલ્લાસ અને હાસ્ય.

ખૂબ કોતુકો થયાં. ચાકરી કરનાર આવી ગયું પછી ડોશી મરવાની ઉત્તાવળ શું કામ કરે ? એમના ગાલની કરચલીઓ છલકાઈ ગઈ. આ જોણું જોઈને સહૃદ દાંત કાઢવા લાગ્યાં – માર્દીકરી તો જુઓ ! મૂર્છાની વાતો જ ખૂટી નથી અને લૂણી વાતોથી જ ચલાવી લેતાં હતાં એવું નહોતું, મંગળ પ્રસંગ હતો. સંગીત વગર ચાલે ? તેથી, મોડી રાતે ગામ જંપી જાય પછી એ ઘરમાંથી ગાણાં સંભળાતાં. સૂરજમા ગાય અને કમુજોઈ એમાં મંદ સૂર પુરાવે. અમારા પ્રદેશમાં ક્યારેય નહીં સંભળાયેલા એવા એ રાગ હતા. અંધા કરતાં વધારે શબ્દો અજાણ્યા હતા. પડોશીઓ એ સાંભળતાં સાંભળતાં ઊંઘી જતાં.

આમ બધું થાળે પડી ગયું પણ એક નાનો પ્રશ્ન રહ્યો. માને મળવા સામે હતો તેવો જ પ્રતિબધ પરદેશથી આવેલી વિધવા બહેનને મળવા સામે પણ હોય જ, કારણ કે એ દુશ્મનની છાવડીમાં જઈને બેઠી હતી. મહાભારત સમયના જુનવાણી ઔદ્યાર્યની અપેક્ષા આજે રાખવી એમાં નરી મૂર્ખાઈ છે –

અને છતાં,

અને છતાં મને થતું કે મુલાકાતો તો થતી જ હશે, અને કોઈ રોકી શકે નહીં. માત્ર જરીક કલ્યાનાં ઉપયોગ કરવો પડે.

મને દેખાતું :

મધ્યરાત પછીનું અંધારું છે. એમાં એક માણસ એના ઓટલા ઉપર બેઠો છે. સામે, રસ્તાની બીજી બાજુ પાતળી સળી જેવી એક સ્ત્રી ઊભી છે. વૈધવ્યનો રાતો કસુંબી સાલ્લો એઝો ખેંચીને શરીરે માથે દાખ્યો છે. એક છેડો દાંતની વચ્ચે છે. બે બાજુ ઊંચે હાથ પ્રસારી, સામેના માણસ તરફ હવા મારફતે કંઈક મોકલતી, એ હોઠ ફક્કાવે છે – બર્થ, તમારું શરીર હારું છે ને ?

પેલા પાસે તો સ્વગત બોલવા માટે પણ શબ્દો નથી. માત્ર છાતી આગળ હાથ જોડી એ ટાર બેસી રહે છે.

S

કિશોરનું ધ્યાન રમતમાં ટકી ન શકે એવી સ્થિતિ હતી. મૃત્યુનો ઉત્સવ મંડાયો હતો, ડોશી પોતે જ પોતાને હાલરડાં સંભળાવતા વિદાય લઈ રહ્યાં હતાં. સહૃદ પોતપોતાની જગ્યાએ પોતપોતાની રીતે સુખી હતું. દુંખી થવા માટે કારણ નહોતું. તેમ છતાં, એના આંગણામાં હઠથી બેસી રહેતા એક માણસનો વિચાર મને આવતો.

એક બપોરે, કોઈ જોતું નથી એની ખાતરી કરી હું બળવંતકાકાના ઓટલે જઈને ઊભો રહ્યો.

મેં કહ્યું, ‘કાકા.’

‘બોલો, ભાઈ.’

મેં કહ્યું, ‘સૂરજમા.’

આંખો ઉઘાડ્યા વગર એમણે કહ્યું, ‘હા, સૂરજમા.’

‘અને કમુજોઈ.’

‘હા, ભાઈ, કમુજોઈ.’

મેં બોલી નાખ્યું, ‘ઝીઈએ માની ખૂબ ચાકરી કરી, કાકા.’

હું જઈને ઊભો રહ્યો ત્યારે એમણે હાથ માર ખલે મૂક્યો હતો. હવે એ હાથ ધીમેધીમે મારા વાંસે ફરવા લાગ્યો. શબ્દોથી આટલું જ બોલ્યા, ‘ઝીઈને તો ગંગા નાદ્યાનું પુષ્ય મળશે, ભાઈ.’

સાંજ પડી હતી. અંધારું થયું હતું. શેરીનો વિશાળ ચોક ખાતી હતો. બળવંતકાકા આંખો બંધ કરીને બેઠા હતા. પુસ્તક સામે પડ્યું હતું. હમણાં હમણાં એમનું વાચન આ રીતે ચાલતું. હું એમણી સામે જોઈ રહ્યો. પાપ-પુષ્યના નિયમો અને પેટાનિયમોની સમજ આજે નથી તો. એ ઉમરે કયાંથી હોય ? વળી ગંગાનાં પાણીના ગુણધર્મો વિશે હું કેટલું જાણું ? છતાં મને એટલો વિચાર આવ્યો કે એ પક્ષપાત તો નહીં જ કરે. કમુજોઈને એ ધન્ય દૂબકીઓ ખવડાવશે પણ સાથેસાથે, કિનારાથી દૂર એકલા બેસી રહેતા માણસને એ સાવ કોરો તો નહીં જ રાખે.

r

મનજીત પંદર વર્ષથી શ્યામલાલ અને મનોરમાનો વિચાસુ શ્રાઈવર હતો. પતિપત્તી કારમાં ઘણી અંગત વાતો કરતાં, એટલે ઘણુંબધું એ જાણતો હતો. પણ અહીંનું તહીં કરવાની એનામાં ટેવ નહોતી.

શ્યામલાલની એક બહુ અંગત વાત પણ એ જાણતો હતો. શ્યામલાલ અવારનવાર કોઈની મુલાકાત લેતા. એક વાર શ્યામલાલ એ સ્ત્રીને એક ડોક્ટર પાસે લઈ ગયા હતા. એટલે કોઈ સ્ત્રી સાથે આડસંબંધ હોવાની એને ખાતરી થઈ હતી. મોટા લોકોનાં મોટાં રહસ્યો એમ માની આંખ આડા કાન કરતો. બેચાર વાર મનજીત સાથે એકલા દવાખાને જવાનું થતાં નિરૂપમાનો પરિચય થયો. મનોરમા એ રહસ્ય જાણે તો ઘરમાં મહાભારત સર્જવાની અને પોતાની કાયમી આવક જતી રહેવાની બીકને કારણે મનજીતને ચૂપ રહેવા દર મહિને એને બસો રૂપિયા આપવાનું નક્કી કર્યું.

એક વાર મનજીત એના દીકરાના ઓપરેશન માટે શ્યામલાલ પાસે વીસ હજાર રૂપિયાની લોન માળી. શ્યામલાલે ગુસ્સે થઈને કહ્યું, “એટલી મોટી રકમ તું આ જન્મે તો પરત નહિ કરી શકે. સોરી, બેપાંચ હોય તો જુદી વાત.”

“શેઠજી, મારા દીકરાની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોક્ટરને સાત દિવસમાં પૈસા ચૂકવવાના છે.”

“સોરી, હું તને મદદ નહિ કરી શકું.”

મનજીત સિંતમાં વ્યગ્ર હતો. એને નિરૂપમા વાદ આવતાં નિરૂપમા પાસે જઈ આજીજ કરી.

“જો શ્યામલાલ સાથેના અમારા સંબંધની વાત તું કદ્દી કોઈને ન કરે તો હું તને મદદ કરીશ. પણ માસિક બથ્યું બંધ.”

“તમે મને મદદ કરતાં હો તો મને એ મંજૂર છે.” કહેતાં એને નમી પડ્યો.

“તારા ડોક્ટરનું નામ-સરનામું આપ. બે દિવસ પછી મને મળજો.”

મનજીતે સરનામું આયું.

બીજે દિવસે નિરૂપમા ડોક્ટરને મળવા ગઈ. એની ચાલાક આંખો ડોક્ટરના આંતર મનને પારખી ગઈ. એણે ડોક્ટરને એની જાળમાં ફસાવ્યા. દર મહિને મળવાનું વચન આપી મનજીતના દીકરાના ઓપરેશન માટે બાંધી લીધા.

બીજે દિવસે મનજીત મળવા આવ્યો ત્યારે કહ્યું, “તારું કામ પતી ગયું. આવતા સોમવારે ડોક્ટર ઓપરેશન કરશે.”

“તમે પૈસા આપી દેશો ને?” મનજીતે ભોળાભાવે પૂછ્યું.

“એ તારે નહિ જોવાનું. તારું કામ પતી જશે. તારું વચન પાળજો.”

મનજીત નિરૂપમાની વાત સમજ ગયો. એની એક મહાત્વની મૂડીનો વિચાર કરતો એના દીકરાની ખુશીમાં ગરકાવ થઈ ગયો.

ધર્મ : કાળમાં વિલીન થયો છે કુરુક્ષેત્રનો રોદનધ્વનિ, યુધિષ્ઠિરના રાજ્યાભિષેકનો વિજયધ્વનિ.

કુરુક્ષેત્રનો નાશ જોઈ પોઢ્યા છે ભીખ.

યોગમાં લીન થઈ વિદુરે યુધિષ્ઠિરમાં વિસર્જિત કર્યા છે પોતાના પ્રાણ;

અરણ્ય હૃતાશનમાં ચિત્તાંશે ચડ્યા છે ધૃતરાષ્ટ, ગંધારી અને કુતી,

વૃષિષ્ણુણનો થયો છે વિનાશ,

ચાગરતટની કીડારસ્થલી બની યાદવોની મૃત્યુસ્થલી,

પ્રભાસસૈત્રમાં લીલા સંકેતી છે કૃષ્ણે,

બલરામ સમાયા છે શેષનાગમાં.

કાળને વશવર્તો છે વૃષિષ્ણવંશ, ગંધાર, પૌંડ્ર, અંધક, મગધ, ચેદિ કે કુરુક્ષેત્ર કીટ હી વા કુંજર, કાળની સર્વને લાગે છે આળ.

હસ્તિનાપુરના સિંહસન પર આરુઢ યુધિષ્ઠિરને નથી ચેન

છાતી પરની વિજય વરમાણ કોરી રહી છે છાતીમાં

સાજ સુંદર શ્રીલીન કરી મરે ?

કાળની ગતિ જાડી ધર્મમતિ યુધિષ્ઠિરે મહાપ્રસ્થાનનો કર્યો છે સંકલ્પ  
અંતિમ પ્રયાણ

અંતિમ પ્રસ્થાન – નવા આરંભનું.

ગૃહાણિ, યજ્ઞાણિ સાથે કીધાણિ, ઈર્ષાણિ ઠારીને આવ્યા છે યુધિષ્ઠિર  
ધારણ કરી વલ્કલ

ચાલી નીકળ્યા છે પંચતાપસો અને એક તાપસી  
તપથી દીપ્ત તાપસો.

ધર્મભોકની કોઈ આકંશા વગર પાછળ પાછળ ચાલી આવે છે એક ચાન  
ક્યારનુંય ક્ષિતિજ પાર છોડ્યું છે હસ્તિનાપુર

દૂરસુદૂર દાયિમાંથી વિલીન થયા છે જનપદો

સંભળાતા નથી માનવકુળના કેલિકોલાહલો, ધેનુઓના હંભારવો

ધીમે ધીમે હવે આણું થતું જાય છે અરણ્ય

દાયિપથ પર દેખાતા નથી હવે દેવદૂમ દેવદાર

સંભળાતા નથી ઘાસના નાજુક ચાસ.

હવે તો બસ હિમ, હિમ જ હિમ – શાશ્વત હિમ.

છૂટ્યું છે બધું જ

નથી છૂટ્યું તો કેવળ કુરુક્ષેત્ર.

વિજય પછીય હંકાવતું

પાંડવો અને પાંચાલી ભીતર રહેલું કુરુક્ષેત્ર – અફાટ રણક્ષેત્ર.

(પદ્ધતિનો અવાજ)

યુધિષ્ઠિર : ચાલ દ્રૌપદી ચાલ

અમારી સાથે ભમણ કરતાં જનેવને ગ્રામનગરે તારા દેહ પર નથી જો મેં કલાંતિ દૂર નથી હવે અંતિમ વિશ્રાંતિ

ચાલ ઉઠ દ્રૌપદી, લાવ તારો હાથ

દ્રૌપદી : ના, મહારાજ

આ પથ પર તો પોતે જ કરવો રહ્યો પ્રવાસ

રક્તના આવેગમાં ફ્લાંગી ગઈ હું અટવિ અને ભવાટવિ

અંતિમ પથ પર હવે સંચિત થઈ છે કલાંતિ

યુધિષ્ઠિર : 'મહારાજ' કહી ઉપહાસ ન કરો દ્રૌપદી

સુવર્ણસિંહાસન, રાજદંડ, રાજમુકૃત અને રાજ્ય સાથે છોડ્યું છે બધું જ

સહસા કોઈ બોધનક્ષણો બરી ગયું છે એ સંબોધન

હવે હું ન આર્થપુત્ર, કે તું આર્યા કે ભાર્યા

આપણે સહુ તો મુક્તિપથના પ્રવાસી

દ્રૌપદી : નહીં ચાલી શકાય હવે. સુખેથી સિધાવો સહુ.

(ધરણી પર ઢળી પડતી દ્રૌપદી)

ભીમ : ધર્માત્મા ! આ મોક્ષમાર્ગમાં પતિપરાયણ દ્રૌપદી કેમ લથડી પડી ? શો છે તેનો દોષ ?

યુધિષ્ઠિર : જીવનભર ગુપ્તિ રાખ્યો જે પ્રણ – આપણે સહિયારો મર્મ

આજે કરુ છું ઉજાગર

પાંચાલી પાંચ પાંડવોની ભલે હો ભાર્યા

પણ અંતરતમથી વિશેષ પ્રેમ કર્યો અર્જુનને

તે જ તેનો દોષ.

દ્રૌપદી : અંતિમ કાળે / અંતકાળે ઉપાલંબ ન આપો મહારાજ.

(સ્વગત) હા,

અર્જુનને મેં પ્રેમ કર્યો વિશેષ.

મત્સ્યવેધ કરી અર્જુને જીતી મને

પણ જીવનભર જીતી ન શકી અર્જુનને.

વિદ્ધ મત્સ્ય જેમ તરફાતી રહી સતત.

અર્જુનને મેં પ્રેમ કર્યો વિશેષ.

પણ એ કયાં મારો રહ્યો શેષ ?

તે તો વહેચાયો સુભદ્રા, ઉલુપિ, ચિત્રાંગદામાં,

ને રહેસાઈ હું.

પણ ના,

તે તો કદાચ રહ્યો કેવળ કૃષ્ણનો

કેવળ કૃષ્ણનો

દુપદનંદિનિ, પાંચાલી કુરુકુલસામાજી

હું આજે ફરી નાથવતિ અનાથવત.

નિષ્ઠુર કૂર ઠંડો પવન દંશો છે મારા અંગને, ખેંચે છે મારા વલ્કલ

પણ હવે કોઈ નથી લજજા

હિમે સજાની છે મારી સજજા

યાશસેની હું દ્રૌપદી

વળુનિ શિખાની જેમ સળગતી રહી અહર્નિશ

ક્યારેક પ્રજળી

ક્યારેક કજળી

જવાલામુખી જેમ રહી હુંકારતી

ક્યારેક ધૂધવાઈ

ક્યારેક ભભૂકી સળગી

તો ક્યારેક સળગાવ્યું.

મારી આગને ક્યારેક તેં ઠારી ભીમ

આજે ઠારશે આ હિમ.

સ્વર્ગને દ્વાર ભલે જાવ ધર્મરાજ, ભીમ, પાર્થ નકુલ ને સહદેવ

હું તો ઠરીશ આ હિમમાં

હિમ !

આજે ઠાર તું આ યજાવેદિશા યાશસેનીના દેહને

ઠાર તું જવાલામુખીશા મારા ચિત્તને.

(પાંડવોનું પ્રયાણ. સહસા સહદેવના પડવાનો અવાજ,

ભીમ : બાતા યુધિષ્ઠિર ! સહૈવ શુશ્રારત અહંકારરહિત

માદ્રાનંદન સહદેવનું પતન કયા દોષથી થયું ?

યુધિષ્ઠિર : બાતા ભીમ ! સહદેવને અહંકાર હતો તેની બુદ્ધિનો

ત્રિકણવ્યાપ્ત તેના શાનનો.

સહદેવ : જાઓ, સર્વે સુખેથી સિધાવો સર્વો

(સ્વગત) ઉચ્ચિષ્ઠ જેમ પરી રહેવા દો મને

ત્રિકણજ્ઞાન એ શું વરદાન ?

વરદાન સાથે જ કોઈ પરોવી ગયું છે શાપ.

ભોગવાયેલું ભોગાવ્યું

જિવાયેલું જબ્યો

મરણ પહેલાં ય મર્યાદ.

જીવિતોને જોયા મૃત – વિસ્મૃત

શાનવૃદ્ધિકના અંતિમ અંકોડાનો લાગ્યો છે દંશ – દાહક છે પીડા.

કામની કૃષણમાં  
 ક્યારેક દેખાતી ચંચળબાળા  
 તો ક્યારેક ગવિતગાત્ર ચેતકેશા વૃદ્ધા.  
 સંભમથી ભામી ઉઠનું રિત.  
 ઉન્મત થઈ ઉઠેલો કામ  
 અચાનક થઈ જતો શાંત.  
 માસ, પક્ષ, પ્રદર ઘટિકા નહીં  
 પણ  
 નિમિષમાત્ર જો સૂર્યગ્ર ક્ષણ એક વર્તમાનની મળી હોત તો  
 વસાયું હોત મેં તેના પર એક હસ્તિનાપુર.  
 અસ્તિ-નાસ્તિના અંતિમો પર ભટકતા મનનું આશ્રય હોત એ હસ્તિનાપુર.  
 ભલે  
 ક્ષણ બે ક્ષણ હો  
 પણ શાંતિ મળી છે મહામના યુધિષ્ઠિરને  
 શાંતિ મળી છે વીર અર્જુનને  
 મહાબલિ ભીમને  
 સુદર્શન નકુલને  
 સદાય પ્રજણતી દ્રૌપદીને  
 ને હું ?  
 હું ચિર અશાંત  
 ગત આગત, અનાગતના સૂત્રને ગુંચવતો ગુંચવતો ગુંચવતો,  
 ઉકેલી ન શક્યો સમયના સણંગસૂત્રને  
 કણતટ પર સિથર  
 તોય હું ન તટસ્થ.  
 ક્ષણ એક જો કુવારી મળી હોત !  
 ભલે ન જોઉં સ્વર્ગનું દ્વાર  
 પણ હવે આ લઈ લો જ્ઞાનનો ભાર  
 ગળવા દો મને હિમમાં જ  
 (પાંડવોનું પ્રયાણ નકુલના પડવાનો ચિત્કાર)

ભીમ : રાજન ! મનોહર ધર્મત્બા બંધુપ્રિય નકુલનો કેમ થયો પાત ?  
 યુધિષ્ઠિર : પુરુષર્ભ ભીમ ! અપ્રતિમ રૂપનો ગર્વ એ દોષ હતો નકુલનો.  
 નકુલ : વીતી ગયેલી વસંત પણી શિશિરના આ પ્રપાતે  
 (સ્વરગત) હું નકુલ પાંખ્યો કે  
 રૂપ એ જ ક્યાં છે સ્વરૂપ ?  
 સ્વરૂપ તો ઓળખ્યું ધર્મવિત્તા તમે. માત્ર તમે જ.  
 હું તો પુરાયેલો રહ્યો રૂપની રેખાઓમાં

અને ક્યાં ગયું મારું એ રૂપ ?  
 દ્રૌપદીને આવેગથી સાહવા  
 દઢ આશ્વેષમાં બાંધવા છતાંય  
 સર્પની જેમ સરી ગયું છે મારા હાથમાંથી તેનું રૂપ  
 અને તેના હાથમાંથી મારું.  
 દેહ બને છે દેહનું સ્મારક.  
 અશ્વવિદ્યાવિદ હું નકુલ  
 જોઉં હું કે ક્ષણ પલાણીને  
 ઊડતી જાણ જેવી કેશવાળી લઈ  
 પુર્યાટ દોડી ગયો છે અશ.  
 ડાબલાં ય હવે દૂરસુદૂર  
 પડી રહ્યાં છે હવે માત્ર પગલાં  
 પવન અને હિમની રાહમાં.  
 આ રૂપને હવે ભલે રેલારે હિમ.  
 (શૈષ પાંડવોનું પ્રયાણ - અર્જુનના પડવાનો અવાજ)

ભીમ : ધમાર્થદર્શિન મહાપ્રાજા યુધિષ્ઠિર  
 પરિહાસમાં પણ જેણે અસ્તય ઉચ્ચારણ નથી કર્યું  
 તેવો પરાકમી ક્ષેત્રવાહન અર્જુન પણ પડ્યો.  
 એ ક્ષણ કર્મનું ફળ ?  
 યુધિષ્ઠિર : ઋજુ આ અર્જુનને હતું અભિમાન તેના શૌર્યવીર્યનું  
 અપમાનિત કર્યા તેણે ધનુર્ધરો એ જ એનું સ્ફલન.  
 અર્જુન : હતબલ, હતવીર્ય છે આજે આ બલિષ અર્જુન  
 દસ્યુ બની કાળ જ હરણ કરી ગયો મારું બળ  
 હવે મહાપ્રસ્થાનપર્વે  
 યુદ્ધ છે તો માત્ર જાત સાથે  
 એ જાણવા છતાંય દોડી ન શક્યો ગાંડીવનું મમત્વ  
 વિદ્ધ  
 વિદ્ધ છે મને  
 સમુદ્રનાં ઉદ્દેખિત મોઝાં જેવી યુદ્ધોન્મત સેનાઓ થંભાવી  
 કૃષ્ણો મને આપણું જે ગીતાશાન  
 તે જ મિથ્યા કર્યું મેં.  
 પ્રેમ અને પરાકમ એ જ શું મારી ઓળખ ?  
 શુભર્દશના દ્રૌપદી, નાગકન્યા ઉલૂપિ, ક્ષાત્રરમણી ચિત્રાંગદા  
 સુહાસિની સુભદ્રા કરતાંય વિશૈષ પાંખ્યો કૃષ્ણ પાસેથી  
 કૃષ્ણ પાસે યુધિષ્ઠિર ભીમ પાંખ્યા પ્રણામ  
 નકુલ સહદેવ આશીર્વાદ

આદિગન તો પામ્યો માત્ર હું જ.

પણ મેં શું આપ્યું કૃષાને ?

ખાંડવદહન પ્રસંગે હેઠળ પાસે મેં માર્ગયાં અસ્ત્ર શસ્ત્ર  
અને

કૃષો કામના કરી પાર્થ પ્રત્યે શાચતપ્રેમની.

ગાંધારીના શાપનું નિમિત્ત અમે – પાંચ પાંડવો અને હસ્તિનાપુરનું રાજ્ય

પણ હતપુત્ર, હતકુલ, હતજ્ઞતિ થઈ એ શાપ ભોગવ્યો કૃષો.

ધાર્યું હોત તો કૃષ્ણ મિથ્યા કરી શક્યા હોત તે શાપને.

પણ શિરોધાર્ય કરી એ શાપ – મર્યાં તુચ્છ મરણ.

હવે વધતું જાય છે કૃષાનું કર્ષણ.

અસ્ત્રવિદ્યા પરીક્ષા પ્રસંગે

પૂછ્યું હતું ગુરુ દ્રોષો

‘સામે શું દેખાય છે વત્સ ?

અભિમાનની કહું હતું મેં

‘દેખાય છે એક આંખ – નાનકડી લાલ ચળકતી.’

એ લક્ષાવેધમાં જ ચૂકાઈ ગયું સચરાચરનું લક્ષ.

સ્થિરમતિ યુધિષ્ઠિરને જ થયું સમગ્રનું દર્શન

આજે

અમથો એવો કંપ

પ્રકૃપિત થાય છે ભીતર, ફોરતી આવે છે કસ્તૂરીની ગંધ.

હવે કોઈ વેધ નહીં

કોઈ લક્ષ નહીં

સચરાચર સૃષ્ટિ જ હવે લક્ષ.

બે બે વાર સેવ્યો છે વનવાસ હવે સેવવો છે મનવાસ

કરી છે નાગલોક ભૂતોક સ્વર્ગલોકની લક્ષાહીન યાત્રા

હવે અનંતયાત્રા.

જીવનપટ પર પૂરું થયું છે વિરાટનાટ્ય.

શેતહિમની જવનિકા પાછળ

હવે નેપથ્યમાં જવાનો થયો છે સમય.

(પાછળ ભીમના પડવાનો અવાજ)

ભીમ : રાજન્ય આપનો પ્રિય એવો હું ભીમસેન પણ આ પડવો  
કહો રાજન્ય શો છે મારો દોષ ?

યુધિષ્ઠિર : પુરુષર્ભ ભીમ, તું સહૈવ રહ્યો અતિભુક્ત અને કોધી  
એ છે તારા પતનનું રહસ્ય.

ભીમ : હું ભીમ

(સ્વગત) કુરુક્ષેત્રમાં મેં ઢગવે ઢગ્યા ઢીમ

હવે હિમમાં હિમ

વૃક્ષ પરથી કોઈ ઝંગે જેમ ફળ

તેમ મેં ઝંગેદા તૌરવબાળ

આજે અમને એક પછી એક ઝંગે છે કાળ

ફેંક્યાં મેં ગદા, તોમરો, શક્તિઓ સહસ્ર

આજે ફેંકાઈ ગયો હું હું.

ઓંચક્યા દશોય દિંગાજોને એક બાવડે

પણ હવે ઓંચકાતી નથી મારી જ બુજા.

ક્રોણ શોષી લીધું આ બદિએ બાહુઓનું બળ ?

હું જાણું નહીં ફૂલ બકુલ

કે મન સંકુલ.

હું તો ભામિનીનો ભક્ત

તેના કેશમાં રીચ્યું દુઃશાસનનું રક્ત.

ક્રોપટીના એ રક્તચૂડામાંથી વહે છે ઉષારકત – ધવલ હિમને ઓગાળતું

હિમમાં ભણે છે દુર્યોધનના ઉરુભંગનું રક્ત

દુઃશાસનની છાતીનો રક્તધરો જવાલામુખી જેમ ફુલકારે છે રક્તને

રક્તલાવા દાડાએ છે મન હિમમાં.

આજે આ હિમગિરિમાં ગાંધારીએ જોયેલું કુરુક્ષેત્ર આજે છેક દેખાય છે :

રૂદ્ધની કીડાસ્થલી જેવી રણભૂમિ,

રક્તકર્દમથી દલદલ થઈ ગિઠલું ક્ષેત્ર

દશોય દિશાઓના દરવાજે લટકે છે વિદીર્ઘ ગાત્રો,

ચુંથાયેલા, ચેપાયેલા રક્તનીંગળાં અંગો

આકાશમાં કાળાં વાદળોની જેમ મંડરાતા શેન, બાજ અને ગીધનાં જુંડ

ચાળવલોચન આંખોને ઠોલતા કાગડાઓ

આભૂષણોને મેચતાં ગીધો

હાથમાં પતિનું મસ્તક લઈ વિલ્લ બની ધડ શેદશી

તો કોઈ કપાયેલો હાથ દસડતી, વીટોડીની જેમ આક્રદ કરતી ફૂલવધૂઓ,

તેમના વિલાપનો અસ્પષ્ટ અવાજ

ઘોર પ્રતિઘોષ બની પડધાય છે આ શાંતિમાં.

ઉગ આવેગી ચંડમૂર્તિ હું ભીમ

હવે શાંતિથી રાહ જોઉં હું મૃત્યુની.

લાક્ષાગૃહની ઝાળથી બચ્યા તો અહીં હિમમાં ફળ્યા.

સર્વત્ર હિમ.

નિષ્ઠર દેવ જેવું હિમ – હિમ મૃત્યુ જેવું.

આ અંતિમ પડાવે શાતા આપો ઓ હિમ !

યુધિષ્ઠિર : એક પછી એક છૂટ્યો સર્વનો સંગ

પ્રિય પાંડવો પાંચાલીનો સંગ  
 તોય હું નહીં નિઃસંગ  
 આત્મસંગ જ સાચો સંગ  
 એ જ સાચો રંગ.  
 આત્માર્થે પૃથ્વી તજવાનો હવે આવી ગયો છે કાળ  
 અર્જુનભીમની ભાતુભર્ત્રનાની  
 પાંચાલીના વલવલતા વિલાપની, કલકેલિની  
 રાજ્યાભિપેકના જ્યદોષની  
 નથી હવે કોઈ સ્મૃતિ.  
 પૂર્ણ થયું છે પક્ષ માસ જાતું સંવત્સર  
 જન્મજન્માન્તરનું આવર્તન.  
 ચાલ શાન, ચાલ મારા વિરસાથી શાન,  
 ધર્મનું જ જ્યાં હો પ્રવર્તન.  
 અધારમા હિવસે જ મળી ગયો જીતનો સ્વાદ.  
 મૃગયા કરવા નીકળ્યા  
 ને હાથમાં આવ્યું એક કરાલ કંકાલ.  
 જાણે અજાણે કોણે વાવ્યા  
 આ વેરનાં બીજ ?  
 દુપદે ? દુપદનંદનીએ ? અંબાએ ? પિતામહ ભીજે ?  
 કે સ્વયં કૃષ્ણ દૈપાયન વ્યાસે ?  
 દુર્યોધનનો નથી જોતો કોઈ દોષ  
 દોષ નથી પુત્રાસક્ત ધૂતરાઘ્નનો  
 દોષ કદાચ દૈવનો  
 કે  
 સહુનો સહિયારો.  
 દૈવદોષે જ કુરુક્ષેત્ર બન્યું વેરનું વિષકોત્ર.  
 - તેની વિષક્ત જવાળામાં સુકાયું, શોષાયું, સળગયું, ભસ્મ થયું બધું  
 અકળ છે દૈવની લીલા.  
 આજીવન બ્રહ્મયર્થની ઘોર પ્રતિજ્ઞા કરી જે ભીજે તે જ  
 આજીવન ગૂંચવાયા કુરુકુળ સંસારમાં.  
 સૂર્યપુત્ર કર્ણ રહ્યો અહિન્શ અંધકારમાં પ્રજળતો  
 - મરણોત્તર જ પાય્યો ક્ષાત્રોપિત શ્રાદ્ધવિધિનું માન.  
 મહાશાની વ્યાસપુત્ર વિદૂર પર જ લાગ્યું હીનકુળનું લાંછન  
 નરપુંગવ અર્જુન બૃહનલ્લા બની નાચ્યો વિરાટની સભામાં.  
 પુરુષોત્તમ કૃષ્ણને મળ્યું પારદીના હાથે તુર્ય મરણ  
 અંધ ગાંધારીએ ખોલ્યાં નેત્રો ને જોયો કુરુકુળનો વિનાશ

પરીક્ષિતમાં જ બસ બરી હવે પાંડવકુળી આશ  
 હું સત્યાગ્રહી  
 ને મારા મુખે જ ઉચ્ચારાયું અસત્ય.  
 વિજય રૂપે જ મહ્યો પરાજય  
 અકળ છે દૈવની લીલા.  
 હસ્તિનાપુરની ચતુર્સરીમાને બેરીની જેમ છોડીને આવ્યા પછી હવે  
 અષ્ટ દિશા વ્યાપ્ત ક્ષિતિજનું નથી આહુવાન  
 આહુવાન હવે ઊર્ધ્વનું.  
 ચાલ શાન, ચાલહજી અધૂરું છે આરોહણ.  
 વિરાટ આ સભામાં ગુપ્તવેશો છે સર્વ.  
 રૂપમાં ગોપિત અરૂપનો, સ્વરૂપનો ઓળખવાનો કર્યો સર્વે યત્ન.  
 ચાલ શાન, ચાલ હજી અધૂરું છે આરોહણ  
 (આકશમાંથી વિમાનમાં ઠંડનું પ્રગટીકરણ - સંકેતિક સંગીતથી)

યુધિષ્ઠિર : પ્રાણમ દેવાયિદેવ ઠંડને.  
 ઠંડ : ધર્મરાજ યુધિષ્ઠિર, હું આવ્યો છું આપને સદેહ સર્વે લઈ જવા  
 પદારો, આરૂપ થાવ આ વિમાનમાં.  
 યુધિષ્ઠિર : દેવાયિદેવ ! આપને એક વિનંતિ છે.  
 અંત સુધીનો મારો સાથી આ મારો ભક્ત શાન પણ સર્વમાં આવશે મારી  
 સાથે.  
 ઠંડ : શાનનો સ્વર્ગપ્રવેશ નિષિદ્ધ છે ધર્મવેતા યુધિષ્ઠિર.  
 છોડ્યું આપે દિગંતવ્યાપી હસ્તિનાપુરનું સામ્રાજ્ય  
 પથમાં જ છોડ્યા ભાતા અને ભાર્યા ત્યારે આપે  
 એક વાર પણ પાછું વળીને જોયું સુધ્યાં નથી.  
 તો, શા માટે આટલું મમત્વ આ હીન પ્રાણી માટે ?  
 યજ્ઞ જેનાથી ભષ થાય છે, ચાંડાલોનો જે નિત્ય સાથી છે  
 એવા અપવિત્ર શાન માટે શોભે નહીં આટલું મમત્વ.  
 છોડો શાનને.  
 આપ મારી સાથે પદારો વિમાનમાં.  
 યુધિષ્ઠિર : હસ્તિનાપુરનું રાજ્ય એ મારું નહીં ભગવનું  
 - એ તો મારા પૂર્વજીનો વારસો અને ઉત્તરાધિકારીઓની થાપણ  
 ભાતા કે ભાર્યાને ત્યજ્યા નથી મેં  
 પથમાં જ છૂટી ગયા છે તે  
 આ શાન તો છેક હસ્તિનાપુરથી રહ્યો છે મારી સાથે  
 આવ્યો છે મારા શરાણો.  
 શું પવિત્ર શું અપવિત્ર.  
 પ્રત્યેક જીવમાં દસ્તિ જુવે સમત્વ.

કરું હું પ્રાણત્યાગ  
 પણ શરણે આવેલાનો કેમ કરું ત્યાગ ?  
 શાન વગર સ્વર્ગનું સુખ મારે મન દુઃખ.  
 આપ સુખેથી સિધાવો સ્વર્ગ.  
 (આકાશ તરફ દસ્તિ કરીને)  
 છલના ન કરો દેવ  
 નહુષ, બડક, નકુલ બની છચવેશે  
 શા માટે લો છો મારી પરીક્ષા. ફરી ફરી એ જ પરીક્ષા.  
 તમે મારા ગુરુ, તમે મારા તાત  
 આવો હવે સાક્ષાતુ  
 (ધર્મ રૂપે શાનનું પ્રગટીકરણ)  
 અરે ! ક્યાં અદરથ થયો શાન ?  
 ઓહ !  
 પિતા ! તો શાન રૂપે તમે જ છાયા બની રહ્યા મારી સંગ !  
**ધર્મ :** ધન્ય છે વત્સ.  
 તું સંદેવ રહ્યો જ્ઞાનાર્થી – મારો પરીક્ષાર્થી.  
 દેહમાં રહી તું રહ્યો વિદેહી.  
 ભલે નથી તારા જીવનમાં પ્રેમ-પરાકમના સુવર્જણ્ણું  
 પણ  
 અનેકાનેક નદીઓના સંસ્કારસિંચન કરી જનપદપોષક  
 ગંભીર વહેતા નદીની જેમ વધ્યું તારું જીવન.  
 વિતરાગ, વિતમન્યુ થઈ તે ભોગવ્યું જીવન.  
 એક અભોલ પ્રાણી માટે તે ત્યજ્યું સ્વર્ગ.  
 ધન્ય છે વત્સ  
 તને  
 માત્ર તને જ છે સંદેહ સ્વર્ગનો અવિકાર  
 આવ, તને લેવા આવ્યા છે ઈંદ્ર, મરુત અને અશ્વિનીકુમાર  
 જો,  
 આ, આ ખૂલ્યાં સ્વર્ગનાં દ્વાર.  
**યુધિષ્ઠિર :** પિતા ! ભલે પોયણાંની જેમ ખૂલ્યાં સ્વર્ગનાં દ્વાર  
 સ્વર્ગ માત્ર પાંડવોને ?  
 જીવમાત્ર તો અહીં આ ધરતી પર.  
 સ્વર્ગની સન્મુખ સમજાઈ છે પૃથ્વીની માયા.  
 હિમગિરિથી ગીર્ધ કોઈ સ્વર્ગ નથી કરવું આરોહણ.  
 હું ચાહું અવરોહણ નાનકડા નિર્જર જેવું  
 જે નાદ કરતું બંકિમ કંદરાઓ, ઉપત્યકાઓમાં વહી નદી બની

વનપ્રાંતર, જનપદને સીંગે યુગોયુગો સુધી.  
 મારે નથી ભળવું શતબિષા, બાણરજ, અભિજિત કે કૃતિકામાં.  
 મારે ભળવું આ મૃજમય મૃત્તિકામાં.  
 જ્યાં હિમમાં હિમ થઈ ઢળ્યા છે અનુજ ભીમ, અર્જુન, નકુલ ને સહદેવ  
 જ્યાં ભસ્મ રૂપે ભળ્યા છે પિતા પાંડુ, માતા માદ્રી અને કુતી યોગેશ્વર કૃષ્ણ  
 પિતાસમ વિદ્વાર, પિતામહ ભીખ બાતા કર્શ અને દુયોધન.  
 પૂર્વજોની ભસ્મ સાથે ભળ્યા છે જ્યાં અમારા પુત્રો.  
 જ્યાં લહેરાય દેવદૂમ દેવદાર, ભુજ્ઝ અને અશત્થ  
 જ્યાં સંભળાય ઘાસના ચાસ.  
 જ્યાં વિહરે કુજ કુરંગ અને કીટ  
 તે મૃજમય મૃત્તિકામાં ભળી જવા દો મને.  
 હું પૂથાપુત્ર  
 સર્વમાં શેષ થઈ શોધું મને.  
 સિધાવો પિતા ધર્મરાજ !  
 આપ સિધાવો સ્વર્ગો.  
 મને સ્વીકારો ઓ માતા પૃથ્વી !  
 સ્વીકાર કરો મારો માતા.  
 સ્વીકારો.



r

### જીવનચરિત્ર

**(૧૦૮) સિદ્ધપુરના સિદ્ધ સંત :** શ્રી દેવશંકર બાપા :  
 તરલા દેસાઈ, ૨૦૦૮, હેમત ભણ, પદ, પાયલપાઈ, સોટેલાઈટ,  
 અમદાવાદ, પૃ. ૧૦૮, રૂ. Nil (૧૦૮) મહામાનવ ડૉ.  
**અંબેડકર :** નટવર ગોહેલ, ૨૦૦૮, રનાંદે પ્રકાશન, અમદાવાદ,  
 પૃ. ૮+૧૬૭, રૂ. ૧૫૦/- (૧૧૦) ગાંધીજીનાં પ્રેરણાતીર્થો :  
 ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૮, રનાંદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૬+૫૮,  
 રૂ. ૩૦/-.

### આસ્વાદ

**(૧૧૨) આવિસ્મરણીય ‘મરીઝ’ :** ગુલામ અબ્બાસ  
 ‘નાશાદ’, ૨૦૦૮, સી/૬૦૪, ફેલેસાગર કોમ્પ્લેક્સ, ફેલેગંજ,  
 વડોદરા-૩૯૦૦૦૨

કટલું ખોલીને અંદર પ્રવેશવાનું, ભાઈઓના ભાગે આવેલાં જેતરોની વચાળે શોઢ હોય, બીજાનાં જેતરોથી જુદાં પાડવા માટે થોરની અકરેઠ વાડ્ય કરેલી હોય. અંદર જવા માટે ખોડીબાનું હોય. એને બોર્ડીનાં કાંટાળાં જઈડાનું કટલું બનાવીને આડું કરેલું હોય. એ ખોલો એટલે જેતરમાં, ગાડાવાટ હોય, પણ એ તો કારેક જ ખોલાય, જ્યારે ગાડું કે જેહાડે જોડેલું હળ લાવવાનું હોય ત્યારે. કાયમી રસ્તો તો આ ખોડીબાનું જ ! બે બાજુ બે લાકડાની થાંભતીઓ ઊભી કરી હોય, એને કટલાથી ખોલ-વંધ કરવાની. જેથી જેતરમાં કોઈ કોઈનાં ઢોર આવી ન શકે. ક્યાંક ક્યાંક લાવરાં-તેતરાં કે સસલાંએ નેળિયાં પાડયાં હોય એટલું જ !

ખેડૂલૈનું જીવન એટલે જેતર, શોઢા, ઢોર-ઢાંખર, વાડ્ય, કાંટા ને જાંખરાં ! કોઈની પાસે પાંચ વીધા તો કોઈની પાસે આઈ-દસ વીધા જમીન હોય તો પોતાનો ગુજરો આરામથી થતો રહે; બે-ત્રણ ડેબાં હોય તો એનાં ઘીદુધમાંથી હાથખરચી નીકળા કરે ! નાના-મોટા પ્રસંગ તો જે કંઈ ભેગું કર્યું હોય એમાંથી થાય અથવા તો કોઈને ભાઈ-બાપ કરવાના કે ઊભી-ઉધારે કે વ્યાજવા લેવાના ! જીવતરનું ગાડું ગબડ્યા કરે ! અભાગે જ કોઈ મોટે ખેડૂત મળે જેની પાસે ચાલીસ-પચાસ વીધા જમીન હોય !

કોણ કેટલા કૂવાનો માલિક છે એના પર એની ઈજ્જત-આબરુનો આધાર ! માણસ સમાજમાં પાંચમાં ક્યારે પુછાય ? ‘કૂવાણા બૈ તો બે કૂવાના ધણી સે.’ એને બધા માનથી જુદે, ક્યાંય જાય તો ખાતલામાં ઓશીકે બેસાડે. ઓશીકાનો મહિમા મોટો ગણાય ! વીલ હોય, મોભાવાળા હોય, એમને પાંગથે બેસાડાય નહિ, એ એમનું અપમાન કહેવાય એટલે એનો મોભો જળવાય – માન મળે, હોકા-પાણી કરાવે. કોઈને કૂવા જેવું કંઈ ના હોય તો લોકો કહે : ‘ડફેળની પાહણ એક ખાદું પણ નથ !’ એની સામે કોઈ ના જુદે, જુદે તો નફરતથી જુવે, કોઈ પ્રેમથી ના બોલાવે. ‘ગરીબની વહુ સૌની ભાભી’ જેવો એનો ઘાટ થાય. સમાજમાં છોકરોના હગપણના હંદા પડે એને તો !

ટેમ ટેમનું કામ કરે સે. ચેટલા હારાફેરા થૈ જ્યા સં ! અતારે તો સાયકલો, સ્કૂટરો, મોટરસાઈકલો, ભાતભાત ને જાતજાતની મોટરગાડીઓ થૈ જૈ. તમારા પગ ભાજી જ્યા. વધારે મોટરવાળો આબરુદ્ધ ગણાય. પણ બૈ, ઈ મોટરો ચેવી રીતે આઈ સે, એ કોઈ જોતું નથી. વધારે મોટરવાળો આબરુદ્ધ ગણાય. બધાય પેસાના પૂજારી મારા બૈ. અમારે તો એવું નર્દી. ભલા માણસની સમાજમાં આબરુ ખરી. અમારે તો માલમિલકત – જે ગણો તે જેતર, ઢોર ને કૂવા.... બૈ ઈનું તો ઔંણ દોઢો મણ રાયડો થો.... હો મણ ઘઉં થાય.... ઈની તો પાંચેય આંગળીઓ જ્ઞાની સે. આ અમારા સુખની નિશાનીઓ. આખો દા'ડો વલવલ કરીને આઈએ. અને રાતે માંચામાં પડતાંની હારે ઘસઘસાટ ઊંઘ આવે, ઈનાથી મોટું સુખ ચીયું હોઈ શકે ? તમારી જ્યમ નર્દી કે આખી રાત પડાં ઘસતાં ઘસતાં ગોળીઓ લેવી

પ્રે !

જેતરમાં બે મુઝડા બળદની જોડી બાંધી હોય, હથ મૂકીએ તો લપસી જાય એવી સાત-આઈ બેંસો વાગ્પોણી હોય, સવાર-સાંજ ઘરધણિયાણી બોગેણું બે ઢીંચણની વચ્ચે બરાબર ગોઈવીને, બે હાથેથી બેંસના આંગળોમાંથી જઈડળું... જઈડળૂં... શેફકડાં દૂધ દોતી હોય !

સાંજના સમયે આખું આભદું ભરીને પંખીઓ આથમતા સૂરજને મળતા જતાં હોય, કૂવા પરનાં આંબા-આંબલી-લીમડા-વરખડા-કણજી-પેપર કે પીંપળાનાં પાંડડે ચકલીઓનો ચહેરાછાટ, કાગડાઓની કાગારોળ, કાળી કાકણસારનો કર્કશ કે બંગલાનો ડક્કડ ડક્ક અવાજ અને સૂદા-વૈયાં કે કાબરોની કાગારોળ થતી હોય ત્યારે સાંજ થાડી-પાકી ઘર તરફ વળે, એ જ વખતે જેતરે જેતરે સળગતી ધૂઘીઓનો ધુમાડો હવામાં તરતો હોય, એને સૂંઘતાં સૂંઘતાં પશુ-પંખીઓ ઊંઘવાની તૈવારીમાં પડગાં હોય ત્યારે કૂવાની એડોઝે કે અંદરના ભાગમાં અથવા કાંઠા પાસે કબૂતરોનો ગટરધૂ... ગટરધૂ... ધ્વનિ શમતો જતો હોય ! તમારે એમાંનું કશુંય વોય સે ખરું ? પર્યાવરણની પરિષદોમાં ગળાં ફાડીકૃષીને બોલવાનું પછી વેર જઈને ઊંઘી જવાનું !

આખો સમાજ માથે ભગવાંન રાખીને જીવે. દરેકને એકલીજાનો આશરો હોય, કોઈનું કામ અટકી ના પડે. અરે ! એકલીજાના ટેકે ટેકે ક્યારે પસાર થઈ જાય એની ખબર જ ના પડે ! પોતાનું કામ પણ સૌનું મજ્જ્યાનું થઈ જાય. હાથોહાથ ક્યારે એ પૂરું થાય એની ઘરધણીને પણ સમજ ન હોય ! ભલે સામસામે એકલીજાને બોલવાના સંબંધ ના હોય, પણ કોઈને અગવડ ઊભી થાય તો એ જોવા ઊભો ના રહે, એ એવું વિચારે નહિ કે મારે એની સાથે સંબંધ નથી, તરત જ પડે જઈને ઊભો જ રહે; એવી ભાવનાવાળા !

જેતરમાં કોઈને નવો કૂવો ખોદવાનો વોય તો સૌપ્રથમ મા'રાજને બોલાવે ! ટીપણાં ફંદાવે, પોથીને ચાંલ્યા કરે, કાળ-ચોઘડિયાં જોવાડાવે, લાભ-શુભનું મુરત કઢાવડાવે. એ વખતે પગલાં પારખનારા પગી હતા, પંખીઓના અવાજપારખુ અને કાનેવાળિયા હતા એમ પાણી પારખનારા પાણીકળા પણ હતા, પાણીકળાને ભાઈ-બાપા કરીને શોધી લાવવો પડે, એની માંગ ઘણી રહે; દૂર દૂર સુધીના લોકો એને શોધતા આવે, લઈ જાય. ગામડે ગામડે એના ઘરાક, કોણ ક્યારે ઊંઘકી જાય એની ખબર જ ના પડે ! એની પાસે ટેમ હોય જ નર્દી ! આજે આંય તો કાલે ક્યાંય !

પાણીકળા જેતરમાં આવે. જેતરનું કટલું ખોલી, અંદર પ્રવેશી, ઊભો રહી, જેતરો ઉપર નજર ફેરવી, ઊંડો શાસ લઈ, નજર નીચી કરી, પોતાના નાકની કંઈ નારી ચાલે છે, એ દિશામાં ડગલાં ભરે. પહેલાં તો બધાં જેતર ઘાઈ લે. જેમ કોઈ દક્કાયમાંથી જોતો હોય એમ, જાણો ધરતીના ગર્ભનું પરીક્ષણ કરતો ના હોય ! ‘પાણીનું વળું પકડાય સે, પણ ચીયી દિશામાં જાય સે, એ પકડદું કાઢુ સે. હશે... માતાજી... માતાજી... કરો. હો હારાં વાંનાં થાહી.’ અડધો દિવસ આંટા મારે, પછી શેખનાગની છાતી ઉપર ખીલો ઠીકતો હોય એમ, હાથમાંની કોશને જોરથી ઊભી પટકીને, અણી અંદર ઘુસાડી, પાણીનું પાતાળ ખોલી હે – લ્યો, ખોલો આંય, તમારે તો પાણી જ પાણીની ઘણાને આ રીતે પાણી થયાં હોય એટલે તમારે તો એના શબદમાં શ્રદ્ધા રાખ્યા સિવાય ધૂટકો જ નર્દી !

એ વખતે વરહ ઘણાં હરવાં હતાં. વરસાદ ખૂબ થાય. ચોમાસામાં તો કૂવાના કંઈ ઊભા રહીને પાણીનાં બકીયાંમાં કે ઘૂણીયા ભરી શકતા ! આજો શિથાળો પાંણીની હરવારણીઓ હેડ્યા કરતી ! પાણીનો તોટો ન'તો. વરહાદ પણ માનવીઓનાં દલની જ્યામ મન મૂર્ચીને પડતો. અતારે તમારા ધુમાડાએ તો ઱લોબલ વોર્મિંગના પ્રશ્નો ઊભા કર્યા છે, એની બૂમો પાડો છો ! હાચી વાત તો એ સે કે, કુદરત તમારાથી રૂઠી સે, ધરતી મા પણ ચેટલું સહન કરે ? તમે તો ધરતી ઉપર ભારરૂપ બની જ્યા સો ! પોતાની જેનોતાની પણ કોઈ મર્યાદા હોય કે ને ? સીઝેરિયન ઉપર સીઝેરિયન ! બચારી ધરતીનું શરીર ચાઈણી જેવું કરી નાંસયું છે, હવં તો જ્યો ! પણ જ્યો તો તમે શયના ?

કૂવો ગાળવાના મુરત વખતે ગામના આગેવાનોને પણ જેતરમાં બોલાવવામાં આવે. મા'રાજ ઉગમણા મુઢે ઊભા રે. જેતરમાલિક કંતાન પાથરે પછી ઉપર પછેણી ! મા'રાજ જૂતાં બહાર કાઢીને ! પગ બંનેરી એમનાં પગલાં પથરણામાં કરે. બેસો. જાંબે નાખેલો રૂમાલ આઘોપાછો કરે. ક્યારેક પીળું પંચિયું લાયા વોય. થેલી જેવી કોથળી ખોલે ! એમાંથી જાત-ભાતના ભગવાન નીકળે ! બાજદ હોય તો ઠીક છે, નઈતર ચારપાંચ ઈંટો પાથરીને બાજદ ગોઠવાય ! કંકું-ચોખા તો ખરાં જ. થાળીમાં ખાવાનાં પાન મુકાય, હાથમાં પાણી લઈને કૂડાળું કરી, એમાં શ્રીગણેશની નાનકડી મૂર્તિ મુકાય ! શ્વલ્પ ખોલે એ પોતે જ સમજે. જેતરનો ધણી અને ગામમાંથી આવનારા બધા સામે બેસીને શ્વાસી આ બધું જ જેયા કરે, પછી વિષ કરાવે, ખાત-મુહૂર્ત જેવું જ. પાણીકળાએ જ્યાં નિશાની આપી હોય ત્યા મા'રાજના હથે કોદાળીથી ખાડો ખંદાય ! કંકું-ચોખાથી વધાવાય, ધૂપ-દીપ-નૈવેદ થાય અને શ્રીફળ વધેરીને 'રખવાન મા'રાજની જે...' બોલાય ! એ જ સમયથી કૂવો ખોદવાનું કામ શરૂ થાય !

જેતરમાં કૂવો કરાવવો એ પણ એક અવસર ગણાતો ! મજૂરો કે દા'દિયાં લાવવાનાં, કોન્ટ્રાક આપવાના રિવાજ તો તમે લાયા. એ વખતે તો સગાંવહાલાંને કુહેણ મોકલાય, કુટુંબમાં પણ કહેવાય, હાથોહાથ ભાયપામાં કામ થાય. બળદોની હુંદેલની જેમ માણસોના કામની પણ હુંદેલ કરવામાં આવે ! લાગતાવળગતા બધા વારાફરતી કૂવો ખંદાવાના કામમાં જોડાય ! આજે મારો વારો તો કાંઠે તમારો ! હાઈ... શૂ... હાઈ... શૂ...

પહેલાં તો કૂવાની પહોળાઈ નકી થાય. કૂવા ઉપર એક ડોસ જોડવાનો કે બે અથવા ત્રણ ! એ રીતે એને ખોદવાનો વોય. જો એક જ કોહ જોડવાનો હોય તો સાંકડો થાય તો ચાલે ! દસ-બાર જણા પાવડા-કોદાળી-તગારાં-સ્થૂલીઓ લઈને ખડા પગે રહે. કોઈ ખોટે, કોઈ માટી ભરે, કોઈ ઊંચકીને દૂર નાખી આવે, હાકોટા-છાકોટા થાય કરે, હાથોહાથ કામ ચાલે ! માથોડું ખંદાય ત્યાં સુધી તો વાંધો ના આવે. પછી બે દોમેરો બાંધીને, ટેરણીયું લટકાવી, ઉપર પૈડાને ગોઠવીને મોટી સ્થૂલીઓની નીચે ચાર લાકડાનો ચોકો કરી, બાંધીને, માટી ભરીને, બેંચીને ઉપર લાવવામાં આવે, બે જણા ઊભા રહીને એને બેંચી લે, બીજા બે એને ઊંચકીને દૂર ફેંકી આવે. ચાર-પાંચ દા'ડામાં તો કૂવાના તળિયે ઢીંચણ સમાજાં નીર છલકાવાં માંડે !

કૂવો ગણાવવો એ તો ધેર વિવાહ હોય એવો આનંદ ગણાય. વહેલી સવારે બધા આવી જાય. લેંસનું દૂધ વેંશામાં ઓગાળીને – દૂવો બનાવીને પી લેવાનો ! ચાનું તો કોઈ નામ-નિશાન નહોતું. ખાંડ કેવી હોય, એ તો આશર્યની વાત હતી. હા, ગોળનાં દડબાં

આતા ખાતા હાલ્યા જવાનો આનંદ કંઈક ઓર હતો. કૂણા કૂણા બપોર થાય એટલે બધા વિધામો ખાય. દેવતા સળગે, ચલમો ભરાય, ગમગપાય મારતા જાય, માથે બાંધીલા રૂમાલથી રેતાળ પરસેવો લુછાતી જાય, થોડી વાર આનંદ કરે. ફરી પાછા કામે વળગી જાય. બપોર થતાં સુધીમાં તો ઘરવાળાં-બૈરાં ને છોકરાં બધાં જ – આ બધાનું ભાત ખાવાનું લઈને આવી જાય !

ઘઉં, જુવાર કે બાજરીના રોટલા, ગોળ અને ધી ! ક્યારેક કઢી પણ લઈ આવે, એમાં વાડીમાંથી ધી રેડીને, ઘર ધિણિયાણી સૌને ખવાદે, ખાતાં ખાતાં ટેળટખાં થાય, નાના હોય તો ભાબીઓની મશકરી પણ કરી લે ! ઓડકારો ખાઈને, ચલમ-પાણી કરી, થોડી વાર માટે માથાના રૂમાલનું ઓશીદું કરીને આંબાના છાંયે આડા પરીને, કેડ્ચોને સરખી કરે ! આડા પડ્યા નથી કે ઘસઘસાટ ઊંઘ્યા નથી ! ઊંઘને અને થાકને પાક્કી ભાઈબંધી હોય છે.

ગોળ-ધીની સુગંધ એમના મોઢામાં હોય, મૂઢો ઉપર પણ એ તગતગતું હોય, એની સુગંધથી કીડીઓનાં ઝુંડે ઝુંડું આવી ચઢે – ધીમા પગલે ! તો ક્યારેક માખીઓ પણ બણાબણવા માંડે એમની ચોમેર ! કોઈ એમનું ધ્યાન દોરે તો એ કહે પણ ખરો : આ સેતરોમાં આપણો હક્ક સે એટલો ઈંયાંનો પણ ખરો કે નઈ ? કીડી-મંકોડી-પશુ-પંખી-પ્રાણીઓ – લીલો મોલ કે ફરફરતા ઘાસ સાથે એમને એટલો જ નાતો ખરો તે ખરો જ ! એ પણ જીવ સં અનું આપણે પણ. એ નેના સં તો આપણો મોટા સીએ. ધરતી મા તો હૈની સે ભઈ ! આવું તો આ સેડૂભઈઓનું ગન્યાંન. છે તમારી પાસે આટલી સમજ ? કે વિશાળ મન ?

સાંજે પાવડા-કોદાળી-તગારાં લેગાં કરીને ઠેકાણે મૂકવામાં આવે ! જો કૂવો ગળાવનારો ખમતીધર હોય તો ચારે જેતરમાં જ જલસો થાય ! ઘરનો થોડો દૂબળો હોય તો એ જ રોટલા ને શાક, દૂધ ને વેંશે !

કૂવો ખંદાય પછી એમાં પાણીની સરવાણીઓ કૂટે ! વાહ લૈ વાહ ! દોડતા દોડતા અંબાના થડમાં ગોઠવાયેલી ચાર ઈંટો વરચે બેઠેલા જેતરપાળની આગળ જઈને ફાળિયું ઉતારી, ધીનો દીવો પ્રગયાવીને પ્રાંધના પણ કરે : હે મારા ધણી ! તારો આશરો મારે મોટો સે, તું રાખે ઈમ રઈએ. તારી લીલી નજર કાયમ માટે અમારા ઉપર પથરાયેલી રૂહે એ જોજે !

પાણી દેખાતાંની સાથે જ આનંદ આનંદ છલકાય સૌના ચહેરા પર. નદીની રેતમાં દીરડા ગાળીએ અને જેવી પાણીની સરવાણીઓ કૂટે એમ, ધરતીમાતાના થાંનેલામાંથી પાણીની ધારો વહેવા માંડે ! આજુબાજુનાં જેતરોવાળાં પણ પાંણી જોવા માટે ટોળે વળે, છિકરાં કોઈના પગ નીચેથી ઘૂસીને અંદર નજર કરે ત્યારે કોઈ હાકેટે પણ ખરો ! જે... આ તો ઘણો નસીબદાર કેવાય ! જાંણો નારિયેણનું પાંણી જ જોઈ લ્યો... અરે ! ભલાની હંમે ભગવાન પણ જુવે સે. જુઓને ઢેકણા ભૈને તો આખું સેતર ચાઈણી ચાઈણી કર્યું તોય પાંણી ના ભાણ્યું ! એની વારે ભગવાન આઈ જ્યા...

કૂવામાં પાણી દેખાયું નથી કે, એને વધાવાની તિયારી થઈ નથી. તાબડતોબ ઢોલી બોલાવાય, મા'રાજ તો હોય જ ! ફરીથી એ જ વિષ-વિધાન ! એ જ મા'રાજનું અગડમ

બગડમ હાલવા માંડે ! કંકું-ચોખાની સાથે શ્રીફળનો પ્રસાદ, ગોળ-ધાળા.... જાંશે આહાડનો પે'લો વરહાદ ! ધન ભાયા... ધન ધરા ! પાણી વધાવાય, મા'રાજને સીધું-સામાન અપાય, સુખી થાવાના આશીરવાદ લેવાય. આખા ગામમાં વાયરો વાત લઈને જાય : ફુલાણા જૈના કૂવામાં ભૂંગળી નાણે પાણી થ્યું... અફવાઓ પણ ચાલે : જૈ કોણાળીનો ઘા કર્યો એઠી જ માંયથી પાંઝાની સેરો ઊડી... રંધું હાળો નસીબવાળો સે ? તો કોઈને ઈર્ષા પણ આવે : અતારે ભલે ફૂલાતો વોય, ઉનાળાના પેટમાં ચંચાં દુખે સે ? જો... જો... ને તળિયું જોવા ન મળે તો ? કોહ ભર્યું પાંઝી જોઈને પોરહાઈ જ્યા સં ! ગામનાં મૌંબાં એટલી વાતો... પણ કૂવાને ક્યાં આ બર્ધું સાંભળવાનું હોય છે ? કૂવાને તો પોતાનું કામ કરવાનું હોય છે. જે બીજાની નિંદાને ગજાકારતો નથી, એ કાયમ માટે ભચાતો જ રહે છે. કૂવાને તો પોતાની લીટી લાંબી કરવામાં જ રસ હોય છે. કૂવાનું કામ છે પાણી આપવાનું – જે અવિરત આયા જ કરતો હોય છે, જેને જે કહેવું હોય એ કહે, એને ક્યાં કોઈની સાડાબારી હોય છે ?

કૂવો કરવાનો છે એની તૈયારી છેલ્લા છ માસથી કરતી હોય છે. કૂવાના માપ પ્રમાણે સુથાર પાસે ટોરી તૈયાર કરાવી રાખી હોય છે. એકાદ કણજી કે વરખડો વાઢીને એ સુકાઈ જાય એ પણી એના થડને વ્લેરીને એને ગોળાકાર ઘણીને તૈયાર રાખેલો હોય છે. એ ટોરીની સાથે સુથાર, લુખાર અને કડિયા પણ તૈયાર જ રાખ્યા હોય... ઉપરથી પાણી ઉલેચાતું જાય, અંદર ટોરી બેસાડાય, એની ઉપર ઈંટોથી ચણાતર કરાય ! ચાર દિવસમાં તો પાંચથી કૂટ કૂવો ચણાઈ જાય; ફરીથી ખોટવામાં આવે; જેમ જેમ નીચે બંદાતો જાય, તેમ તેમ ચણાયેલી ઈંટો, ટોરીને કારણે, નીચે જતી જાય ! ફરી બે દિવસ સુધી ચણાતર થાય ! એ જમાનામાં સિમેન્ટ જેવાં સંપન્નાં તો હતાં નઈ, તેથી ચૂનાનો ઉપયોગ થતો ! સાત-આઠ કૂટ પાણી થઈ જાય, પણી કોઈ ઊંડો કરાવે તો આદ-દસ-બાર કૂટ પાણી કાયમી થઈ જાય.

થોડા દા'ડામાં તો કૂવો ચણાતો ચણાતો ઉપર આવી જાય. ઉપરના ભાગે લાકડાના પાટા ગોઈવાય, એકબીજામાં ફીટ કરીને, એક બાજુ થાણું બનાવાય. બે મજબૂત લાકડાની દોમેરો વચ્ચે પૈકું ગોઈવાય, જે બે બાજુ ઊંચું હોય અને વચ્ચે એનો ગાળિયો હોય. જેના કારણે વરત એમાં રહી શકે, છટકી ના શકે !

એકાદ-દોઢ મહિનામાં તો કૂવો ખેતરોના ચાસે ચાસમાં રેલાવા માંડે ! શેઢાની નીકોને નવડાવતો નવડાવતો ક્યારે ક્યારામાં સમાવા માંડે ! કૂવો તો ધરતીનું ધાવણ, દૂંજતા પાતાળનું પોત ! કણેકણમાં સમાતો કૂવો ! પાંદટે પાંદટે ઊગતો કૂવો ! ઊભીઓમાં કે લીલાં લીલાં દુંડાંમાં લેરાતો કૂવો ! કૂવો સૂરજની આંખ. કૂવો તેતરનું ભાત, કૂવો કુલડીનું પાણી, કૂવો પંખીની પાંખ, કૂવો બાવળની રાખ. કૂવો લીમડાનો મ્હોર, કૂવો બોરડીના ન્હોર ! કૂવો શેઢાનો ભાથી, કૂવો ખેડૂનો સાથી ! કૂવો જીવનની રેલ, કૂવો મરણનો ખેલ !

અમે કૂવે કૂવે કૂટચા, અમે ટેરણીયે રીંગળાયા, અમે કોસે કોસમાં દલવાયા ! અમે કંઠે બેસી મલકાયા ! અમે કૂવાના હાથ, અમને કૂવે ભરી બાથ, અમે કૂવાના શાસ, અમને કૂવાની વાસ, અમે કૂવો કૂવો રમીએ, અમે કૂવે-કૂવ ખરીએ. કૂવો ધરતીમાં ધરબાયો, કૂવો ભીનો ભીનો હરખાયો. કૂવો કૂણો કૂણો ઊંઘ્યો, કૂવો નીક દ્વારા પૂંઘ્યો, કૂવો હવામાં હિલ્લોળાય, કૂવો ધીમે ધીમે અમળાય ! કૂવો પાકટ થતો જાય, કૂવો ખરવા તૈયાર થાય,

કૂવો દાતરરે કપાય, કૂવો ખળમાં પથરાય ! કૂવો ગાંસડીએ બંધાય, કૂવો ગાડામાં સંધાય. કૂવો ચાલતો ચાલતો જાય, કૂવો ખાંડણિયે ખંડાય, કૂવો ઘંટીમાં પિસાય, કૂવો ક્યારેય ના રિસાય. કૂવો હાથોમાં ટિપાય, કૂવો દાંતોમાં ચવાય, કૂવો ઘટક ઘટક રેલાય... કૂવો નસેનસમાં ફેલાય...

ક્યાં છે મારો કૂવો ? ક્યાં છે મારાં ખેતર ? ક્યાં છે મારો શેઢો ? ક્યાં છે મારી વાડ ? ક્યાં છે મારા લ્દેરાતા મોલની સુવાસ ? ક્યાં છે ધરતીમાં પાણી ? ક્યાં છે મારી હરખાતી વાશી ? ક્યાં છે આકાશેથી ઉલેચાતો દરિયો ? હવે તો અક્કરમીનો કાણો થૈ ઱્યો પદિયો ! હું પણ આંગે નેજવાં કરી, ચાસમાં ધુમાડાના ગોટેગોટા લઈને ઊભો છું તમારી વચ્ચાણે – નળની ચકલીમાંથી ક્યારે આવે છે પાણી એની રાહ જોઈ રહ્યો છું... હા, રાહ જોતાં જોતાં આંગોમાં આવે છે પાણી...

આજે તો કૂવાએ લીધો છે ખેતરવટો અને પાણીએ લીધો છે પાતાળવટો ! હવે તો ક્યારેક ક્યારેક કૂવા જેવાં સપનાં આવે છે મારા બૈ....

## પ્રક્રિયા

(૧૧૪) ગુજરાતનાં ખેલરત્નો : જગદીશ બિનીવાલે, ૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૬+૨૭૬,

૩. ૨૦૦/- (૧૧૫) ગુજરાતનાં સાહિત્યકારરત્નો : ડૉ. બેચરભાઈ પટેલ, ૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૨૪૬, ૩. ૧૮૦/- (૧૧૬) ગુજરાતનાં પત્રકાર-રત્નો : દિનેશ દેસાઈ, ૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૫૨, ૩. ૧૧૫/- (૧૧૭) ગુજરાતનાં ગ્રંથરત્નો : બદેયરભાઈ પટેલ, ૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૨૨૪, ૩. ૧૬૦/- (૧૧૮) રંગભૂમિ-પર્વ : હસમુખ

બારાડી, ૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૬૦+ચાર્ટ, ૩. ૧૨૦/- (૧૧૯) પત્રકાર-પર્વ : યાસીન દલાલ, ૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૮૨, ૩. ૧૪૫/- (૧૨૦) પર્યાવરણ-પર્વ : નટવર હેડાઉ, ૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૮+૨૧૬, ૩. ૧૫૦/- (૧૨૧) આદિવાસી-પર્વ : ઠન્ડુકુમાર જાની, ૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૬+૧૫૨, ૩. ૧૧૦/- (૧૨૨) પંચાયત-પર્વ : શિવદાન ગઢવી, ૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૮૮, ૩. ૧૪૫/- (૧૨૩) કૃષિપર્વ : રવીન્દ્ર અંધારિયા, ૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૨૨૦, ૩. ૧૬૦/-



## આસ્તવાદ

પાંચ પે'ગમાં દરિયાસવનું કાવ્યરસપાન ! | રાહીશયામ શર્મા

દરિયાનુભૂતિ : પાંચ કાવ્યો

૧.

દૂર વૃક્ષનાં પક્ષ  
વાળ ફરફરે.  
ચમકતી ટેકરીઓની તેચ  
કપાળ જગમગે.  
ભરપૂર હવાઓ ફૂલેલા આ શઢ  
ફેફસાં બીન બજાવે  
મોજાંનો રવ હળવો હળવો  
ગીત સજ્યું આડકં  
ધીરે ધીરે  
ચાર દિશામાં  
લંબાવું છું  
હાથ  
અને આ પગ  
દરિયો પી ગયો છું.

૨.

‘અહો ! અહો અદ્ભુત આ બધું...  
કેમ રહે છે આંખો તારી બંધ ?’  
માંચી આંખે સૌને ફુહેતો :  
‘દરિયો પી ગયો છું.’

૩.

સંગીત જેવું કરીક વાગે છે  
મીશબતીના ખૂલોથી  
ટપક છાએ  
બોર બોર આંસુ  
કોઈ બે જલાસ મૂકી જાય છે  
સ્થિત વરી  
લળી લળી

હાથમાં ધરે છે મેનુ

‘હોટ વુડ યુ લાઈક ડુ...  
અધવર્યે જ બોલી ઉડુ  
નાણિંગ.’  
નાણિંગ ?  
કોને કહું ?  
દરિયો પી ગયો છું.

૪.

રૂપાળી રેઠ્રેસના  
ધૂજતા હાથમાંથી  
મારી દિશમાં આવી પડે છે  
લોઝ્સ્ટર, પ્રાઉન્સ, કેબ અને ફિશ.  
હું એ બધાંની સામે થોડીક વાર જોઈ રહું છું  
પછી એમ ને એમ બેસી રહું છું  
થોડી થોડી વારે એ આવી આવી જોતી રહે છે  
કહે છે,  
‘ઇઝ ઇટ ઓકે ?’  
હું દિશા સામે તાકી રહું છું...  
થોડી વારે એ ફરી આવે છે,  
‘આર યુ ઓકે ?’  
હું કશ્યું બોલતો નથી.  
‘કેન આઈ બ્રિન્ગ સમચિન્ગ...?’  
હું સર્જણો બોલી બેસું છું  
‘દરિયો.’

૫.

જળાંહળાં રોશનીમાં શહેર આખું ચૂપ  
કેમ છે ?  
વાહનો – રમકડાં !  
કયા રૂપકડા ભૂતલમાં દૂબી રહ્યાં છે ?  
કાનમાં  
કચાંથી આ બૂડું... બૂડું... બૂડું  
અવાજો સંભળ્યાય છે ?  
શહેર આખણાને પૂછું છું

તો કહે છે,  
જવા દે –  
તું દરિયો પી ગયો છું.

કોણ સુમાઈ, બેન્ગાડોક (થાઈલેન્ડ)  
૨૧, ૨૨ ઓફ્સ્કોલર ૨૦૦૮

## પ્રબોધ ૨. જોશી

પાંચ કાલ્યોના સમૂહનું એકત્ર શીર્ષક છે : દરિયાનુભૂતિ.

વિલિયમ જીમ્સે આવી દરિયામય અનુભૂતિનું નામકરણ કરેલું ‘ઓશનિક એક્સપીરિયન્સ’ . પહેલાં ‘આચાર્ય’, પછી ‘ભગવાન’ રૂપે ઘ્યાતનામ બનેલા રજનીશે ‘ઓશો’ નામ આ અર્થમાં ધારણ કરેલું, પ્રાચીન જપાનીઝ ભાષામાં ‘ઓ’નો અર્થ થાય પરમ અહોભાવ, સ્નેહ અને સત્સનાન; જ્યારે ‘શો’નો અર્થ ‘ચેતનાનો સર્વવ્યાપક વિસ્તાર.’

‘દરિયાનુભૂતિ’ના નાયકની ચેતનાનું પરિવ્યાપન ‘ટોપોગ્રાફિકલ’ના સંદર્ભથી સંકલિત થયું છે. એ વિશીષ સ્થાન છે કોણ સુમાઈ, બેન્ગાડોક (થાઈલેન્ડ). તારીખ સાથે પણ સમુદ્રનો અનુભવ જાણો છે.

પાંચ રચનાની અંતિમ ધ્રુવપંક્તિ છે : ‘દરિયો પી ગયો છું.’ આને તકિયા-કલામ પણ કહી શકાય.

પ્રથમ (૧) કૃતિ, કવિનાયકની આત્મલક્ષી અભિવ્યક્તિનો લયવીન નમૂનો છે. કલ્યાણના, કલ્યાણોના ચમકારા સાથે વિભિન્ન ઉપમાઓનું સંરચન તરત ધ્યાન કર્યે છે. દા.ત. દૂર વૃક્ષનાં પણ / વાળ ફરફરે... ચમકતી ટેકરીઓની ટોચ / કપાળ જગમગે.

એક વેન્ટેજ પોઇન્ટ્થી નાયક પરિદશયનું આકલન કેવી રીતે કરે છે ? દૂર ઊભેલાં વૃક્ષનાં પણ સાથે ‘વાળ ફરફરે’ પદ મૂકી જાણે કવિ વૃક્ષનાં પણને વાળની દૂરસ્થ ઉપમા અર્પે છે, પણ તદ્દન એમ નાય હોય. નાયકના પોતાના વાળ પણ શક્ય છે દૂર વૃક્ષનાં પાણ સાથે તાલ મેળવતા હોય. ચમકતી ટેકરીઓની ટોચને કપાળની ઉપમા આપી તે ‘જગમગે’ છે અથવા કપાળને ટેકરીઓની ટોચની ઉપમા દઈ તે જગમગે છે - આવી રચના સહજ સિદ્ધ થઈ રહી છે, અહીં. ઉપમા કર્મ પ્રકૃતિની સાથે તેમજ નાયકની સમાનતરે વિવિધ રીતિએ સામોસામ પરસ્પરને ઉંડળમાં લે છે. આ ભાવકની પસંદીદા પંક્તિ છે :

ભરપૂર હવાએ ફૂલેલા આ શઢ  
ફેફસાં બીન બજાયે.

વૃક્ષરાજિ, ટેકરીઓ પરથી સરી કેમેરાનેત્ર ‘આ શઢ’ના ઉલ્લેખથી ભાવકને દરિયાદેવના વાહણ વહાણ તરફ લાવે છે, છતાં શિત્રાત્મકતા સાથે વર્ણન પૂરું નથી થતું, આગળ સંગીતતવાદ્યાનો પ્રેવેશ થાય છે, ‘ફેફસાં બીન બજાયે.’ તેના ફેફસાં બીન બજાયે ? નાયકનાં કે નાવનાં ? ભાવકો માટે અનુમાનનો અવકાશ છે. એની તો મજા છે. બીનના સંગીત પછી ગીતની ઉપસ્થિતિ સ્વાભાવિક, એટલે કરી રચાઈ : ‘ભોજાંનો રવ હળવો હળવો / ગીત સજ્જાં આર્ડંઠ.’ પરિવ્યાપન ધીરે ધીરે વિકરે છે પદબન્ધાર્પૂર્વક : ધીરે ધીરે / ચારે દિશામાં / લંબાવું છું / હાથ / અને આ પગ. (આપણી ભાષામાં એક પ્રયોગ છે જે અહીં વિભિન્ન રીતે પ્રસ્તુત છે : પેટમાં પેસીને પગ પહોળા કરે... ) ચતુર્દિશામાં નાયકને હાથપગ

લંબાવવા પડ્યા કયા કારણો ? નાયકને સંગીતપણે લાગ્યું તેનું વિશ્વાપન તત્કષણ કરે છે : ‘દરિયો પી ગયો છું.’

૧લી રચના એક સ્વયંસંપૂર્ણ કાવ્ય રૂપે નિર્વાચ, પણ ત્યાર પછીની રીતિગતિ ખાસ તો પ્રથમ કૃતિની વિસ્તૃતિ સમી છે.

રજમાં દરિયાનુભૂતિ ‘અહીં અદ્ભુત આ બધું’ જેવી કરીઓમાં ‘અહો રૂપમ્’ (મીચેલી આંખે સ્તો) વિલસે છે, અને એમ તજ કૃતિમાં ‘અહો ધ્વનિ’ રૂપે વિસ્તરે છે - દા.,ત. ‘સંગીત જેવું કંઈક વાગે છે’ કેન્દ્રલ લાઈટ ડિનરના કરુણ પરિવેશનો વિનિયોગ જચ્ચી ગયો, ભલે આંસુનો ઉદ્દેશ સ્પષ્ટ નથી કથ્યો.

‘ભીજાબન્તીના ખૂબોથી

ટપકે છે

બોર બોર આંસુ’

બાકી ‘નથિંગ’ના ઉદ્ગાર સાભિત્રાય.

૪થી રચનામાં રૂપાળી વેઈટ્રેસ નાયકની અસમંજસતા માપી પૂછે છે, ‘ઠિઝ ઠિઝ ઓકે ?’ બીજી વાર - ‘આર યુ ઓકે ?’ નાયક કશું બોલતો નથી પણ પેલી ‘કેન આઈ બ્રિન્ગ સમયિના...?’ ત્રીજી વાર પૂછે છે એની સાથે નાયક ‘સફાળો બોલી’ બેસે છે : ‘દરિયો’ - એ પદવિન્યાસ અનોખો છે.

પમી રચનાનો વળાંક અચાનક ચોકાવી મારે એવા વર્ણનથી વિભૂષિત છે. આપું શહેર ચૂપ, વાહનો - રમકડાં ‘કોઈ રૂપકડા ભૂતલમાં રૂભી રથાં છે ?’ નાયકના કણ્ણરન્ધ્રમાં બૂઝું બૂઝું... બૂઝું... અવાજો, નથી રહેવાતું ત્યારે તે શહેર આખાને પૂછે છે ત્યારે જળાંહળાં રોશનીવાળું એ કહે છે : ‘જવા દે, તું દરિયો પી ગયો છું.’

એક કાવ્યસર્જકની આત્મમન દરિયાઈ અનુભૂતિ, રચનાની કલાયમેકસમાં જાણે કે સમસ્ત શહેરની પ્રતીતિમાં પલવાઈ જાય છે. પ્રાસ-અનુપ્રાસના મોહને વર્જી, આશર્થચીહ્નોની, વિરામચીહ્નોની માયા મેલી એક સણું અનુભૂતિને પાંચ બંડમાં આખંડત્વ બક્ષવા માટે કરી પબોધ ૨. જોશી સાશ્વતવાદના અધિકારી છે.

(૨)

લોડ બાયરને પણ દરિયાને એની રીતે કેવો નીરખ્યો હતો તે અહીં કાવ્યરસિકોને વાંચવો ગમશે.

*And I have loved thee, ocean !*

*and my Joy / of youthful sports was  
on thy breast to be / Bornes like thy bubbles  
onward : from a boy /  
I wantedon with thy breakers.*

(Childe Harold's Pilgrimage IV. (ixxviv)

૧

## નવતર ગુજરાતી મુદ્રા અંકિત કરતી રચના | ભાનુપ્રસાદ પંડ્યા

નવી ગુજરાતી ગુજરાતમાંથી પસાર થઈએ તો એનાં અનેક નવતર લક્ષણો જોઈ શકાશે. ગુજરાતસંરચનાની લાક્ષણિકતાઓ અને એના મિજાજને પોતાની રીતે જાળવીને પણ એ ‘શુદ્ધકવિતા’ (Pure Poetry) બનવા પ્રતિ ગતિ કરે છે. નાજુક-મુલાયમ અને તરલ-દુતિલ ભાવસ્પંદનોને એ અવનવાં કલ્યાણમાં રજૂ કરે છે. જૂની ગુજરાતી માફક એ હવે સંદે ચોટ દ્વારા માત્ર તાણી ઉઘરાવવાની પણ અપેક્ષા નથી રાખતી ! વળી અર્થાન્તરન્યાસી બોધ કે દદ્ધાન્તનિન્બર તથ્ય તારવી આપવાની ઝંગતમાં પણ નથી પડતી. પોતાનો શેઅર અવતરણક્ષમ (Quotable) બને એની પરવા પણ કવિને નથી ! પોતાની સંવેદનક્ષણને પૂરી સર્જકતાથી આકારિત કરવા કવિ તત્પર હોય છે. રદીફ જાળવે પણ કાફિયાના ઉચ્ચારસામ્યને તજી એ માત્ર એનું લગાત્મક વજન સાચવવા પ્રયાસ કરે ! ટૂંકમાં, અરબી-ઉર્દૂ ગુજરાતીમાં નવા-અવતારે તાજગી પ્રસારતી કોઈ કલગી પુષ્પછોડની સોડમ પાથરે છે ! આનાં અનેક ઉદાહરણો આપણી ગુજરાતમાંથી મળશે, પણ અહીં આપણે એક ગુજરાતના રસાત્મક અંશોને માણસ્તાં ઉપરની વ્યાસ્તિઓની પ્રતીતિ કરીએ.

### ગુજરાત કરે

આંસુ અવાજો ના કરે, ઘોંઘાટ કેવળ જળ કરે,  
ઘર તો સંદે ધ્યાનસ્થ છે, ઉત્પાત સૌ સાંકળ કરે.  
  
વરસાદ ફૂલોને સંદે નવડાવતો આનંદથી,  
શાંગારવાનું કામ અને પ્રેમથી જાકળ કરે.  
  
કેવા સીતમ યુગથી થયા ઈતિહાસમાં કયાં નોંધ છે ?  
ધૂતરાષ્ટ્ર જેવો છે સમય ફરિયાદ કોને પળ કરે ?  
  
આકાશને જામીન પર છોડાવવાનું થાય તો  
જામીન અરજ પર સહી સૌ પ્રથમ વાઢળ કરે.  
  
છે આપણા હાથમાં કેવળ સળી ને સાળ આ,  
કાપડ વણીને આપવાનું કામ તો શામળ કરે.  
  
હર પાંખ પાસેથી મળે આકાશની સંઘળી વીગત,  
કયાં છે નરક ? છે સ્વર્ગ કયાં માનવ હજુ અટકળ કરે.  
  
થોથાં બધાં પદ્ધરાવતું આ શાબ્દ તો અંધાર છે,  
એવું અલૌકિક પામે ‘ધૂની’ જે તને ઝાળળ કરે !

[‘ગુજરાત’ દી. અંક-૨૦૬૩]

- ‘ધૂની’ માંડલિયા

આ ગુજરાતનામાં કવિએ મત્તવાના શેઅરથી જે સૂક્ષ્મ-બારીક નિરૂપણ છટા દાખવી છે, તેમાં આપણાને રજૂઆતની નિરાળી ખૂબી (અંકાજે-બયાં) પ્રતીત થાય છે. તેમજો જરાય બોલકા (Loud) થયા વના થોડાં કલ્યાણ યોજને વિભિન્ન સંકેતો કર્યા છે. પ્રકૃતિ, પુરાણ,

ઈતિહાસના સંદર્ભો આવે છે, પણ તેમાં કયાંય આવેગ, આકોશ, મુખરત્વ જોવા નથી મળતાં, પણ ગુજરાતના શ્રોતા, વાચક કે ભાવકને પ્રત્યેક શેઅર પાસે થંભીને – થોભીને એમાંના મર્મ તથા ચિત્તગુણને પામવા તત્પર કરે છે.

ગુજરાતકારને ‘ઘોંઘાટ’ અને ‘ઉત્પાત’ – અવાજ – એ બંને વિશે કંઈક સંકેત આપવો છે, પણ એ માટે તેઓ સીધું કથન નથી કરતા પણ ‘આંસુ’ અને ‘જળ’ને સામસામે મૂકે છે. આંસુ ‘મૂગી વેદના’ રૂપે ચૂપચાપ વહી જાય છે, પણ જળ ‘સામુહિક સંખર્ણ’નું બળ બને, ઘોંઘાટ કરે. સમાજમાં અકલ ખૂલાણાં અશ્વુ છે, તો સંઘશક્તિના ઘોંઘાટ રૂપે જળ પણ ખૂલાણે છે ! સહદ્યભાવકને આવો મર્મ લેવો હોય તો લે, પણ કવિનો માત્ર દશ્ય કલ્યાણ સર્જે છે ! એ જ રીતે એકલું ઘર શાંત હોય, પણ સાંકળનો ઉત્પાત કે ઘોંઘાટ અવરજવરનો ‘ઉત્પાત’ મચાવે ! આપણી ગુજરાત એના રૂપ ભાવનિરૂપણને છાંડીને હવે સૂક્ષ્મ-શુદ્ધ-સૌંદર્યલક્ષી ભાવનાલેખનને માર્ગ કેવી ગતિ કરી રહી છે, તેની અહીં જાંખી થાય છે. અહીં કવિએ ‘ઔન’ અને ‘અવાજ’ વચ્ચેનો બેદ અત્યંત લાઘવમાં સૂચિત કર્યો છે. કલ્યાણનું વિરોધાત્મક તુલ્યબળ ક્રોશલ દાખવે છે.

હજુ ગુજરાતમાં આગળ વધતાં આ ‘ગતિશીલતા’ અને ‘નીરવતા’ને વિશેષ રૂપાયિત કરવા પુનઃ પ્રકૃતિનાં બે દશ્યકલ્યાણો(Visual Images)ને રજૂ કર્યો છે : ફૂલોને આનંદથી નવડાવતો વરસાદ ધોધમાર હોય, એના જાપણ સંભળાય, પણ પુષ્પો પર ધીરે ધીરે સરકી – બાજી જતાં જાકળબિદ્ધ અશબ્દ હોય છે ! એક નવડાવે છે, તો અન્ય ફૂલોને શાંગારે છે ! બેદ વચ્ચેનો સૂક્ષ્મ વિરોધ આપણાને ચમત્કારનો અનુભવ કરાવે છે.

ગુજરાતકારની ઇબારતમાં ચિત્તગુણ, દશ્યાંકની શક્તિ વિશેષ પ્રગટે છે. ગુજરાતની પરિભાષામાં જેને ‘મુલાકાત’ કહી શકાય, તેની જલક પ્રભાવક રીતે રજૂ થાય છે. આથી એમાંણે જે વસ્તુલક્ષી સંદર્ભો (Objective References) યોજ્યા છે, તે તેમના મિજાજને સહજતાથી અંકિત કરે છે.

‘આંસુ’, ‘જળ’, ‘સાંકળા’, ‘વરસાદ’, ‘જાકળ’ એ સર્વમાં ઠિન્ડિયગોચરતા છે. એની સાથે જ ગુજરાતમાં આવશ્યક એવાં તત્ત્વો ‘લાઘવ’, ‘વિરોધ’ અને ‘સંકેતાત્મકતા’નો પણ આસાનીથી પ્રયોગ થયો છે.

કવિનું સંપદિત ચિત્ત હવે ઈતિહાસ-પુરાણના સંદર્ભોનો આશ્રય લે છે. આધુનિક ગુજરાત ‘મીથ’, ‘આદિમિભબ’નો પણ અન્ય કાલ્યપ્રકારોની જેમ વિનિયોગ સાધે છે :

**કેવા સીતમ યુગથી થયા ઈતિહાસમાં કયાં નોંધ છે ?  
ધૂતરાષ્ટ્ર જેવો છે સમય ફરિયાદ કોને પળ કરે ?**

સમયના મૌનને ‘ધૂતરાષ્ટ્ર’ જેવા પૌરાણિક સંદર્ભ વિના કઈ રીતે સૂચવી શકાયું હોત ? ‘સીતમ’ અને ‘ધૂતરાષ્ટ્ર’ પછી ‘ફરિયાદ કોને પળ કરે ?’માં ‘પળ’નો નિર્દેશ થતાં દ્રૌપદી કેવી સંકેતાય છે ? પણ યુગોથી આ બધું ચાલ્યું આવે છે, તે જોતાં ‘મીથ’ દ્વારા કવિએ સપ્તત્યની સહજ રીતે જ સ્થાપના કરી લીધી છે. ‘યુગ’, ‘ઈતિહાસ’, ‘સમય’ અને ‘પળ’ એ સર્વમાં કાળજીનાં પરિમાળોને કમશા : સંયોજી લઈને ગુજરાતારે બે જ મિસરામાં મોટી સફર જેડી બતાવી છે ! આપણે અહીં સંકેતોનું અર્થધાન્ત નથી કરવું, કવિના કલાત્મક અંશોને ઉદ્ઘાટિત કરતાં એને આસ્વાદીએ છીએ. ગુજરાતનો શેઅર એના લઘુફલકમાં મોટી

શાળ ભરી શકે છે, તે અહીં જોઈ શકાશે.

કોઈ પણ કાચ્યમાં કેટલીક વાર કલ્પનાની ઉડાન સાથે તરંગલીલા (Fancy) પણ દેખા દે બરી ! આ રચનામાં પણ ચોથા શેરારમાં તરંગની ટૂંકી ચાલની છયા જોવા મળે છે. આકાશ જો ચારેકોરથી ઘેરાઈ ગયું હોય, તો એને કોણ છોડાવે ? કવિએ તરંગ ચલાવ્યો કે એવા નિરફ્ફતાર થયેલા આકાશને છોડાવવા જામીનખત ઉપર વાઢળાએ જ પ્રથમ 'સહી કરવી પડે ! ગજલકારને 'વાઢળ'નો કહ્યા સૂઝી આવ્યો અને એને તરંગછથાથી ચાલાકીપૂર્વક પેશ કરી દીધો ! અલબત્ત, શેર આપણને ગમે છે, એનું કારણ એ છે કે તરંગ-ફેન્સીને પણ તેનું સૌદર્ય હોય છે, પછી ભવે એમાંનાં ઉપમાનો, કલ્પનો પૂરું રસાયણ ન પામ્યાં હોય !

પાંચમાં શેરારથી ગજલકાર સંસારિક સંદર્ભથી અળગા થઈ, કોઈ પારલૌકિક પ્રદેશ ભષી મીટ માંડતા દેખાય છે. એમનું ભાવક્ષેત્ર સમાંતર (હોરિઝન્ટલ) ઓંણું અને ઊર્ધ્વલક્ષી (વર્ટિકલ) વિશેષ બની રહ્યું હોય એવું લાગે. ગજલની એ ખૂલ્લી છે કે એના એક વળોટમાં એનો શેરાર 'સ્વતંત્ર એકમ' બનીને અવતરણક્ષમતા દ્વારાવે. મનુષ્યની શક્તિ અને એનાં ટંચાં સાધનો એકત્ર થઈને એ પ્રક્રિયા એક પૂર્ણ કાર્ય તરીકે નીપળ આવે તેની પાછળ કોઈ અજ્ઞાત પરિબળ હોઈ શકે. આવી સંભાવના આપણને આ પંક્તિઓ પર પ્રગતાની દેખાય.

**છે આપણા હાથમાં કેવળ સળી ને સાળ આ,  
કાપડ વણીને આપવાનું કામ તો શામળ કરે.**

જોકે અહીં આપણો આપણા અસ્તિત્વના વૈચિચ્ચનો પણ વિચાર કરવાનો રહે, બધી સામગ્રી હાજર હોવા છતાં જીવનની આકસ્મિકતા એવી છે કે ધારણા મુજબ કશું સંપન્ન ન થાય !

ગજલના અંતિમ બંને શેરારમાં કવિચિત્તની ગતિ હવે અધ્યાત્મની દિશા ('મારિફત') પ્રતિ થતી જોઈ શકાશે. 'સ્વર્ગ', 'નરક'ના ખ્યાલને તેઓ એક અટકળ ગણે છે, જ્યારે આકાશમાં ઉડતાં પંખીઓની અનાયાસ ઊર્ધ્વગિતમાં તેમને મુક્તિનો સહજ આનંદ હશે એમ લાગે છે. પરંતુ 'આકાશની સંઘળી વિગત' અને તેમણે કરેલી 'સ્વર્ગ', 'નરક'ની સામ્યલક્ષી તુલના વચ્ચે અનુબંધ પ્રતીત થતો નથી. આથી પેલી 'વિગત' અને 'સ્વર્ગ', 'નરક'ની અટકળ કંઈક વાયવ્ય રહી જાય છે ! ગજલમાં સાની મિસરા અને ઉલા મિસરા વચ્ચે કોઈ પ્રતીતિકર સામ્ય, અનુમાન, દાવા-દલીલનું ઉચિત અનુસંધાન અપેક્ષિત છે. જ્યારે એ ન હોય ત્યારે સર્મર્થ ગજલકારનું ક્રોશલ પણ ઊંણું ઉઠતે છે. મક્તાના અંતિમ શેરારમાં તો કવિએ શબ્દને પણ એક 'આવરણ' ગળીને અલોકિક તત્ત્વને પામીને તેજોમય બનવાની જંખના સેવી છે. 'ગાગાલગા'નાં ચાર લગાત્મક આવર્તનોની સંબિ સમગ્રતયા જળવી શકાઈ છે. ચાર રૂક્ખનું લગાત્મક સ્વરૂપ ધરાવતા 'રજૂઝ'નો પ્રયોગ સફાઈપૂર્વક થયો છે. આ બહેર પિંગળના માત્ર મેળી હરિગીત છંદ સાથે સામ્ય ધરાવે છે પણ એકરૂપતા તેમાં નથી, કેમકે ગજલની બહેરમાં વજન સંવિ પર હોય છે ! એ ચર્ચા જવા દઈએ, પણ આ રચનામાં 'રજૂઝ'ના મુસ્તફિલુલુનાં આવર્તનો જળવાયાં છે. કવિએ વધારાના શબ્દો - 'ભરતીના શબ્દો'નો પણ વિશેષ પ્રયોગ કર્યો નથી.

'ધૂની' માંડલિયા ઉપનામધારી કવિશ્રી અરવિંદ શાહની આ ગજલકૃતિના નાનાર્થોને - ભાવાર્થોને સ્કુટ કરતાં આનંદ થાય છે. સહદ્યને એનાં દલેદલ ખોલતાં હદ્યમનનનાં દલો પણ ખૂલતાં અનુભવાય છે. ગજલની ઈલારત પણ તત્ત્વમાં - તદ્દ્બવી મુદ્રાનું વૈવિધ્ય દ્વારાવે છે. આધુનિક ગજલની તાસીરનો એમાં સંદ્ર અનુભવ થાય છે.

૧

### પ્રક્રિયા

(૧૨૪) વિશાન પર્વ : ડૉ. સુશ્રુત પટેલ, ૨૦૦૮, ગુજર્ાત

ગ્રંથરલન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૪૮, રૂ. ૧૦૦/-

(૧૨૫) ઉત્સવપર્વ : કમલેશ ચાવડા, ૨૦૦૮, ગુજર્ાત ગ્રંથરલન  
કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૬+૧૬૮, રૂ. ૧૩૦/- (૧૨૬)

ગ્રામપર્વ : માણેકલાલ પટેલ, ૨૦૦૮, ગુજર્ાત ગ્રંથરલન કાર્યાલય,  
અમદાવાદ, પૃ. ૧૨+૧૧૨, રૂ. ૮૦/- (૧૨૭) દુર્ઘાપર્વ : હસમુખ

દેસાઈ, ૨૦૦૮, ગુજર્ાત ગ્રંથરલન કાર્યાલય, અમદાવાદ, પૃ.

૧૨+૧૬૮, રૂ. ૧૨૫/- (૧૨૮) વિતપર્વ : ડૉ. રોહિત શુક્લ, ૨૦૦૮, ગુજર્ાત ગ્રંથરલન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૮૦, રૂ. ૧૩૫/- (૧૨૯) યાત્રા-પર્વ : વાતીભાઈ જોશી, ૨૦૦૮, ગુજર્ાત  
ગ્રંથરલન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૨૮, રૂ. ૧૦૦/-

(૧૩૦) ન્યાયપર્વ : ચિનમય જાની, ૨૦૦૮, ગુજર્ાત ગ્રંથરલન  
કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૩૨, રૂ. ૧૦૦/- (૧૩૧)

ગુજરાતનાં નારી-રત્નો : મીનાક્ષી ઠાકર, ૨૦૦૮, ગુજર્ાત ગ્રંથરલન  
કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૨૪૦, રૂ. ૧૭૫/- (૧૩૨) બરાક

ઓબામા : બદલાતા વિશનો સક્ષેપ પાસવર્વ : સંજ્ય આવટે, અનુ. ગીતા ગૌડ, ૨૦૦૮, ગુજર્ાત ગ્રંથરલન કાર્યાલય, અમદાવાદ,  
પૃ. ૧૮+૨૪૮, રૂ. ૩૦૦/- (૧૩૩) બાળયોગી ચેતનાનું સંક્ષિપ્ત

જીવનવૃત્તાંત : દેવન્દ હ. ભણ, 'અજ્ઞાત', ૨૦૦૬, શ્રીમતી તોલર  
ડી. ભણ, પ્લોટ નં. ૫૮૦/૨, સેક્ટર ૩/સી, ગાંધીનગર, પૃ. ૬૪,

રૂ. ૧૨/- (૧૩૪) ગુજરાત અર્ધશતાબ્દી અને... : સંપાદક  
યશવન્ત મહેતા, ગુજર્ાત ગ્રંથરલન કાર્યાલય, અમદાવાદ, પૃ.

૧૪+૨૪૮, રૂ. ૧૭૫/- (૧૩૫) અમેરિકાના આંગણો : ડૉ.  
અભિના અલી તાઈ, ૨૦૦૮, ગડત વિકાસ ટ્રસ્ટ, ગડત, પૃ.

૧૪+૧૨૪, રૂ. ૧૨૦/-.



અત્યંત સહનશીલ, બુદ્ધિશાળી રહી  
ધરતી શી ક્ષમાવાન  
પાંડવોના સંસારમાં રમમાણ  
દુઃખને હદ્યમાં દાટી  
ધીરે ધીરે થઈ ગઈ શાંત  
આશ્ર્ય પ્રસર્યું તારું  
પ્રસ્થાપિત થઈ ઠન્દપ્રસ્થની કલ્યાણી  
અદ્ભુતીય વ્યક્તિત્વ તારું  
પ્રેમથી આદકેનું કર્તવ્ય કરી બતાવ્યું  
રાજસ્નીઓ અચ્યાબિત  
કહેતી રહી  
કેટલી નિષ્ઠાવાન !  
એનાં વાણી-વર્તનનો જાહુ કેવો ?  
ને ભૂગ્યવાન પણ  
સંસાર કદ્દી દેખાડ્યો સોનાનો  
પાંચ દેવોની પતિક્રતા  
પણ સખી,  
મને વિસ્મિત કરે છે  
તારી આ કથા  
આ પ્રેમનો સંસાર નહોતો  
તું તો સ્વયં યાશસેની  
પંચવતનો સંકલ્પ કરીને  
પાંડવોને અણંડ રાખ્યા  
સહનશીલતાની પરમાવધિ  
તારા અસ્તિત્વમાં સિધ્યર થઈ ગઈ દીવા જેવી  
પરંતુ  
કોઈ જાણી શક્યું નહીં  
પાણી કલકલતું રહે આપણાસ

ને તોય ટાપુ આત્મમળન, એકાડી  
તારી બેચેન નજરથી

કીને ખબર  
ઘનશ્યામ આકાશમાં શું શોધી રહી છે તું ?

શ્રી મીરાં તારળેકર જી. એસ. એસ. મહાવિદ્યાલયમાં (બેલગાંવ) મરાಠીનાં પ્રોફેસર છે. લગભગ પંદરથી વધુ પુરસ્કાર અને આકથી વધુ કાલ્યસંગ્રહો સાચે 'સાંભળ હે દ્રૌપદી !' એમનો આગવો કાલ્યસંગ્રહ છે. લગભગ ૫૦ કવિતાઓ દ્રૌપદીને સંબોધિને આજની નારીના હદ્યમાંથી નીકળતા સંવેદનને વક્તા કરે છે. ૨૦૦૫માં લખાયેલી આ કવિતાઓ મરાಠી ભાષાની ઉત્તમ કવિતાઓમાં ગણાય છે.

૧



### બાળસાહિત્ય

(૧૧૧) પર્વતની ટોચે : ક્રિતિદા બ્રહ્મભક્ત, ૨૦૦૮, ખાંડ  
નં. ૪૬૨/૨/એ, સેક્ટર ૬/એ, ગાંધીનગર, પૂ. ૧૨+૬૮, રૂ. ૮૦/-  
કવિતા

(૧૩૬) મોંદેરી મિરાત મીરાં : પ્રસ્તુતિ પ્રદીપ રાવલ,  
૨૦૦૮, પ્રવીણ પબ્લિકેશન, રાજકોટ, પૂ. ૩૨૦, રૂ. ૨૫૦/-  
(૧૩૭) છીપમાં મોતી : ડૉ. રશિમ ત્રિવેણી, પ્રકા. ભરતભાઈ ભણ,  
૩૦૩, ઠન્દપ્રસ્થ એપાર્ટમેન્ટ, તિંદરા જાકાટનાકા, જલાલપોર,  
નવસારી, પૂ. ૮૪૫૫, રૂ. ૧૦૦/- (૧૩૮) તત્ત્વ ૧૧૧ ગાજલ : લક્ષ્મી  
ડોબરિયા, હિનેશ કાનાણી, રાકેશ હાંસદિયા, ૨૦૧૦, પ્રકા. હિનેશ  
કાનાણી, શ્રીરામ, ૭, નારાયણનગર, ફેનર કોલોની, રાજકોટ-૬,  
રૂ. ૧૧૧/- (૧૩૯) હું નિર્મિશા : નિર્મિશા ઠાકર, ૨૦૦૮, રનાંદે  
પ્રકાશન, અમદાવાદ, પૂ. ૧૬+૬૦, રૂ. ૪૦/- (૧૪૦) મે કહી  
કાનમાં જે વાત તને : ભરત વિન્દુડા, ૨૦૦૮, ડિવાઈન  
પબ્લિકેશન્સ, ગાંધીરોડ, અમદાવાદ, પૂ. ૧૦+૧૦૨, રૂ. ૭૦/-.

### નવલિકા

(૧૪૧) સુખના સુખડ જલો રે મનવા : ડૉ. અભિયાસ અલી  
તાઈ, ૨૦૦૮, ગહત વિકાસ ટ્રસ્ટ, ગડત, પૂ. ૮૪૮૨, રૂ. ૧૦૦/-

(૧૪૨) ક્રૂખ : રાઘવજી માધ્યાદ, ૨૦૦૮, રનાંદે પ્રકાશન,  
અમદાવાદ, પૂ. ૪૪૧૩૨, રૂ. ૭૦/- (૧૪૩) જુંગલેશ્વર નામનું એક

મહાવિદ્યાલય : બહાદુરભાઈ જ. વાંક, ૨૦૦૮, ભરાડ ફાઉન્ડેશન,  
રાજકોટ, પૂ. ૧૨૮, રૂ. ૮૮/-

અભ્યાસ

## કવિ કલાપીના જીવન-કવનની સર્વીંગ છબી રાજવી કવિ કલાપી

ગંભીરસિંહ ગોહિલ

સર્જકતા જીવન, સમગ્ર સર્જન અને તેના આંતરસત્ત્વને કલાદેહ આપી તેને નાટ્ય રૂપે રજૂ કરવું તે ઘણું અધરું કામ છે. બાકીના ડાકોર સુરસિંહજી તખ્સિંહજી ગોહિલ ‘કલાપી’ વિશે ‘રાજવી કવિ કલાપી’ નામની નાટ્યકૃતિ આપીને ડૉ. ધનવંત શાહે તે અધરું કામ સિદ્ધ કર્યું છે. ડૉ. નરેશ વેદ કહે છે તેમ તેમજે નાટકની અધરી કલા, જીવનચિત્રિતાત્મક નાટકની વળી એક વધુ અધરી કલા અને કલાપીના જીવન ઉપર નાટક લખવાની સવિરોધ અધરી કલા એમ ગ્રાન્ડ કઠિન પ્રયાસોની ટૂકો સર કરી છે.

કેવળ અંગત અનુભવ સાહિત્યની કોટિએ પહોંચી શકતો નથી. પરંતુ કવિ કલાપીની વાત જુદી હતી. તેઓનું તો ખૂદ જીવન જ કાવ્યરૂપ પામેલું હતું. તેમના જીવનને કાવ્યથી અલગ રીતે કે કાવ્યને તેમના જીવનથી મિન્ન રીતે જોવાનું શક્ય નથી. તેમનું જીવન અટપટા અનેક રંગો અને ભાવોથી રસિત થયેલું હતું. તેમને અને તેમના કાવ્યને અભૂતપૂર્વ લોકપ્રિયતા મળેલી હતી. તેમનો કાવ્યસંગ્રહ ‘કલાપીના ડેકારવ’ કવિ કાન્તના સંપાદન ડેઢાં ૧૯૭૦નાં બહાર પડ્યો તે પછીથી તેની ૧૬ આવ્યુતીઓ થઈ છે જે ગુજરાતી કવિતાની અનન્ય ઘટના છે. આમ છતાં કલાપી પ્રશંસાઓ અને ટીકાઓથી ઘેરાયેલા રહ્યા હતા. તેઓ તો પોતાને કવિ ગણતા જ નહિ તે તેમની નમ્રતા હતી. તેમની અનેક કાવ્યપક્ષિતીઓ કહેવતરૂપ બની ગઈ છે અને કાવ્યપ્રેમીઓના કંઠાભરણ રૂપે આજે પણ શોભે છે.

કલાપીના જન્મ, ખવાસ દાસી મોંધી – શોભના સાથે પ્રેમ અને લગ્ન, તેઓ રાજબીજ હતા કે નહિ, તેમનું મૃત્યુ, તેમનું સાહિત્યસર્જન એ તમામ બાબતો આસપાસ રહસ્યનાં વાદળો છવાયેલાં છે. કલાપીને રાજ્યસત્તાનો મોહ નહોતો. અનેક વખત ગાદીત્યાગ માટે તૈયારીઓ કરેલી. તેમનું કુંબજીવન અનેક ખટપટોથી ઘેરાયેલું હતું. તેમના ગાદીત્યાગ માટે નિશ્ચિત રીતે તૈયારીઓ ચાલતી હતી. ત્યારે જ તેમનું આકસ્મિક જ્ઞાય તેવા સંજોગોમાં અવસાન થયું. તેમનાં બે રાણીઓ, પૈકી કોટાવાળાં, આનંદીબા, પટરાણી, હતાં, પણ બુદ્ધિકુશળતાથી કચ્છ રોહાવાળાં રમાબાએ મહત્વાનું સ્થાન અંકે કર્યું હતું. કલાપીને તેમના પ્રત્યે ગાઢ પ્રેમ હતો. ઘણાં કાબ્યો તેમને સંબોધીને લખાયેલાં. પણ રમાને સત્તા, વૈભવ અને ખટપટોનો શોખ હતો. કલાપી માટે તે ગમતી વાત નહોતી. જ્યારે રમાને સુરસિંહનાં ગાદીત્યાગની કાર્યવાહી, શોભના પ્રત્યે પ્રેમ અને લગ્ન વગેરે પસંદ નહોતાં.

ડૉ. ધનવંતભાઈએ આ પરંપરાગત ઘટનાઓથી આગળ વધી જતે અભ્યાસ અને સંશોધન દ્વારા અનેક રહસ્યો ખુલ્લાં કરવા પ્રયાસ કર્યો છે. કલાપીનાં સ્વજનો પૌત્ર કુમારશ્રી મંગળસિંહજી, પૌત્રવધુ પ્રવીષકુવરબા, મુલભીના પૂર્વ પોલીસ કમિશનર અને ભગ્રીજ પ્રવીષસિંહજી વગેરેની મુલાકાત લઈને અને ડૉ. રમેશ શુક્લનાં સંશોધનોના અંશોને પણ ધ્યાનમાં લઈને તેમજે કલાપીના જીવન અને સર્જનને સુગ્રથિતા અને અવિકૃતતા આપ્યાં

છે. લેખકે કલાપીના સમગ્ર સાહિત્યનું સઘન અધ્યયન કરીને તેના સર્વ અંશોને નાટ્યરચનામાં ગુંધી લેવાનો પુરુષાર્થ કર્યો છે. તે એટલી હદે કે દરેક દશ્યના અંતે કાબ્યો, ગંધરવનાઓ અને પગોના સંદર્ભો જીવાયપૂર્વક રજૂ કર્યા છે.

જેને લેખક પ્રેમ, પ્રથા અને વ્યથાની નાટ્યકથા તરીકે ઓળખાવે છે તેવી આ ઉંંકો અને ઉંચ દશ્યોમાં વિભાજિત થયેલી રચના છે. તેને ચીલાચાલુ રંગભૂમિના સમયબંધનમાં કાટલાંથી મૂલવી ન શકાય. વર્તમાન રંગભૂમિની જરૂરિયાતોને વશ વર્તીને કુશળ ડિંદર્શક રેમાં કાપકૂપ કરીને પ્રેક્ષકોને અનુકૂળ નવવિધાન કંડારી કાઢે તે અલગ વાત છે. પરંતુ કૃતિના ભાવકને તે રચના કલાપીના આંતરબાધ્ય જીવનસંગ્રહનો યથોચિત આસ્વાદ કરાવવા સક્ષમ બની રહી છે.

અસરકારક દશ્યાંકન અને રંગભૂમિને અનુરૂપ રચનાવિધાન માટે લેખકે પૂરતી કાળજી લીધી છે. સંસ્કૃત નાટક અને વ્યવસાયી રંગભૂમિની કેટલીક પ્રથાઓ તેમજે ખપમાં લીધી છે. કાબ્યો અને ગંધરવાનોં પઠન, પાત્ર અને પરિસ્થિતિનો પરિચય, આગળપાછળના બનાવોની સંગતિ અને નાટ્યનાયકના વ્યક્તિત્વના ઉઠાવ માટે તખતાની બંને બાજુ બે નાના રંગમંચ નિર્દેશી તેના પર સૂત્રધાર અને નાટી ઊભા રહી વાતર્લાપ કરે તેવી નાટ્યપ્રયુક્તિ લેખક યોજી છે. કલાપીના કાબ્યોનો જ આધાર લઈને પ્રેમ તથા વિરહ તેમજ નિરીદેવી તથા પ્રીતિદેવીનું પ્રતીકવિધાન લેખક કુશળતાથી કરેલ છે. પ્રસંગને અનુરૂપ રંગમંચની સજજતા અને પ્રકાશઆપોજન તેમજે ખૂબીપૂર્વક નિર્દેશયાં છે.

જીવાને આ પારદર્શાનું નાયક જરૂરી તેવા ઉપરાંત શિંતનશીલ મર્જક લોવાથી ખસંગો અને વીગતો સાથે કાવ્યપક્ષિતીઓ અને ગંધરવાનોની ફૂલગંધૂણી કરવામાં આવી છે. સુરસિંહના જીવનમાં શોભના સાથે પ્રશય અને લગ્ન અગત્યનું સ્થાન ધરાવતાં હોવાથી પહેલા જ પ્રવેશમાં, રમા સાથે આવેલી સાતાના દાસી મોંધી દ્વારા કચ્છી બોલીમાં રાસ રજૂ કરવામાં આવ્યો છે. સુરસિંહ તેને ભાજાવવા, સંસ્કારવા અને કાવ્યપઠન કરવાનું શરૂ કરાવી દે છે. એક દશ્યમાં તો ૧૯૭૩નું લાટી મુકામે મળેલું ગુજરાતી સાહિત્ય પરિષદું સંમેલન અને તેના પ્રમુખ ફૂલગંધાલ મોહનલાલ જેવેરીને દર્શાવવામાં આવ્યા છે. તે ઉપરાંત કવિ કાન્ત, મસ્તકવિ, સાગર મહારાજ, રૂપશંકર ઓઝા ‘સંચિત’ વગેરેના પાત્રપ્રવેશ સાથે સૂત્રધાર અને નાટી નાટકનો પ્રાસ્તાવિક પરિચયવિધિ પૂરો કરે છે.

સુરસિંહ અને રમા વચ્ચેનો સ્વભાવભેદ નાટકના આરંભે તેમજ અનેક સ્થળે પ્રગટ થતો રહ્યો છે. સુરસિંહને અભ્યાસકાળમાં દેવું થઈ જતાં રમાના પિયરથી ત્રણ હજાર રૂપિયા મળ્યાવવામાં આવેલા. તેમાં જરૂરી નહિ હોવા છતાં ભુજની પાર્ટીને સુરસિંહ પ્રથમ દસ્તાવેજ મોકલે અથવા રમા પોતાના ઘરેણાં ગીરવે મૂકે વગેરે પ્રપંચ કરેલો તેવું સુરસિંહ સ્પષ્ટ કરે છે:

“સુરસિંહ : આપણા વચ્ચે આવો અવિશાસ અને વ્યવહાર ? બેર છોડો... પણ તમે નિર્દોષતા છોડો એનું મને દુંખ થયું. તમે મુત્સદી જવાબ આપ્યો એ મને ના ગમ્યું.

રમા : એટલે હું મુત્સદી છું ?

સુરસિંહ : હા....

રમા : હું રાજકુમારી હું... રાજરાણી હું...

સુરસિહ : મારા માટે માત્ર રમા જ ના રહી શકો ? અસત્ય છે એ અસત્ય છે... પ્રપંચ એ પ્રપંચ છે..." (પૃ. ૪૩) એ જ રીતે રમાએ અણગમતા કામદાર, અવિકારી કે નોકરોને છૂટા કર્યા, પરેશાન કર્યા, પોતાના વિશ્વાસુ માણસોને ગોઠવ્યા, કુવર પ્રતાપસિહના જન્મ વખતે ખટપટ કરી. પત્રો અને કાબ્યોમાં સુરસિહે પોતાનો આ અસંતોષ છુપાવ્યો નથી. તેમ છતાં તેના કારણે રમાને અન્યાય ન થાય તેની સતત કણજી લીધી. રમા તે જાણે. પરંતુ પોતાની ખટપટ, મહત્વાકંસ્થા, પટરાણી આનંદીબા પ્રત્યેની ઈર્ષા, સુરસિહ પર પોતાનું વર્યસ્ય રહે, રાજકારભાર તેમની ઈચ્છા પ્રમાણે જ ચાલે, તેમાં જ્યાં ક્યાંય નડતર થાય તેને નિર્મમપણે નાબૂદ કરવામાં આવે તેવા રમાના પ્રયત્નો સતત ચાલતા જ રહ્યા.

સુરસિહ મિત્રો સાથેના મિલન વખતે વાજસુરવાળા સમક્ષ શોભના પ્રત્યેના તેમના પ્રણયનો એકરાર કરે તે સાથે પહેલો અંક પૂરો થાય છે.

ત્રીજા અંકના આરંભે પ્રબંધકાચ્યુ 'હમીર ગોહેલ' અને ખંડકાચ્યુ 'ભરત', 'સારસી', 'વીણાનો મૃગ', 'બિલ્વમંગળ'નાં દશ્યોમાં પાત્રો તરીકે સુરસિહ અને શોભના નિર્ઝયાં છે જેથી તેમના પ્રણયનાં જ તે કથાનકી હોય તેવો ઉઠાવ મળે છે. 'હદ્યત્રિપુરી' તો તેમના વિશેનું જ ખંડકાચ્યુ હોવાથી ત્રણે પાત્રોના ભાવોટક હુદયમંથનને મૂર્ત કરે છે. રમા સમક્ષ શોભના પ્રત્યેના સુરસિહના પ્રણયનો અહીં જ સ્કોટ થાય છે. પછીનાં દશ્યોમાં પ્રણયસંઘર્ષ આગળ ચાલે છે. સુરસિહ રમાને ખાતરી આપે છે કે શોભનાને ચાહવા છતાં તેમના પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. રમાને તેનાથી પ્રતીતિ થતી નથી. તે શોભના સાથે પ્રેમભાવ માટે સંમતિ આપે છે, પણ લગ્ન માટે આગ્રહ નહીં રાખવા કહે છે. સુરસિહ પ્રેમપાત્ર પ્રત્યેની પોતાની ફરજ અદ્દ કરવા લગ્ન માટે આગ્રહી છે. પ્રેમ સામે કોઈ જ બંધન સ્વીકારવા તૈયાર નથી. આખરે સુરસિહ 'હમીરજી ગોહેલ' લખવા મહાબ્લેશ્વર ગયા હોય છે ત્યારે રમા શોભનાનાં લગ્ન ખવાસ યુવાન રામજી સાથે કરાવી આપે છે. સુરસિહને તારથી પણ જાણ કરવામાં આવે છે. સુરસિહ હત્પ્રભ થઈ મનોવ્યથામાં અટવાય છે.

સુરસિહ મનોમંથન દ્વારા આંતરિક સમાધાન સાધવા પ્રયત્નશીલ છે. પરંતુ શોભનાનો તેમના પર પત્ર આવે છે કે રામજી તેને પીડે છે, જીલમ કરે છે. બાપ પણ તેમાં સામેલ છે. તેના માટે સંસારમાં હેવે કોઈ નથી. તે આપવાની જીવ આપવા વિચારે છે. આ વથથમાંથી બચાવવા સુરસિહને તે વિનંતી કરે છે. પ્રેમપાત્ર પ્રત્યેની ફરજથી દોરવાઈને સુરસિહ શોભનાને બોલાવી લે છે. તેઓ નિર્ણય કરે છે કે શોભનાને એકાંતમાં રહેવા દઈ સ્વતંત્ર રીતે વિચારીને આગળ શું કરવું તે નક્કી કરવાની તક આપવી. શોભનાનો નિર્ણય જાણીને સુરસિહ રમા પાસે તેની સાથે લગ્ન કરવા માટેની દરખાસ્ત કરે છે.

દરખાન સુરસિહ, રમા અને શોભનાનો પ્રશ્ન લઈ મણીલાલ નભુભાઈ, વાજસુરવાળા, સંચિત વગેરે મિત્રો મંત્રજ્ઞા કરે છે. મણીભાઈના મતે લગ્ન કરવાં લોકોની દસ્તિએ અયોગ્ય છે, નિદા થશે, રાજા તરીકે સુરસિહે ભોગ આપવો જોઈએ. સુરસિહ પછીથી કહે છે કે તેમે સૌઅં મંત્રજ્ઞા કરી, પણ પ્રશ્નનો વિચાર લૌકિક દસ્તિએ કર્યો. ઈશ્વર સમક્ષ ન્યાયની દસ્તિએ જોઈએ તો કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને દુઃખી ન જોઈ શકે. અહીં પ્રાપ્તિની વાત નથી, પ્રેમના સન્માનની વાત છે. મિત્રો આગ્રહ કરશે તો હું સ્વીકારી લઈશ પણ બધા

વૈભવો ફેંકી દઈ ખુમારીથી ફીકરી જીવન અપનાવી લઈશ, મને તમે પછી લાઠીમાં નહીં જુઓ.

નાયબ પોલિટિકલ એજંટ ઓલડફિલ્ડ પાસે ફરિયાદ જાય છે. સુરસિહ શોભનાને પ્રેમ કરે છે, લગ્ન કરવા માગે છે, પણ લગ્નના છૂટાછેણાની ફારગતીની રાહ જુએ છે તે વલાણ તેમને પ્રશંસાપાત્ર લાગે છે. આખરે લગ્ન થાય તે માટે રમા સંમતિ આપે છે, પુસ્તકની સાધીએ સુરસિહ અને શોભનાનાં લગ્ન થાય છે. પણ રમા તેના વફાદાર કામદારને તે લગ્ન પડકરવા કોધપૂર્વક જણાવે છે. આ પરાકાણાભર્યા વળાંક પર આવતાં નાટકનો બીજો અંક પૂરો થાય છે.

ત્રીજા અંકનાં શરૂઆતનાં દશ્યો પ્રણયની સંતૃપ્તિની અનુભૂતિનાં છે. મણીલાલ નભુભાઈ જેવા ગુરુજન માર્ગદર્શકની ચિરવિદ્યા, કવિ કાન્તનો છિસ્તી ધર્મનો સ્વીકાર, રમાની ખટપટથી મિત્ર અને વફાદાર નાયબ કામદાર સંપિત લાઠી છોડી જાય વગેરે બનાવો સુરસિહને જિન્ન કરી દે છે. શોભનાના આગળના લગ્નની ફારગતી વિલંબ પછી મળે છે. હવે સુરસિહ નિશ્ચિતપણે ગાદીત્યાગ માટે તજવીજ શરૂ કરે છે. તે રમાને ગમતી વાત નથી. દરખાન સુરસિહના મનનો એક જૂનો વહેમ પાકો થાય છે. કુમાર પ્રતાપસિહનો જન્મ થયો ત્યારે અંગ્રેજ સરકારની વ્યવસ્થા પ્રમાણે અંગ્રેજ નર્સરીને હાજર રામવા સામે રમાએ વિરોધ કર્યો હતો. સુરસિહનો કમે વધતો રહેલો વહેમ હવે પાકો થયો કે પ્રતાપસિહ રાજબીજ ખરા પણ પોતાના પુત્ર નહિં. આથી તેમને લાગે છે કે તેમણે પોતાના નાના પુત્ર આનંદીબાના કુમાર જોશવરસિહને અન્યાય કર્યો છે. ફરજના ભાગ તરીકે તેઓ પોલિટિકલ એજંટને રૂબરૂ વાત કરવા માગે છે કે સરકાર રાજસત્તા સંભાળી લે અથવા જોશવરસિહને ગાદી મળે. કામદાર તાત્યાસાહેબ સાથેની આ વાત રમાનો વિશ્વાસુ કારકુન જેશકર સંભળી જાય છે.

લેખક અહીં ખરાખરીના સંઘર્ષની કાણ બરાબર પકડી છે. વાત સંભળીને રમા જેશકરને કોધના આવેશમાં કહે છે, "તારી જીબ કાપી નાખ." સત્તાનો વૈભવ પોતાના હથમાંથી સરી જાય તે રમાને કોઈ પણ ડિસાબે માન્ય નથી. સુરસિહની ફરજની ભાવના અને રમાનું ઘવાતું હિત પરસ્પર ટકરાય છે. તેમાંથી ન બનવાનું બની જાય છે.

ત્રણે રાણીઓને ત્યાં અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ રોકાવાના કમ પ્રમાણે સુરસિહ શોભનાને ત્યાંથી સંજના સમયે રમાને ત્યાં જાય છે. ત્રીજા અંકનું આ છેલ્લું દશ્ય લેખકે યુક્તિપૂર્વક યોજયું છે. શોભના પ્રત્યે ઈર્ષા અને અભાવ સૂચવતા રમાના શબ્દો નેપથેથી બોલાય છે તેમાંના કેટલાક સુરસિહના પ્રેવશ વખતે સંભળાય છે. સુરસિહ રમાના મોઢા પરના કોધના ભાવનો ઉલ્લેખ કરે છે ત્યારે રમા સલુકાઈથી વાત બદલી નાખે છે. સુરસિહને પેડા અને બરફ ખૂબ પસંદ છે તેનો ઉલ્લેખ કરી રમા જાતે બનાવેલા પેડા લઈ આવે છે અને તે લેવા આગ્રહ કરે છે. સુરસિહ રમાને પોતાના હાથે ખવરાવવા કરે છે ત્યારે પણ તે વાત બદલી નાખે છે. એક પેડા સુરસિહ રમાને ખાવ આગ્રહ કરે છે તો તે જ હાથ રમા સુરસિહના મોઢા તરફ વાળી દે છે. સુરસિહ સામે રમા આંખ મિલાવી શકતાં નથી.

પેડા અને બરફ આરોગ્યા પછી સુરસિહની તબિયત ઝડપથી બગડે છે. રમા નોકરોને સૂચના આપે છે કે ડાકોરસાહેબને અસુખ છે. તેમને ઊંચકીને ઉપર લઈ જવા પડશે. પોતે

બધાને બોલાવે છે. સુરસિંહ પ્રશ્ન કરે છે કે બધાને શા સારુ ? સુરસિંહ હજી તેમની તબિયતની ગંભીરતા સમજ્યા નથી. પણ રમા તો જાણે કે પ્રથમથી જ બધું જાણતાં હોય તેમ વર્તવા લાગે છે. આ બેદ તરત પકડાય છે તે નાટ્યકારની ખૂલ્લી છે.

ડૉક્ટરો માટે જેતપુર અને ભાવનગર તાર કરવામાં આવે છે. પણ સુરસિંહ તે પહેલાં હડાળ દરબાર વાજસુરવાળાને તાર કરવા જણાવે છે. પણ રમાએ નોકરોને કઈ શીખવી રાખ્યું હોય કે ગમેતેમ તે તાર થયો જ નહીં. સ્થાનિક વૈદ્ય પ્રભુવાલ શાસ્ત્રીએ વિષ્ણુવિકાનું નિદાન કરી ઘણું ધી પાઈ હેર બહાર કાઢી નાખવા તજવીજ શરૂ કરી. તો રમાએ પૂછ્યું, ‘તમે જવાબદારી થો છો ?’ સ્વાભાવિક રીતે કોઈ ડૉક્ટર કે વૈદ્ય ઉપચારના પરિણામની જવાબદારી ન જ લે. પણ આ કોઈ પ્રશ્ન નહોતો. વૈદ્યને યોગ્ય ઉપચાર કરતા અટકાવવાની રમાની મુત્સદ્વારી રીત હતી. ડૉક્ટરે પણ આવીને કહ્યું કે ઊલટીઓ કરાવવાનો ઉપચાર સમયસર કર્યો હોતું તો સારું હતું. પણ ડૉક્ટરો મોડા પડ્યા હતા.

દરખાનમાં સુરસિંહને પોતાના અંતકાલનો ખ્યાલ આવી જતાં શોભનાની જીવાઈ વગેરેની શિંતા થાય છે. તેઓ કામદાર તાત્યાસાંદેબને સ્યુરના આપી ઠરાવ તૈયાર કરાવે છે, પોતે સહી કરે છે. આખરી વિદ્યાર્થી વેળાએ સુરસિંહ રમા, આનંદીબા, શોભના સૌની માફી માગે છે. નાના કુમાર જોરાવરસિંહને કહે છે કે મેં તમને અન્યાય કર્યો છે, પણ હેવ વખત વહી ગયો. બધાં જ કુટુંબીજનોની હાજરીમાં સ્વસ્થતાથી કલાપી દેહ છોડી દે છે. ‘આપની યાદી’ વગેરે શ્રદ્ધાજીવિ-પઠન સાથે નાટક પૂરું થાય છે.

કલાપી વિશે કહેવાયું છે તેવો રાગ અને તાંગ વચ્ચે તેમના જીવનમાં વિરોધ રહ્યો નથી. લેખક કહે છે તેમ તે બંને તો તેમનામાં સમાન રીતે રહ્યા છે. કલાપીના જીવનનો વિરોધ પ્રેમ અને ફરજ વચ્ચેનો છે. રમાની ખટપથોથી પોતે અનેક રીતે પરેશાન થાય છે તે છતાં રમા પ્રત્યેના પૂર્ણ પ્રેમનો તેઓ સહિયારો આપે છે. મિત્રોને ઉદારતાથી સહયતા મોકલે છે તેમ પોતાને ત્યાં બોલાવી મહિનો બે મહિના રહેવાની સુવિધા કરે છે. મિત્રો પરના પત્રોમાં પોતાનું હૃદય ઠાકવે છે. પટરાણી આનંદીબા સાથે લાંબો સમય અબોલાં રહ્યાં પછી ગેરસમજ દૂર કરી સમાધાનપૂર્વકનો વ્યવહાર કરે છે. એટલું જ નહિ, તેમના પુત્ર – પોતાના નાના સંતાન પ્રયોગે ફરજચૂક થઈ છે તેવું જાણતાં તેને યુવરાજપદ અપાવવા પ્રયત્નશીલ થાય છે. તેનાથી રમાને ગમે તેટલું હુંબ થાય તો પણ ફરજમાં ચૂક થાય તે તેમનાથી સહન થાય તેમ નથી. લેખકના વસ્તુવિધાન પ્રમાણે આ બાબત જ તેમના પરલોકગમનમાં કારણભૂત બની હોય.

શોભના પ્રત્યે શરૂઆતમાં વત્સલભાવ હતો, પછીથી પ્રેમભાવ જાગ્યો. સામેના પાત્રમાં પણ તે ભાવ છે તેની ખાતરી કર્યા પછી પોતાનો પ્રેમ છુપાવતા નથી, પ્રગટ કરે છે. તેનાં લગ્ન થઈ જતાં આંતર સમાધાન શોધવા વ્યાયિત મનથી પ્રયત્નશીલ રહે છે. પરંતુ શોભનાને તેનો પત્ર દુઃખ આપે છે તેની જાણ થતાં તેને પોતાની પાસે બોલાવી લે છે, એટલું જ નહિ પણ તેના પતિના યોગશ્કેમની શિંતા કરી તે અંગે પૂરી વ્યવસ્થા કરે છે. એ સમયે અન્ય જ્ઞાતિસમાજોની સ્વીઓ સાથે રાજવીઓ લગ્ન કર્યા વિના સંબંધ રાખતાં પણ કલાપી નેત્રિક દસ્તિ અને ફરજની ભાવનાથી પોતાના પ્રેમપાત્રને યોગ્ય દરજા મળે, પત્રી તરીકેની સામાજિક પ્રતિષ્ઠા મળે, પોતાની હ્યાતી ન હોય ત્યારે પણ તેને કાયદાકીય

સહિત તમામ રક્ષણ મળે તેની કાળજી લઈ મૃત્યુની પળ સુધી તેની શિંતા સેવે છે.

આથી જ લેખકે આ રચનાને પ્રેમ, પ્રથા અને વથાની નાટ્યકથા તરીકે ઓળખાવી છે. રમાને તો તેમજો પુછળ પ્રેમ આપ્યો જ છે, તેમ છતાં પોતાના ઝજુ, કોમળ હદ્યની જે સૂક્ષ્મ ભાવનાઓ સંતોષપૂર્વક નહોતી તે શોભનામાં પ્રાપ્ત થવાથી તેઓ જ્ઞાતિ, સામાજિક પ્રથાઓ, રાજવી શિરસ્તાઓ, અન્ય બે પત્નીઓના અસંતોષ, મિત્રો-સ્વજનોનો વિરોધ વગેરેને એક બાજુએ રાખીને ત્રીજાં લગ્ન કરે છે અને પોતાની નેત્રિક વિભાવના પ્રમાણે તેનું સમર્થન પણ કરે છે. નિર્જયના પરિણામે તેમને ઊંડી વથાઓ ભોગવવાની આવે છે તે સહન કરી લેવામાં પાછી પાની કરતા નથી, એટલે સુધી કે સ્વરસ્થતાપૂર્વક જીવન પણ સમર્પિત કરી દે છે.

લેખક કલાપીને તડપન, તલસાટ અને તપના માણસ તરીકે ઓળખાવે છે. તેઓ પોતાના માટે અને બીજા માટે તડપા, તલસાટ વેઠ્યો, પણ તુટ્યા નહીં. તેથી તેમાંથી પ્રગટી તપસ્યા. નાટકમાં લેખકે તેમના વ્યક્તિત્વનાં આ પાસાંઓની વીગતો ભલે રજૂ કરવી પડી હોય, પણ તે કૃતિમાંથી વિશેષ કરીને સ્વયં પ્રગટ થાય છે. પત્નીઓ, મિત્રો, સંતાનો, પ્રજાજનો પ્રત્યેની તેમની અકૃતિમ પ્રતિબદ્ધતા સતત પ્રકાશિત થતી રહે છે. એથી જ એક સનાતન અને સમર્પિત પ્રેમી તરીકેનું કલાપીનું વ્યક્તિત્વ કૃતિમાંથી ઊપરસી આવે છે. પ્રેમ અને ઈશ્વરભાવ વચ્ચે તેમને ક્યાંય દ્વંદ્વ નહીંનથી. તેઓ બંનેના આરાધક હતા. જેમ પ્રેમમાં તેમ પ્રભુભાવમાં તેઓ વધુ ને વધુ રમમાણ થતા રહ્યા. પ્રેમની સંતુષ્ટિ પ્રભુભાવમાં સમર્પિત થવા માટે તેમનું જાણે કે સોપાન બની રહે.

લેખક આ જીવનચિત્રાત્મક નાટક લખવામાં પ્રેક્ષક, હિંગર્શક અને અભિનેતાનો વિચાર કર્યો છે તો તેની સાથે ભાવક-વાચકની મનોરંગભૂમિ અને એની કલ્યાણશક્તિ તેમજ કલ્યાણશીલતા તરફ પણ ધ્યાન આપ્યું છે. નાટ્યસિદ્ધાંતોમાં સમયનું બંધન સ્વીકારવામાં આવ્યું નથી, તે માત્ર પ્રેક્ષકોની રૂચિ-સુવિધાનું વ્યવહારું બંધન છે. તેમ છતાં લેખકને સંશોધન, સ્વરસ, વિવેક, શિંતન અને નાટ્યશાસ્ત્રના નિયમો તેમજ રંગમંચની શક્તિ અને મર્યાદા : આ બધાંનું પ્રમાણભાવન સાચવવાની કસોટીમાંથી પસાર થવું પડ્યું છે. કેમકે આ રાજવી, પ્રેમી અને અત્યંત લોકપ્રિય કવિ દ્વારા જિવાયેલું અને ઊગેલું સારસત્ત્વ જો ભાવક સામે ન ઊઘડે તો વાચક-પ્રેક્ષક નિરાશ થઈ જાય તે ભીતિથી તેમજો સજાગ રહેવાનું હતું.

જીવનચિત્રાત્મક રચના હોવાથી લેખક નાટક સાથે કલાપીની વાચનયાત્રા તેમના પત્રોના અંશો રૂપે, તે જ રીતે તેમની શિંતનજલક, જીવની રૂપરેખા સાથે છબીઓ, કલાપીનાં પ્રકાશનો અંગે શોભનાના પત્રો, શોભનાની જીવાઈ માટેનો ઠરાવ, કલાપીનાં માંદળી-મૃત્યુ વિશેની દસ્તાવેજ સાધનો, આરંભે બાલિકા મોંઘી જેનો અંશ રજૂ કરે છે તે કચ્છી ચસ ‘છોલી’, કલાપી પરિવારની વીગતો અને વંશવૃક્ષ, તેમજ સૌથી વધુ ધ્યાનપાત્ર તે લેખકની કલાપી વિશેની સંશોધન-મનની યાત્રા ‘થેંક યુ, મિસ્ટર કલાપી’ વગેરે રજૂ કરેલ છે. આરંભે ડૉ. રમેશ મ. શુક્લાલિભિત ‘કલાપી : એક નાટ્યઘટના’ અને ડૉ. નરેશ વેદ લખેલ ‘ઝજુનાબંધની ઝજુ ગરવી કલા’ તેમજ લેખકનું ‘રસ્ક્રેચ વાચક અને પ્રેક્ષક સાથે થોડીક સંગત – થોડુંક અંગત’ આ ગ્રંથની ધ્યાનપાત્ર સામગ્રી છે.

નાટક સારી પેઠે લંબાયું છે પરંતુ તેમાં કલાપીના જીવન અને કવનને પૂર્ણ રીતે

અભિવ્યક્તિ મળી છે. કૃતિમાં જ્યાં સર્જકતા અને જીવનસામગ્રી એકબીજામાં વિગતિત નથી થતાં ત્યાં આ વિશેષ પ્રયાસની અનિવાર્યતા ગણવી રહી. ભાવકને અને પ્રેક્ષકને અહીં સમગ્ર કલાપી પ્રાપ્ત થાય છે તે તેનો વિશેષ છે. કલાપીના જીવન અને સર્જન વિશે સંભળાતો વિવિધ સૂરોને લેખકે અહીં સુપેરે સાંકળી લીધા છે જેથી ક્યાંય પણ એકાંગી રજૂઆત થઈ હોવાનો અવકાશ રહેતો નથી. સુરસિંહ, રમા, શોભના સહિતનાં પાત્રોનું નિરૂપણ અસરકારક બન્યું છે. સુરસિંહનું અહીં ઉમદા માનવી, આદર્શી પ્રેમી, ઉદાર ન્યાયપ્રેય રાજીવી, પ્રેમાળ મિત્ર, કલાસૂઝ્યાળા સર્જક અને મર્મજી ચિંતક તરીકેનું વ્યક્તિત્વ નિખાર પામ્યું છે. રમાબામાં પ્રેમ, ફુટિલતા, કોધ, ઈર્ષા, રાજખટપટ અને મહાત્વાકંક્ષાનાં લક્ષણો એકમિત થયાં છે. તેઓ પોતાની હિતરક્ષા માટે ગમે તેનો ભોગ લેવામાં અચ્યકાય નહીં તેવાં રાજારાણી તરીકે મૂર્ત થયાં છે. મૌંઘી કે શોભના બાળપણથી યુવાવસ્થા સુધી સુરસિંહનાં વાતસલ્ય, પ્રેમ અને સંસ્કારઘડતરથી વિકસેલું એવું નારીપાત્ર છે જે કલાપી પ્રત્યેના અનન્ય પ્રેમ અને સ્વાર્પણની અનોખી ચરિત્રરેખા ધારણ કરે છે.

નાટકમાં પ્રસંગઘૂણથીમાં વૈવિધ્ય અને કલાસૂઝનો પરિચય મળે છે. રંગમંચની સજીતા અને કૃતિની દશયાત્મકતા એક કુશળ નાટ્યકારની ક્ષમતા દર્શાવી જાય છે. ધનવંતભાઈએ અહીં રંગભૂમિ પર અને ભાવકની કલ્યાણશરીલતામાં કલાપીને તેમના સમગ્ર પરિશેષ સહિત મૂર્તિમંત રૂપ આપ્યું છે.

આ બધું હોવા થતાં એક પ્રશ્ન તો ઉભો રહે જ છે કે આ બધાંમાં સર્જક ક્યાં ? કલાપીના જીવન અને કુત્સની સામગ્રીનું સંકલન, તેને અપાયેલું નાટ્યરૂપ અને તેમાંથી ઉદ્ધાર થતાં કલાકૃતિની સર્જકતા દર્શાંગુલ ઉપર ઊડી આવવી જોઈએ તે ક્યાંક ઓળખ રહી ગઈ હોય એવું લાગે છે. સર્જક સામગ્રીને નાટ્યદેહ આપી દે તેમાં જ તેની સર્જકતાની ઠંતિશ્રી માની લેવાય ખરી ? કલાપીના જીવનનો અંત અમુક વિશેષ રીતે આવ્યો હોય એવું દર્શાવવામાં કલાકૃતિની ફલશ્રૂતિ આવી ગઈ હોય તેવું માની લેવાનું યોગ્ય ગણાય ખરું ? ઘડીબધી છાનબીન પદ્ધી રચનાવિધાનને મૂર્તરૂપ મળ્યું હોવા થતાં તેની કોઈ સ્વતંત્ર અને અખંડ આકૃતિ કેમ ઊભી થતી નથી તે વિચાર માગી લે તેવું છે. સંતોષની હકીકત એ છે કે આવા કલાકીય પ્રશ્નો ખમી શકે તેવી સંક્ષમ કૃતિનું અહીં નિર્માણ થયું છે એટલે તેની સંગતિ બેસાડવા એટલું કહી શકાય કે સર્જક કલાપીના જીવન અને કવનથી બહાર જવાનો આશય ધરાવતા ન હોય. એથી આ રચનાને કલાપી વિશેની જીવનચરિત્રાત્મક કલાઘટના તરીકે જ માત્ર ઓળખાવીએ તે પૂર્વનું ગણાવું જોઈએ.

r

## પ્રવચન

### ભક્તિ, કવિતા અને દર્શન | બોળાભાઈ પટેલ

જુજાતી સાહિત્ય પરિષદ અને શ્રીમદ્ રાજયંદ આશ્રમ, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ૧, ૨ ડિસેમ્બર ૨૦૦૭ના દિવસોમાં આયોજિત ‘કવિતા અને દર્શન’ પરિસંવાદાના નિર્ગુણ કાવ્યધારા, વૈષ્ણવ પરંપરા અને કવિતા, જૈનદર્શન અને કવિતા તથા લલ્યેશ્વરી અને શૈવપરંપરા, અક્કા મહાદેવી અને વીરશૈવ પરંપરા, ગંગાસત્તી અને મહાપંથ પરંપરા વિષયો રાખવામાં આવ્યા હતા. એ પરિસંવાદાના આપેલું બીજ વક્તવ્ય.]

આ પરિસંવાદ માટે આપણે ‘દર્શન અને કવિતા’ એવો વિષય રાખ્યો છે, જે મધ્યકાલીન ભારતીય સંત કે ભક્તકવિઓની કવિતા સંદર્ભે છે.

આ કવિઓમાં છે જ્ઞાનમાર્ગી કવિ અખો, નિર્ગુણ સંત કબીર, વૈષ્ણવ ભક્ત કવિઓ સુરદાસ અને ચંડીદાસ, વિહૃલ ભક્તિના ઉન્નાયક સંત તુકારામ, જૈન ભક્તકવિ સમયસુંદર, યશોવિજ્યજી અને આનંદધન; એ સાથે છે કાશ્મીરી શૈવ પરંપરાનાં કવિયત્રી લાલ વૈદ અથવા લલ્યેશ્વરી, કણ્ઠાટકનાં વીર શૈવ પરંપરાનાં કવિયત્રી અક્કા મહાદેવી અને ગુજરાતી મહાપંથ પરંપરાનાં કવિયત્રી ગંગા સતી.

આ સૌ કવિ-કવિયત્રીઓને એક સર્વસામાન્ય ઓળખ આપવી હોય તો સંત યા લક્તકલિંગા આપી રહીએ નાંદુલાંનાં આપણે ત્યા લક્તકલિંગાનું કે પ્રચૂર ચાંદેલેન આવ્યા.

૧. સુદૂર દક્ષિણાંતરમાં તમિળનાડુમાં છૃદીથી નવમી સદીમાં તમિળભાષી શૈવપંથી નાયનમાર ભક્તો અને વૈષ્ણવ આલવાર ભક્તો થયા. એ વૈષ્ણવ ભક્તિની ચરમ અભિવ્યક્તિ નવમી સદીમાં ભાગવત પુરાણ રૂપે થાય છે.

૨. ભક્તિનું બીજું આંદોલન લગભગ બારમી સદીથી છેક અધારમી સદી સુધી વ્યાપ્ત છે, જેનો ઉત્કર્ષકાળ પંદરમી-સોળમી સદી ગણી શક્ય શકાય. અપબંધશરીરી જુદી પડી નવું સ્વરૂપ ધારતી વિવિધ ભારતીય ભાષાઓમાં એ સમયમાં વિપુલ ભક્તિસાહિત્ય રચાયું છે.

જે ભક્તકવિઓની વાણીની આપણે ચર્ચા કરવાના છીએ, તે સૌ બારમી સદીમાં થઈ ગયેલાં વીર શૈવ કવિયત્રી અક્કા મહાદેવીથી ઓગણીસમી સદીમાં થયેલાં ગંગા સતી સુધીમાં થયા છે.

આપણે આ ભક્તકવિઓની વાણીને દર્શન એટલે કે ફિલોસોફીની પૃષ્ઠભૂમિમાં જોવાનો ઉપક્રમ રાખ્યો છે. એટલે અહીં આરંભે જ કવિતા અને દર્શનને અલગાવીને સમજવાં પડે. ફિલોસોફી અર્થાંત દર્શન એટલે તત્ત્વવિચારણા. એનો ઉદ્ભૂત અથાતો બ્રહ્મજિગ્નાસાથી થાય છે. જીવ જગત અને બ્રહ્મ અર્થાંત ઈશ્વર વિષેનું તત્ત્વચિન્તન. એ મસ્તિષ્કનો વિષય છે, વિશ્વેષણ-સંશ્વેષણનો વિષય છે. એનો સંબંધ એક રીતે મસ્તિષ્ક સાથે છે. કવિતા આસ્વાદનો વિષય છે – એનો સંબંધ કવિ અને ભાવક ઉભય પક્ષે હૃદય એટલે કે ભાવનાજગત સાથે છે.

મસ્તિષ્ક અને હૃદય – વિચાર અને ભાવના – આ બન્નેનું કાર્ય જુદું જુદું છે, પરંતુ

શું એ પરસ્પરનાં વિરોધી છે ? પ્રેરોએ એના ‘રિપલિક’માં thrice removed from reality કહી કવિતાને પોતાના આર્દ્ધ નગરમાંથી દેશવટે આપી દર્શનને ગુરુસ્થાને સ્થાપ્ય હતું.

ખેટો કવિતાના પ્રભાવ’ને જાણતો હતો, એટલે કવિતાને ‘સત્ય’થી દૂર અને માણસની હલકી વૃત્તિઓને ઉત્તેજન આપનાર કહી દર્શનની મહત્ત્વ સ્થાપિત કરી, પછી એના જ શિષ્ય એરિસ્ટોટલે ટ્રેજેડીની વાખ્યા સંદર્ભે કવિતાની ફરી પ્રતિષ્ઠા કરી એમ કહીને કે કવિતાનું સત્ય ઈતિહાસના સત્યથી ચછિયાતું છે, એ માનવહંદયના સનાતનભાવોને બ્યક્ત કરનારું છે.

હવે આપણે જે રચયિતાઓની વાણીનું વિશ્વેષણ કરવાના છીએ, તેમને આપણે એકદમ કાવિદાસ આદ્ય જેવા કવિઓની પરંપરામાં નાખી શકીએ એમ નથી કે એકદમ શંકર જેવા દાર્શનિકની કોટિમાં રાખી શકીએ એમ નથી. તત્ત્વજ્ઞ કવિ અખાએ કહી દીધું છે :

### શાનને કવીતા (કવિતા - કવિ)ના ગજોશ

#### કિરણ સૂરજનાં કેમ વજોશ ?

આ બધા રચયિતાને કવિતા - કવિ ગજોશાં છતાં તેમની ઓળખ માટે એક વિશેષજ્ઞ લગાડીએ છીએ - ભક્તકવિ. આપણે એમને એકદમ દાર્શનિક કવિ કહેતાં ખમચાઈશું. કશુંક દર્શન-તત્ત્વ એ એમનું પ્રતિપાદ નથી, એ રીતે એમની કવિતા - માત્ર રસાસ્વાદ - સાહિત્યાસ્વાદ માટે પણ રચાઈ નથી. ભાષાના બાવન અક્ષરોની બહાર રહી જતા એવા કોઈ ‘પરમ’ના અનુભવની - ‘બાવન બાહેર’ના અનુભવની વાત એમણે કરવી છે.

#### બાવનનો સઘણો વિસ્તાર

#### અખા તેપનમો જાણો પાર.

પરંતુ આ જે બાવન બાહેરનો છે - તેપનમો છે - તેની વાત મસ્તિષ્ણની તાર્કિક દલીલોથી નથી કરવી, પણ અનુભૂતિની - experienceની રસમય વાણીમાં કરવી છે. એ અનુભૂતિને આપણે ‘અ-લૌકિક’ અનુભૂતિ કહી શકીએ, પણ એ અનુભૂતિ - experience છે. એ બ્યક્ત કરવા, એ અનિર્વચનીય છે, છતાં વચ્ચીય કરવાના - વાણીમાં બાંધવાના પ્રયાસમાં કવિતાનો આશ્રય લેવો પડે છે - કહો કે ‘શબ્દ’ની કળાનો આશ્રય લેવો પડે છે. કવિતા શબ્દની કળા છે, જે દ્વારા દર્શન - અહીં જે તે ભક્તકવિનું નિજનું ‘દર્શન’ છે. એ દર્શન આપણી ડિલોસોફિકલ સિસ્ટમમાં આવતું દર્શન નયે હોય - ભારતીય પ્રદર્શનની પરિભાષામાં કે અન્ય દાર્શનિક પરિભાષામાં બ્યક્ત કરવાનો ભક્તકવિનો આશય પડો ન હોય. અખો કહે છે -

#### થીડું શોધતાં લાધી પોળ

#### કહે અખો કર આકમઝોળ

આકમઝોળ - અ-લૌકિક અનુભૂતિનો છાકુ પરિભાષાગત શબ્દમાં કેમ બાંધવો ? શા માટે બાંધવો ? કબીર કહી ઉઠે છે :

#### મન મસ્ત હુઆ તબ ક્યો બોલે

#### હંસા પાયો માનસરોવર તાલતદૈયા ક્યો ખોજૈ

#### હીરા પાયો ગાંડ ગઠિયાઓ બારબાર વાકો ક્યાં ખોલૈ

હલકીથી તબ ચઢી તરાજુ મદવા પી ગઈ બિન તોલે  
તેરા સાહબ હૈ ઘટ માંહી બાહર નૈના કર્યો ખોલૈ  
કહત કબીર સુનો ભાઈ સાધો સાહબ મિલ ગયે તિલ ઓલે...

અહીં ‘સાહબ’ મળવાની - એમાં દર્શનની આપણી પરિભાષામાં બ્રહ્મ-પરમતત્ત્વની અનુભૂતિની વાત છે - પણ એ કહેવી જ શા માટે ? કેવી રીતે કહેવી ? એ અનુભૂતિ વાણી બહારની છે, વિલક્ષણ છે, છતાં એની કંઈક ‘ઝાંકી’ આપણને કચવવા. કબીરમાં રહેલ કવિ’ સમાંતર કલ્યાણો - એવિયટની પરિભાષામાં objective correlative - પ્રતીક શોધે છે -

#### હંસા પાયો માનસરોવર

હંસા-હંસનો આપણે ત્યાં - આપણી આધ્યાત્મિક પરંપરામાં એક પ્રતીકાર્થ છે - હંસ = આત્મા.

#### મીરાંબાઈ યાદ આવશે :

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું

કે આધુનિક કવિ સુન્દરમ્ભની એક પંક્તિ -

હંસ મારાને ભાઈ નવલભ નારિયું

સુરતા એની પટરાણી -

સુરતા સહેલાણી - મારા દિલડાની રાણી

આ ‘સુરતા’નો પણ દાર્શનિક - યોગપરક અર્થ છે.

પણ કબીરનું objective correlative પરંપરાગત અર્થને વિસ્તારી એક હૃદ્ય કલ્યાણ બની જાય છે :

#### હંસ પાયો માન સરોવર તાલતદૈયા ક્યો ખોજૈ ?

હંસને માનસરોવર મળી ગયું છે - કબીરને સાહેબનો સાક્ષાત્કાર થઈ ગયો છે.

અહીં એક વસ્તુ કહેવી જોઈએ અને તે એ કબીર પંદરમી સદીમાં કે મીરાં સોળમી સદીમાં જે ભાવકો સામે વાત કરતાં હતાં, તે ભાવકવળને આ બધી પરિભાષા ‘ભુબોધ’ હતી. એમની આ પદાવલિ એ વર્ગ સમજી જતો. પંદરમી-સોળમી કે એ સમયની ભાષા-પરિભાષા આજના આપણા ભાવક વર્ગથી દૂર ચાલી ગઈ છે - એટલે એની આજે વાખ્યા કરવી પડે છે.

#### હીરા પાયો ગાંડ ગઠિયાઓ

હીરો - સાચો હીરો છે અને એને ગાંઠે બાંધ્યા પછી - સંશયાત્મા બનીને વારંવાર જોવીને જોવાની જરૂર નથી કે એ સાચો છે કે જુણો છે - આવે વખતે ગીતાની પરિભાષામાં ‘સંશયાત્મા વિનશ્યતિ.’ હીરો - તત્ત્વ કહી કે સ્વયં બ્રહ્મ - મૂળ તત્ત્વ, જેની જિજ્ઞાસા હતી - ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા.’

દાર્શનિક-તત્ત્વજ્ઞાની તત્ત્વચિંતન કરે છે, કબીર તો એ પામી ગયા છે.

હવે એ અનુભૂતિની અભિવ્યક્તિ તો એમણે પોતાના પદની પહેલી - ઉંઘાડની પંક્તિમાં જ કરી દીધી - ‘મન મસ્ત હુઆ તબ ક્યો બોલૈ ?’

એ જાણો છે - ‘છેલ્યો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’

**‘સાહબ મિલ ગયા રિલ ઓડે –’**

આપણને ધીરાભગતના શબ્દો યાદ આવશે –

**તરણા ઓથે હુંગર રે હુંગર કોઈ હેણ નહિ –**

આ અવળવાણીનો આશ્રય કબીર અને મધ્યકાળીન બધા કવિઓ અનિર્વચનીય એવા દિવ્યાનુભવની જંકી કરાવવા લે છે – એ અવળવાણીની પદાવલિ એ esoteric – દીક્ષાગમ્ય છે – એ વખતના દીક્ષિત ભાવકોને એ સમજાતી પણ શું કબીરને કે આખાને આપણે દર્શાનિક કહીશું ? એમની વાડીમાં દર્શાનવિશેષની છાયા છે.

આખાને વેદાંતી કવિ કહીએ છીએ. મધ્યકાળમાં ભક્તિકવિતાનો જુવાળ હતો એ વખતે શંકરાચાર્યનો અદ્વૈતવાદ, રામાનુઝાર્યાર્યનો વિશિષ્ટદ્વાત્વવાદ, વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વાત્વવાદ આદિ દાર્શાનિક મતોનું પ્રચલન હતું. આ બધા ‘વાદો’ની વ્યાખ્યાઓ – બ્રહ્મ અને જીવનો સંબંધ શો છે – એ પ્રશ્ન પર આધારિત છે. એ રીતે આખો કેવલાદ્વાત – શાંકરવેદાંતને અનુસરે છે, પણ એમની કવિતા એનું પદ્ધતુપાતર નથી.

કવિતા એ દર્શનનું પદ્ધતુપાતર નથી. કવિતામાં દર્શન એક ‘ingradient’ – સામગ્રી તરીકે આવે, પણ એ કવિતાની શરતે આવે. દર્શન – પણ એક અનુભૂતિ બની જાય – એલિયટ જેને ‘felt thought’ કહે છે. એટલે દર્શનની કે આત્મતત્ત્વની વાત પણ કાવ્યાનુભવ બનીને આવવી જોઈએ.

કબીર અને આખો નિર્ગુણધારાના ભક્તકવિઓ છે. નિર્ગુણની પરંપરા ઉપનિષદની બ્રહ્મ-ઉપાસના સુધી જઈ શકે. એ સંદર્ભે ઈસ્લામની પણ અસર કબીરમાં જોઈ શકાય. બન્ને મૂર્ત્પૂજાના આકાર વિરોધીઓ છે. કબીર તો કહે છે –

**જો પથર પૂજે હરિ મિલે**

**તો મૈં પૂજું પહાડ...**

તો આખો કહેશે – જાણીતો છિયો છે :

**એક મૂરખને એવી ટેવ પથર એટલા પૂજે દેવ**

**તુલસી દેખી તોડે પાન નદી દેખી કરે સ્નાન**

**કથા સુધી સુધી કૂટચા કાન તોયે ન આવ્યું બલજાન.**

આ બાબ્ય પૂજાતીર્થતપ્વતની નિંદા કરનાર કબીર કે આખો જ્યારે આત્માનુભૂતિની વાત કરે છે, ત્યારે તેમની ‘અખડતા’ને સ્થાને અભિવ્યક્તિની સ-રસતા તો આવે છે – કવિતા પણ કોણી ઉઠે છે. કબીરની પ્રસિદ્ધ સાખી ઉદ્ઘૃત કરું તો –

**લાલી મેરે લાલ કી જિત દેખો તિત લાલ**

**લાલી દેખન મેં ગઈ મેં લી હો ગઈ લાલ.**

કબીરે ‘જીની જીની બીની ચદરિયાં’ – જેવાં તંત્રસાધનાનાં પઢો લખ્યાં છે, તો આત્માપરમાત્માનું મિલન – જીવબ્રહ્મનું મિલન અને એમના વિરહનાં પઢો પણ રચ્યાં છે. – વિરહભાવની શ્રેષ્ઠતા દર્શાવતાં કબીર કહે છે –

**બિરહા બિરહા જગ કહે બિરહા હે સુલતાન**

**જા ઘટ બિરહ ન સંચરે તા ઘટ જાણું મસાન**

કબીરને ‘વિરહ ભુજંગમ’ ડસી ગયો છે, તો બીજી બાજુ એમને એ પ્રિયના મિલનનો

ખુમાર પણ છે, રહસ્યવાદી ગણાતા કબીરે – ‘રામ મોર પીવ / મૈં રામકી બહુરિયાં’ એમ કહ્યું છે. તો એ પરમનાં દર્શન પણી કહ્યું છે :

**નહિ ઐસા લો નહિ વેસા લો**

**મૈં કહ્યિ વિધિ કહું ગંલીરા લો**

**ભીતર કહું તો જગમય લાજે**

**બાહર કહું તો જૂઠા લો**

**બાહર ભીતર રહત નિર્દંતર**

**ગુરુ પરતાપે દીકા જો.**

ઉમાશંકરને મતે આખા જેવો તત્ત્વજ્ઞ કવિ આપણી ભાષામાં હજુ બીજો પાક્યો નથી. અખેગીતા એનું ઉદાહરણ છે. ઉમાશંકર તો એને ‘વિચારકાબ્ય’ સુધ્યાં કહે છે, પરંતુ ‘જેમાં કાવ્યરસને માટે અવકાશ આપનાર કથાનક કે પ્રકૃતિવર્ણનને માટે પણ કોઈ તક નથી તેવા સંણગ વિચારકાબ્યમાં એણો આપણું ધ્યાન કાવ્યશક્તિથી રોકી રાખ્યું છે. જેનું એક જ ઉદાહરણ –

**ભાઈ, ભક્તિ જેહવી પંખિણી જેહને શાન વેરાગ્ય બેઉ પાંખ છે**  
– જેવું રૂપક.

આ નિર્ગુણ કાવ્યધારાની લગોલગ વેગથી વહે છે સગુણ ભક્તિધારા. આ ભક્તિધારામાં રામચરિતમાનસના કર્તા સંત તુલસીદાસ ભલે કહે –

**અગુન સગુન છિ નહિ કષ્ણ લેદા**

પણ એમણે વિષ્ણુના અવતાર રામને પરબ્રહ્મ રૂપે સ્થાપ્યા છે, કહો કે એમના રામ અવતારી તરીકે મર્યાદા પુરુષોત્તમ છે. રામચરિત માનસમાં ટેરઠેર અને ખાસ તો એના ઉત્તરકંડમાં દાર્શાનિક તત્ત્વની ચર્ચા કરી છે, પણ એવે વખતે કવિતા ભૂલી પરી છે, જોકે ચૌપાઈનો જાદુ બરકરાર રહે છે.

પરંતુ આ પરિસંવાદમાં સગુણભક્તિધારાના એક બીજી મુખ્ય વૈષ્ણવ કવિ સુરદાસને લીધા છે. સુરદાસ પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્લભાચાર્યથી દીક્ષિત થયા હતા. અલબત્ત નવું સંશોધન આ હકીકતને ટેકો આપતું નથી. પણ પરંપરાગત રીતે એમના ‘સૂરસાગર’ની રચના ભાગવતાનુસારી કૃષ્ણલીલા ગાવા માટે થઈ છે. સૂરસાગરમાં લગભગ ૫૦૦૦ પદો છે, જેમાં કર્તૃત્વના પ્રશ્નો તો છે. તેમાં ચુસ્ત પુષ્ટિમાર્ગ તો બાળકૃષ્ણની ગોકુળલીલાને વિશે કેન્દ્રમાં રાખે છે, પણ પણી તેમાં કૃષ્ણની વૃન્દાવની લીલા અને માથુરલીલાનો સમાવેશ થાય છે.

પુષ્ટિમાર્ગની સમાંતર છે ચૈતન્યદેવની ગૌડીય વૈષ્ણવભક્તિ. ચૈતન્યદેવના અનુયાયી રૂપ ગોસ્વામી અને જીવ ગોસ્વામીએ ‘ભક્તિરસામૃતસિંહુ’ જેવા ગ્રંથો લખી ભક્તિશાસ્ત્રનું વૈશ્યાનિક વિવેચન કર્યું છે, એટલું જ નહિ ‘ઉજ્જ્વલ નીલમણી’માં ભક્તિરસનું કાવ્યશાસ્ત્ર પણ રચ્યું છે.

વલ્લભાચાર્યની ભક્તિમાં અનુષ્ઠાનને વિશેષ મહત્ત્વ છે, એ વૈધી ભક્તિ – વિધિવિધાનને માનતી ભક્તિ છે. ચૈતન્યની ભક્તિ રાગાનુગા છે જે પ્રેમને મહત્ત્વ આપે

છ. વૈષ્ણવભક્તોએ ભક્તિના અનેક ભેદ-ઉપભેદ બતાવ્યા છે – પરંતુ તેના કેન્દ્રમાં છે – પ્રેમ, અર્થાત્ એ પ્રેમભક્તિ – મધુરાભક્તિ છે. પુષ્ટિમાર્ગમાં પણ, ચૈતન્યઅનુમોદિત ગૌરીય વૈષ્ણવભક્તિમાં પણ, મધુરરસ ભક્તિશાસ્ત્રનો સૌથી શ્રેષ્ઠ અને અંતિમ રસ છે. એ પામવા ભક્તનો બધો પુરુષાર્થ હોય છે. આ રસના આલંબન છે નિખિલ માધુર્યસ્વરૂપ શ્રીકૃષ્ણ.

### **“અધરં મધુરં વદં મધુરમ્...”**

રાધા અને ચંદ્રાવલી મુખ્ય નાયિકાઓ છે – બીજી પણ સખીઓ ખરી. પરંતુ મુખ્યત્વે તો રાધા કેન્દ્રમાં છે. રાધા વિના પૂર્ણપુરુષ અપૂર્ણ છે. ભક્તિ પણ રાધાભાવ – (પ્રોપીભાવ)થી કરવાની છે અને એ રીતે ભક્તિ કરતાં ભક્ત પરબ્રહ્મ કૃષ્ણને પમાય છે. પરંતુ સ્વયં કૃષ્ણ મહાભાવની અનુભૂતિ માટે – પોતાના ‘રસો વૈ સः’ સ્વરૂપની પૂર્ણતા માટે રાધા સાથે અન્તં લીલામાં વ્યાપ્ત રહે છે. શ્રીકૃષ્ણની ગ્રાન્તિનો શ્રેષ્ઠ ઉપાય રાધાભાવે મધુરરસની ભક્તિ.

આ જ સમયે અસમમાં મહાપુરુષ શંકરદેવ પણ વૈષ્ણવ ધર્મની સ્થાપના કરે છે, જે એકશરણ કે તેમના નામથી મહાપુરુષિયા સંપ્રદાય કહેવાય છે. તેમાં પણ કૃષ્ણોપાસના કેન્દ્રમાં છે. પરંતુ શંકરદેવ મૂર્તિપૂજાને સ્થાને બાગવતપૂજા અપનાવી. પછીથી એ ધર્મમાં મૂર્તિપૂજા પણ પ્રવિષ્ટ થઈ છે.

ગૌરીય વૈષ્ણવ કાવ્યધારામાં ચંડીદાસ સૌથી અગ્રણી કવિ છે. પણ બધા સંત-ભક્ત કવિઓના પ્રાપ્ત થતાં જીવનચરિતોમાં ચમત્કારો ભળી ગયા હોય છે. નરસિંહ મહેતા હોય કે મીરાંબાઈ, ચંડીદાસ હોય કે સુરદાસ – ‘ખાજિયોગ્રાસી’ સંત ચરિતાવલિના પરિવેશને વિવેકપૂર્વક સ્વીકારીને ચાલીએ. ચંડીદાસ એકાધિક છે, જુદા જુદા સમયમાં થયા છે. પણ જે પદો ચંડીદાસના નામે પ્રચલનમાં છે, તે તો વાણાંખરાં ચૈતન્યદેવના આવિર્ભાવ પહેલાંના છે, જેમ તેમના પુરોગામી કવિ વિદ્યાપતિનાં છે. ચૈતન્યદેવ આ પદો સાંભળી રાધાકૃષ્ણનાં ભક્તિકીર્તન હોય એમ મહાભાવની અવસ્થામાં આવી જતા. ચંડીદાસ ચૈતન્ય-મતાવલબીઓની નજરે ભક્ત કવિ બની ગયા. જેમ જ્યદેવ, તેમ ચંડીદાસને તંત્રપરંપરા સાથે જોડી દીધા છે. એ રીતે ચંડીદાસ અને રજકિની રામીની પ્રેમકથાને એક સાધનામૂલક તંત્રિક સંદર્ભે પણ જોવાય છે. શાંતિનિકેતનમાં વાસુદેવ બાઉલને કંઠે સાંભળોલું ગાન યાદ આવે છે :

**જે જન પ્રેમેર ભાવ જાને ના તાર સાથે પ્રેમ ચલે ના ગો ચલે ના.**

**રજકિનીર કાપદ કાંચા આર ચંડીદાસેર બાંસી ભાવાં...**

**ભાર બછર ભાઈલો બાંસી, બાંસીટે માછ લાગલો ના...**

**રજકિની કથા કરીલો આર ચંડીદાસ પાછ ધરિલો**

**માછ ધરિલો ભાલોઈ હલો એખાને આર રહિબોના –**

(જે જા પ્રેમનો ભાવ નથી સમજતું, તેની સાથે પ્રેમ કેવી રીતે થાય ? રજકિની એક બાજુએ કપડાં ધૂએ છે અને ચંડીદાસ ગલ નાખીને માછલી પકડી રહ્યા છે. પરંતુ ભાર ભાર વર્ખ ગલ નાખીને બેઠા છતાં ગલમાં માછલી પકડાતી નથી. છેવટે રજકિનીએ જ્યારે વચનો ઉચ્ચાર્યા, ત્યારે ચંડીદાસને માછલી પકડાઈ...)

તંત્રસાધનાની પારિભાષિક પદાવલિમાં પાંચ મફારમાં ‘મત્ત્ય’ આવે છે – પાંચ મ

કરના એ અર્થધાન્તમાં આપણે અત્યારે જતા નથી. કહેવાનો આશાય એટલો છે કે રજકિની સાથેનો ચંડીદાસનો પ્રેમ તેમની ઉપાસ્ય દેવી વિશાળાક્ષી – બાસુલીના આદેશથી માન્ય હતો.

આજે પણ શાંતિનિકેતનથી આશારે ૨૦ કિલોમીટર દૂર આવેલ નાનુર ગામને ચંડીદાસના ગામ તરીકે ઓળખાવાય છે, ત્યાં ચંડીદાસેર ભીટો(ખોરડાં)ની જગ્યા છે – વિશાળાક્ષી દેવીનું – બાસુલીનું મંદિર છે અને ગામની ભાગોળે વિશાળ તળાવ છે અને એક પથર પણ એને કંઠે બતાવાય છે, જેના પર રજકિની રામી કપડાં ધોતી હતી – આ હાજિયોગ્રાસી !

કવિ ચંડીદાસને માટે કોઈ દાર્શનિક ભૂમિકા નથી, એમને માટે તો માનવીય પ્રેમની અભિવ્યક્તિનાં પ્રતીક જોઈએ – અને તે ગીતગોવિંદ અને કવિ વિદ્યાપતિની પરંપરામાં ચંડાકૃષ્ણ રૂપે સહજે ઉપલબ્ધ છે. વૈષ્ણવ પ્રેમ કવિતાની પરંપરાગત બધી અવસ્થાઓના ઢાંચામાં ગોઢવાયાં હોવા છતાં એ શુદ્ધ વૈષ્ણવતત્ત્વની રીતે રચાયાં નથી. ચંડાકૃષ્ણનાં દિવ્ય પ્રતીકી છતાં અનું ધરાતલ માનવીય છે – ચંડીદાસની વૈષ્ણવ કવિતા ન જાણનાર પણ એમની ઉક્તિ તો જાણે છે :

### **‘સબાર ઉપરે માનુષ સત્ય, તાહાર ઉપરે નાઈ’**

(બધાયા ઉપર મનુષ સત્ય છે, તેનાથી કોઈ ચઢિયાતું નથી.)

ચંડીદાસના નામે મળતાં શ્રીકૃષ્ણકીર્તનમાં તો કૃષ્ણ એક પ્રગટભ નાયક છે. ચંડિકા ભોળી ગોપી. અનેક યુક્તિપ્રયુક્તિઓથી તે રાધાનું સાન્નિધ્ય જ નહિ, રાધાનો પ્રેમ સંપાદિત કરે છે. પરંતુ બંગાળી વૈષ્ણવ પદાવલિમાં તો રાધા કૃષ્ણના પ્રેમમાં દૂબેલી એક કુલવધૂ છે. કૃષ્ણની વાંસળી સાંભળી તે વાઙ્કુલ થઈ જાય છે. બડાધી (વૃદ્ધ માતામહિ)ને કહે છે –

**કે ના બાંશી બાંઝી બડાયિ કાલિની નઈ કુલે**

**આદુલ શારીર મોર લેઆદુલ મન**

(કાલિનીને કોઠે કોણ વાંસળી વગાડે છે, મારો દેહ આદુલ અને મન વાઙ્કુલ બની જાય છે... કોણ વાંસળી વગાડે છે, તેને ચરણે જાતને સોંપી દર્શા. મારી આંખોમાંથી જરાર આંસુ જરે છે... વાંસળીને શિરે વંદન કરી ચંડીદાસ ગાય છે.)

એક પદમાં રાધાની ઉક્તિ છે :

**સઈ, કેવા શુનાઈલ શ્યામ નામ**

**કાનેર લિતર ણિયા મરમે પણિલ ગો**

**આદુલ કરિલો મોર પ્રાણ...**

(હે સજિ, શ્યામનામ કોણ સંભળાયું ? એ નામે કાનની અંદર પ્રવેશી મારા પ્રાણને વાઙ્કુલ કરી દીધા છે, હું જાણતી નહોતી કે શ્યામ નામમાં આટલી મીઠાશ છે, જીભ પરથી ખસ્તું જ નથી.)

રાધા કહે છે :

**બન્ધુ કિ આર બલિલ આમિ**

**જાવને મરમે જનમે જનમે પ્રાણ નાથ હેઓ તુમિ...**

પ્રાદુર ચૈતન્ય રચાયેલાં આ પદોને પછી રૂપ ગોસ્તામીએ ‘ઉજ્જવલ નીલમણિ’ નામના

ભક્તિરસશાસ્ત્રના રચેલા અવંકારગ્રંથમાં ઉદાહરણ રૂપે ટાંકી મધુરરસ'ની વ્યાખ્યા કરી છે.

ચંડીદાસની રાધા પરકીયા છે – કૃષણને પ્રેમ કરવા જતાં પોતાના બન્ને કુળને (પિયર અને કશુર) પોતે કલંકની ટેપલી માથે ઉપાડી છે. એની વાકુળતાથી, વેદનાથી એ પીડાતી હોવા છતાં કૃષણના પ્રેમમાં નિમજ્જ્ઞ છે.

ચંડીદાસ ચૈતન્યપંથ અનુમોદિત મધુરરસના શ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન પામ્યા છે. વિદ્યાપતિ ચંડીદાસનાં પદો ચૈતન્યદેવના વૃન્દાવનનિવાસ દરમ્યાન અને ત્યાં ગૌરીય વૈષ્ણવ ઉપાસનાપદ્ધતિનું પ્રચલન થતાં પહોંચી ગયાં હોય. એટલે જ્યારે સુરદાસનો એક ભક્તકવિ કે કવિભક્ત તરીકે પ્રવેશ થાય છે, ત્યારે માત્ર ભાગવત કે ગીતગોવિંદ જ નથી – અત્યંત લોકપ્રિય થયેલા કવિઓ – વિદ્યાપતિ અને ચંડીદાસ પણ હોય.

પરંપરાપ્રાપ્ત પ્રમાણો અનુસાર સુરદાસ તો વિહુલાચાર્યના આધ્યાત્મ કવિઓમાં મુખ્ય હતા અને એમને ‘કીર્તનિયા’ તરીકે ગોવર્ધનનાથજ્ઞાના મંદિરમાં સ્થાપિત કર્યા હતા, વળી એ વલ્લભાચાર્યની આશાનુસાર ‘ભગવદ્ગીતા’નું ભાગવતાનુસારી ગાન કરનાર પણ છે.

બાળલીલાનાં જેવાં પદો સુરે લખ્યાં છે, એવાં ભાગ્યે જ કોઈએ લખ્યાં હોય. એ રીતે વાત્સલ્યલીલાનાં પદોમાં પણ સુરદાસ અજોડ છે.

**મૈયા મોહિ દાઉ બહુત બિજાયો**

**મોસો કહ્યત મોલકો લીનો તોહિ જસુમતિ કબ જાયો...**

અથવા

**મૈયા મોરી મેં નહીં માખન ખાયો –**

**ગવાલબાલ હે યહ સખા સબે ભિલ મોરે મુખ લપટાયો...**

S S S

**જ્ઞોદા હરિ પાલને જુલાવૈ**

**હલરાઈ હુલરાઈ મલહાવૈ જોઈ સોઈ કછુ ગાવૈ**

**મેરે લાલ કોં આઉ નીદરિયા, કાહે ન આનિ સુલાવૈ**

કવિ કહે છે :

**જો સુખ સુર અમરમુનિ દુરલભ, સો નંદભાગિની પાવૈ**

સુરદાસમાં ભાગવતાનુસાર કૃષણની બધી બાળલીલાઓ પદો રૂપે આવે છે, તેમાં મુરલીવાદન, ચીરહરણ, રાસલીલાનાં પદો હોય જ, પછી છે ગોપલીલા, ગોવર્ધનલીલા, પ્રેમલીલા અર્થાત્ મધુરાભક્તિની શબ્દાવલિમાં કહીએ તો – ઐચ્છાધૂરી, રૂપમાધૂરી, મુરલીમાધૂરી.

કૃષણ વાંસળી વગાડે છે – આખી વ્રજભૂમિને મુંઘ કરે છે પરંતુ આ વાંસળીનો દાર્શનિક પક્ષ છે. એટલે જેમ ગોપીઓ જીવ છે, કૃષણ ઈશ્વર છે તેમ મોરલી એટલે માયા છે. માયા જીવ માત્રને પોતાના વશમાં કરે છે. આ માયાના બે પ્રકાર છે : વિદ્યામાયા, અવિદ્યામાયા.

અવિદ્યામાયા આત્મા-પરમાત્મા – જીવબ્રહ્મ વચ્ચે વિભેદ કરાવે છે. વિદ્યામાયા જીવબ્રહ્મનો ભિલાપ કરાવે છે. મોરલી – વિદ્યામાયા છે જે ગોપીઓનો (જીવોનો) કૃષણ (બ્રહ્મ)

સાથે સંયોગ કરાવે છે. ભાગવતમાં વેશુમીત છે, અનું એ મહાત્મ્ય છે.

સુરદાસે એમના સમયમાં પ્રચલિત સગુણોપાસના અને નિર્ગુણોપાસનામાં સગુણોપાસનાનું મહત્વ સ્થાપિત કર્યું છે – ગોપીઓના માધ્યમ દ્વારા. એમણે નિર્ગુણ ઉપાસનાનું ખંડન કર્યું છે. ભમરણીતનાં પદોમાં સગુણ-નિર્ગુણ વિવાદ છે, જેમાં ઉદ્ધવ નિર્ગુણ પક્ષે દલીલ કરી ગોપીઓને કૃષણને ભૂલી બ્રહ્મરૂપ ઈશ્વરની ઉપાસના કરવા કહે છે – ત્યારે સરળહદ્ય ગોપીઓ કહે છે :

**નિર્ગુણ ક્રીન દેસ કો બાસી....**

ગોપીઓને ઉદ્ધવ નિર્ગુણ ઈશની આરાધના કરવા કહે છે તો ગોપીઓ કહે છે.

**ઉધો, મન ન ભયે દસનીઝ**

**એક હુતો તે ગયો સ્યામ સંગ, કો આરાધી ઈશ ?**

ઉદ્ધવ ગોપીઓનો પ્રેમ અને તેમની આ દલીલો આગળ નિરુત્તર બની જાય છે, અને ગોપીઓના એટલે કે સગુણના પક્ષના બની જાય છે. એ રીતે સુરદાસે સગુણનો નિર્ગુણોપાસના પર વિજય બતાવ્યો છે.

પરંતુ આ તો તાકિક બાબત થઈ, સુરદાસે જે કવિતા સિદ્ધ કરી છે – રાધાનું ચિત્ર કે રાધા અને ગોપીઓનો વિરહભાવ વ્યક્ત કર્યો છે તે આપણને – ભાવકોને સ્પર્શી જાય છે. અહીં મધુરાભક્તિ અને પ્રેમકાલ્યનું દ્વારા રહેતું નથી. સુરની કવિતા એની ઊંચાઈથી જ અધ્યાત્મનો સ્પર્શ કરાવે છે.

ભક્તિ એટલે શું – વિરહભક્તિ એટલે શું – એ સુરનાં પદોમાં ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. સુરની રાધા મધુરાભક્તિની ચરમસીમા છે, શું સંયોગમાં શું વિયોગમાં, પરંતુ એની અભિવ્યક્તિનું ધરાતલ માનવીય છે.

**જેમકે રાધાકૃષણનો પ્રથમ સંવાદ –**

**બુઝત શ્યામ તૈન તૂ ગોરી**

**કહાં રહતી, કાકી ડે બેરી, દેખી નહીં કબહું રજ ખોરી....**

**(રાધા : ) કાહેકો હમ રજતન આવતી ખેલત રહત અપની પૌરી**

**સુનત રહત સવન્તિ નંદ ઢોયા કરત હિરત માખનદધિ ચોરી**

**(કૃષણ : ) તુમહરો કહા ચોરી હમ લૈહે ખેલત ચલૌ સંગ ભિલ જોરી**

**સુરદાસ પ્રલુ રસિક સિરોમનિ બતાનિ ભૂરઠ રાધિકા ભોરી**

સુરદાસની રાધા સ્વકીયા છે. રાધા-કૃષણના પ્રથમ મિલન પછી એ જશોદાને ધેર પણ આવે છે, અને જશોદા અને લાડ લડાવે છે. (અલબાત્ સુરદાસમાં રાધાકૃષણના વિવાહનો સ્પષ્ટ નિર્દેશ નથી.) સુરદાસનાં પદોમાં રાધાકૃષણના પ્રેમનું કમિક વિકસન છે, પરંતુ સુરની કવિતા ઉત્તમ રૂપે પ્રગટે છે – વિરહનાં પદોમાં. વિરહી ગોપીઓની ઉક્તિ છે :

**નિસદ્ધિન બરતત નેન હમારે**

**સદા રહતિ પાવસ રિતુ હમ પર, જબ તેં સ્યામ સિધારે.**

કે ઉપાલભરૂપ આવાં પદોમાં :

## પ્રીતિ કરિ કાણુ સુખ ન લખ્યો

કૃ

## પ્રીતિ કરિ દીન્હી ગવૈ છૂરી

સુરના શ્યામ સ્વયં ગોપીઓના વિરહથી બગ છે. ગોપીઓને મળીને ઉદ્ધવ મથુરા પાદા ગયા પછી, કૃષ્ણ ઉદ્વને કહે છે :

## ઉધો મોહિ બ્રજ બિસરત નાર્હી -

સુરદાસે કૃષ્ણના દ્વારકાવાસી થયા પછી રાધાકૃષ્ણના અંતિમ મિલનનો પ્રસંગ યોજ્યો છે, કુરુક્ષેત્રમાં :

## રાધા માધવ લેટ ભર્ત.

ભલે, પણ છેવટે રાધાને માટે તો અનુ અંત વિરહ છે – એ જ તો વિરહભક્તિ.

કબીર આદિ સંતો દ્વારા નિર્ગુણોપાસનાની પ્રતિષ્ઠા થઈ, તેનો રામભક્ત કવિ તુલસીદાસ અને કૃષ્ણભક્ત કવિ સુરદાસે એમની રામ અને કૃષ્ણકવિતાથી એક રીતે પ્રતિકાર કર્યો છે. સુરદાસના સૂરસાગરમાં આવતા ભમરગીત પ્રસંગને તો સુરદાસે એક વાદસભામાં ગોઠવી દીધો છે. વિદ્વાન ઉદ્ધવની નિર્ગુણ બ્રહ્મ તરફી દુલીલો અને માત્ર હૃદયનો ધર્મ સમજતી અજ્ઞ ગોપીઓની ઉપરથી સાઢી લાગતી પણ વાક્યવિદ્યધતાનો પરિચય આપતી વક, કટાક્ષસભર દલીલોમાં માત્ર તર્કયુદ્ધ નથી, વાસ્તવમાં ગોપીઓનાં વિરહદીર્ઘ હૃદયની પ્રભાવક અભિવ્યક્તિ છે – સુરદાસની અનુપમ કાવ્યસ્થિદ્ધ અહીં છે. નંદાસે – અષ્ટાપના બીજા એક મહાત્વના કવિએ પણ સુરદાસ પછી ભમરગીતની રચના કરી છે, પણ તેમાં તો ઉદ્ધવ-ગોપીસંવાદ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષની તર્કજીવ બની જાય છે. આ ભમરગીત પરંપરા ગુજરાતી કવિતામાં પણ છે. પછી તો આ ઉદ્ધવ કહેતાં ‘ઓધવજી’ આપણાં લોકગીતોમાં પણ ગોપીઓને મથુરાના રાજ થઈ બેદેલા કૃષ્ણને ઉપાલંબ આપવાનું અને પોતાની વથા કહેવાનું એક સંબોધન બની ગયા છે.

સુરદાસમાં પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત છે અથવા પુષ્ટિમાર્ગના આચાર્યાંએ સુરદાસની કવિતાસિદ્ધિને કારણે પછી પોતાની અષ્ટાપ વ્યવસ્થામાં એમને ગોઠતી દીધા અને એમની કીર્તનિયા આદિની પદવી અને એ પહેલાંની મહાપ્રભુજ સાથેની મુલાકાત અને એમને હથે દીક્ષિત થવાની અને લીલાગાન કરવાની પ્રેરણ પામવાની વાત પણ ગુણી લીધી છે. પરંતુ સુરદાસ વિશે થતાં નવાં સંશોધનો એ બધી વાતોને ‘પુષ્ટિ’ આપતાં નથી.

આપણા આ પરિસંવાદમાં જે બધા મધ્યકાલીન ભારતના ભક્તકવિઓનું સંમેલન યોજ્યું છે, તે ભક્તોમાં ખેડેખ સૌથી પહેલા તો મહારાજ્ઞના સંત શાનેશ્વર આવે. તેમણે સૌથી મોટી કાન્તિ એ કરી કે સંસ્કૃત નહિ, પણ હજ તો અપભંશમાંથી સ્વ-રૂપ ધારતી મરાઠીમાં કવિતા લખવાનું શરૂ કર્યું. ભગવદ્ગીતાની ‘ભાવાર્થબોધિની’ ટીકા માત્ર સોળ વર્ષની વયે લખી છે અને પછીને વર્ષે ‘અમૃતાનુભવ’ – એમાં શાનદેહ દાર્શનિક ભૂમિકા અપનાવી છે – પણ એમણે ચુક્કદર સ્વામીએ શરૂ કરેલ વારકરી સંપ્રદાયને બેઠો કરવા નામદેવને પ્રેરિત કર્યા, સાથે વિહુલભક્તિને પુનર્જીવિત કરી, એમના મતે અદ્વૈતી ભક્તિયોગ પ્રમાણે વિહુલના પરમભક્ત હોવું એટલે ખરા વેણું હોવું અને એ જ એમના મતે જીવમાત્રનું અંતિમ ઉદ્દીપ છે. પંદ્રપુરના વિહુલની ભક્તિમાં તુકારામ એ અંતિમ શિખર છે. વારકરી

પંથને પણ તેમણે ચરમોચ્ચ સ્થિતિએ પહોંચાડ્યો. વારકરીપંથ વિષે હિલીપ ચિત્રે કહે છે તેમ સ્વયં પ્રેરણાથી વ્યક્તિએ સ્વીકારેલો એ માર્ગ છે, તેના કોઈ લેખિત કઠોર વિધિવિધાન નથી. પણ શબ્દ-અર્થ સૂચયે તેમજ વારી-વારો એટલે કે પંદ્રપુરની અથવા નજીગના કોઈ તીર્થની વર્ષે એકાદ વાર યાત્રાનું વિધાન છે. તુકારામને નામે ચઢેલ એક અભંગમાં કહ્યું છે તેમ –

## પંદ્રીચી વાટે

## બાબળીચે કાટે

## સખા વિહુલ લેટે / પાંડુરંગા.

આ તુકારામનો રચેલો અભંગ નથી, લોક-અભંગ છે, એમને નામે ચઢેલો અભંગ છે. ‘તુકારામ મહારાજની સામ્રાધ્યિક ગાથા’માં આ અભંગ મળતો નથી, કાકા કાલેલકરમાં વાંચવામાં આવેલો. પછી મેં તુકારામના વંશજ અને તુકારામની ગુરુગાદી સંભાળનાર મરાઠી વિદ્વાન સનાનંદ મોરેને એ વિષે પૃથ્વી કરી. એમણે કહેલું કે એ લોક-અભંગ છે. આવા ઘણા અભંગ એમને નામે ચઢેલા છે. પણ આ અભંગમાં પદ્રેના વિહુલની વારકરી જાત્રાની વ્યાખ્યા આવી જાય છે, જે લોકચેતનામાં વ્યાપ્ત છે.

જૈન ધર્મ અત્યંત પ્રાચીન ધર્મ છે અને એની જીવંત પરંપરા આજે ભારતના ઘણા વિસ્તારોમાં છે, તે ભલે શેતાંબર, દિગ્ંબર કે સ્થાનકવાસી જેવી મુખ્ય શાખાઓ કે અનેક બધા ગંધ્યોમાં વિભાગ્યિત હોય.

જૈન ધર્મ નિરીચરવાદી છે, પણ તીર્થકરોની, જે ડેવાળમુદ્રિત પામેલા મહામાનવો છે, ઉપાસના કરવામાં આવે છે, જેમના પર ઈશ્વરત્વનો આરોપ કરવામાં આવે છે – એ રીતે એમનાં સ્તવન કે સજીવાય રચાયાં છે. સ્યાદવાદ અને કર્મસિદ્ધાંત જૈન ધર્મના દર્શન અને ધર્મશાસ્ત્રના પાદામાં રહેલ દર્શન છે. આત્માના ગુણો કર્માદી અવરોધાયેલા છે, તે દૂર કરવા માટે ધર્મપુરુષાર્થની આવશ્યકતા છે. એ પુરુષાર્થનું પહેલું પગથિયું એટલે સમ્યક ગુણની પ્રાપ્તિ અર્થાત્ સમ્યક્તવ શાન.

આજે જેણની આપણો ચર્ચા કરવાના છીએ તે આચાર્ય યશોવિજ્યજ્ઞ મહારાજે આ વિષયમાં ‘સમકિતના સડસઠ બોલની સજીવાય’ લખી છે. તે આમ તો પૂર્વે થયેલા આચાર્ય હરિભદ્રસુરિજીની ‘સમ્યક્તવ સપ્તતિકા’ને આધારે રચાયેલી સજીવાય છે.

## સુકૃતવલ્લી કાંઈબિની સમરી સરસ્વતી માત

## સમકિત સડસઠ બોલની, કહીશું મધુરી વાત

આ સમકિત બોલ અર્થાત્ સમ્યક્તવના ગુણની વ્યાખ્યા. પ્રથમ બે ગાથામાં સજીવાયમાં વર્ણન કરાતા દ્વારાની સૂચિ છે, પછીની ઢાળમાં તેનું વિસ્તારથી વર્ણન છે.

આનંદઘનને જૈન કવિ કહેવાથી જાણે એમની યૌગિક પ્રભા અને આધ્યાત્મિક દર્શન સીમિત થઈ જાય છે. આનંદઘન કબીર કે અખો કે તુકારામની કોટિના આત્મ-સાક્ષાત્કારની અનુભવવાણીને પ્રગટ કરનાર યોગી કે શાની ભક્તોની શ્રેષ્ઠીમાં આવે એવા અલગારી છે :

અબ હમ અમર ભયે ન મર્દેગે

યા કારણ મિથ્યા ડિયો તજ કયું કર દેહ ધરેગે ?

રાગ દોસ જગ બંધ કરત હૈ, ઈનકો નાસ કરેંગે,  
મર્યાં અનંત કાલ તે પ્રાણી, સો હમ કાલ હરેંગે....

S S S

મર્યાં અનંત બાર બિન સમજથો, અબ સુખ દુખ વિસરેંગે  
આનંદધન નિપટ નિકટ અભિર દો, નહિ સમરે સો મરેંગે...  
આ પદ સાંભળતાં જ કબીરનું મસ્તીભર્યું પદ વાદ આવે :  
મન મસ્તા હુાં તબ ક્યો બોલે ?

અથવા અખાની પંડિત :

છીંડું શોધતાં લાધી પોળ  
હવે અખા કર આકમગોળ  
અને તુકારામના સ્વર્ગારોહણ સમયના અભંગ -  
આપુલ્યા ભરણ પાહિલે ભ્યા ડોળ  
તો જાણ સોહળા અનુપમ્ય

૩

મરણ મારે મરોન ગોલે / મજ કેવે અમર

ઘણી વાર થાય કે જુદા જુદા સમયમાં થયેલા, જુદી જુદી પંથપરંપરામાં થયેલા આ બધા ભક્તકવિઓની જાણો એક જ જ 'વેવલેન્થ' (તરંગલબાઈ) છે.

જૈનપરંપરા પ્રમાણે આનંદધન અને યશોવિજયજ્ઞાન મિલનનો પ્રસંગ એ બન્ને મહાન આત્માઓના સ્વભાવને પ્રગટ કરે છે. અનેક વિદ્યાપારંગત વિદ્ધાન મુનિ યશોવિજયજ્ઞાન પ્રવચન સમયે આનંદધન આવે છે, યશોવિજયજ્ઞાન વિદ્ધાન કહે છે, પણ કહે છે કે 'તમને હજુ આત્મપ્રતીતિ થઈ નથી'

અને યશોવિજયજ્ઞ આનંદધનને નમસ્કાર કરે છે. આનંદધન એક સજ્જાય લાયે છે. જેમાં આધ્યાત્મિક અનુભવને દાખ્યતાજીવનના પ્રતીક દ્વારા - રૂપક દ્વારા આનંદધન રજૂ કરે છે.

સુહાગણ જાગી અનુભવ પ્રીત  
નિન્દ અશાન અનાદિ કી મિટ ગઈ નિજ રીત.  
ઘટમંદિર દીપક કિયો સહજ સુજ્યોતી સરૂપ  
આપ પરાઈ આપહી, ઠાનત વસ્તુ અનૂપ  
કહા હિનાઉ ઔર હું, કહા સમજાઉ ભોર  
તીર અચૂક હૈ પ્રેમ કા, લાગે સો રહે ઠોર  
નાદિલુદો પ્રાણકુ જિને ન તૃષ્ણ મૃગલોય  
આનંદધન પ્રભુ પ્રેમકા, અકથ કહાની કોય

S S S

અવધૂ નરનાગર કી બાજુ જાણો ન બામણ કાજ

S S S

આતમ અનુભવ ફૂલકી નવલી કોઉ રીત  
નાક ન પ્રકટે વાસના, કાન ચ્રાદે ન પ્રતીત

ભારતીય સંતો યોગીઓની લગભગ સહસ્રાબ્દીની ભક્તિ-પરંપરામાંથી અહીં બે વિશિષ્ટ કવયિત્રીઓની વાત થવાની છે. એક ઉત્તરની એટલે કે કાશ્મીરની લાલ વૈદ અર્થાતું યોગિની લલ્દેશરી છે, અને બીજી દક્ષિણાં એટલે કે કષાર્ટકની અક્કા મહાદેવી છે. બન્ને શિવની અનુરાગિની છે. લાલ વૈદ કાશ્મીરી શૈવમટનાં અનુયાયી છે, અક્કા શરણ સમ્પ્રદાય અર્થાતું વીર શૈવ મતનાં અનુયાયી છે. બન્નેમાં ઘણી સમાનતાઓ મળશે. બ્રાહ્મણ કુળમાં જન્મેલાં લલ્દેશરી પરિણીત હત્યાં પણ શિવનાં આરાધિકા હત્યાં. પતિ અને સાસુનો ત્રાસ હતો. પાણી ભરીને આવતાં મોડું થયું. પતિએ લાકીથી ઘડા પર પ્રહાર કર્યો. ઘડો ફૂટી ગયો, માથે પાણી ઘડાના આકારે સ્થિર થઈ ગયું ! હાજ્યોગ્રાઝી પ્રમાણે સંતના જીવન-ચ્યમતકાર. લાલ વૈદની કવિતા વાખ્ય - (વાક્યાનિ) તરીકે ઓળખાય છે, જેમ અક્કા મહાદેવીની કવિતા 'વચન' તરીકે.

લલ્દાની વાખ્ય છે :

સદાથી અહીં આપજો આવત્તા રહ્યાં  
અમે સદા અહીંથી જતાં રહ્યાં  
જીવનમરણના આ ચક્યાં  
શૂન્યથી મહાશૂન્યમાં મળતાં રહ્યાં.

લાલ વૈદ અને અક્કા બન્ને વિવસ્ત્રા બનીને ફરતાં. અક્કાના કેશ ઘણા લાંબા, એનાથી પોતાનો સુંદર દેહ ઢંકાયેલો રાખતાં - 'કેશામ્બરા' કહેવાતાં. એ જ સ્થિતિમાં એ કલ્યાણનગરમાં શરણોના અનુભવમંડપમાં પુરુષસંતો અલ્લમ પ્રભુ આદિને મળવા ગયાં હતાં - વિવાદ થયો હતો પણ અક્કાની વાત માનવામાં આવેલી. લલ્દેશરીએ તો લખ્યું છે :

ગુરુએ ઉપદેશ આપ્યો  
બહારથી તું અંદર જા  
એ વાત મને સ્પર્શી ગઈ  
હું વિવસ્ત્રા બની નાચવા લાગી

લલ્દેશરીએ એક વાખ્યમાં કહ્યું છે - 'હું તપસ્વિની આ સંસારમાં આવી અને બુદ્ધિના પ્રકાશથી 'સહજ' (સ્વાત્મ)ને પામી લીધો.'

લલ્દાની વાખ્ય નિશ્ચ રહસ્યાનુભૂતિની અભિવ્યક્તિ છે; કબીર, અખાની જેમ રેમાં આત્માનુભવનો રણકો છે : 'બુધુમ પંડિત' ઈશ્વરનો મેં અનુભવ કર્યો છે, ('આ પ્રત્યક્ષ મુખોમુખ વાતો કરે - અખો) પંડિત = ઈશ્વર. લલ્દાની જે વાણી ઉચ્ચારિત થતી તે મંત્રસૂદ્ધ બની જતી.

તે કહે છે : શિવ અને શક્તિને એક સાથે અભિન્ન જોયાં / શિવને ચરાચરમાં વ્યાપ્ત જોયાં.

વળી એક વાખ્યમાં કહે છે : 'મેં (લલ્દાને) પોતાનાં જ વાખ્યની મહિરા પીધી છે...

અને એ રીતે હું છેવટે એ પરમવિભુના દરબારમાં દાખલ થઈ.' આ યોગેશ્વરીને મન જન્મમૃત્યુ એકસરખાં છે -

**‘મારે માટે જન્મમરણ છે એકસરખાં  
ન તો હું કોઈ માટે રહીશ  
ન કોઈ મારે માટે રહેશે...’**

કશ્મીરી ભાષાને દાર્શનિક વિચારધારા લલ્લેશ્વરની આ વાખ્ય દ્વારા મળે છે.  
સાંભળો -

**ત્યાં ન તું છે, ન હું છું  
ન ધ્યેય ન ધ્યાન  
સર્વ કારક બલ પણ ત્યાં  
થઈ જાય છે અંતર્ધાન.**

લલ્લેશ્વરીએ આ મનુષ્યદેહની મહત્તમાની વાત કરી છે. એક વાખ્યમાં કહે છે - ‘આ દેહમાં જ તો એ ‘પંડિત’ (ઈશ્વર)નો નિવાસ છે. જીવતાં જીવત એને નહિ જુઓ તો મર્યાદી તો કેમ કરી જોશો ?’

એટલે લલ્લેશ્વરી માટે આ જગત માયા કે ઉપહાસપાત્ર નથી.

**‘શિવમય ચરાચર જગ પશ્યા / બધા જડ કે ચેતન પદાર્થ  
અસીમ સંસ્કૃતિનું આ સર્જન / શિવમાં જ પૂર્ણિમગન....’**

(સંદર્ભ : જ્યાલાલ ડોલકૃત ‘લાલ વૈદ’ સા. અકા.)

જેમ મીરાં દ્વારિકાધીશ કૃષ્ણમાં સમાઈ ગયાં હતાં, અને અક્કા મહાદેવી ચેન મલિકાર્જનમાં એવી જ કથા લાલ વૈદની છે. એક મોટા માટીના વાસણમાં બેસી ઉપરથી બીજા વાસણથી એ ઢાંકી દીધું. પછી ઉપરનું વાસણ ખસેજું - તો પાત્ર ખાલી !

કવિ ઉમાશંકરે ‘Four Women Saint Poets of India’ (મીરાં, અક્કા મહાદેવી, લાલ વૈદ અને અંડાલ) નામના લેખમાં લલ્લેશ્વરીની વાશીમાં ઉપનિષદનો ‘થૈન’ હોવાની વાત કરી છે, એમને વૈદ કબીરની નિકટનાં લાગ્યાં છે.

લલ્લેશ્વરી તો ખાસું લાંબું જીવાં હતાં એટલે તો વૈદ (દાદી) કહેવાયાં, અક્કા મહાદેવી તો ત૦ પૂરાં કરે, એ પહેલાં જ કહેવાય છે તેમ, શ્રી શૈલ પર ચેન મલિકાર્જનમાં વિલીન થઈ ગયાં હતાં. મીરાંની જેમ એક રાજ્યી સાથે એમનાં લગ્ન થયાં હતાં, પણ અક્કા તો નાનપણથી ચાહતાં હતાં ચેન મલિકાર્જન(શિવ)ને. ચેન = સુંદર. એમનાં વચનોમાં અક્કા(મોટીબહેન)એ ચેન મલિકાર્જનના મિલનની વાત કરતાં દૈહિક કલ્યાણ પ્રયોજવામાં સંકોચ નથી કર્યો. એમનાં એકબે વચનો જોઈએ, જેમાં ચેન મલિકાર્જનનો પ્રેમ દાર્શનિક ભૂમિકાએ વ્યક્ત થતો જોઈ શકાય :

**ફળોના ચૂંટાયા પછી  
એડ કપાયું કે ન કપાયું  
તે મહાત્વનું ખરું ?**

**વરના ગયા પછી  
સ્ત્રીનો કોણ પ્રેમી  
તે મહાત્વનું ખરું ?  
માટીના ધોવાણ પછી  
ખેતરને કોણ ખેડે  
તે મહાત્વનું ખરું ?  
ચેન મલિકાર્જનના સપ્તાત્કાર પછી  
આ કાયા થાને ખાધી કે પાણીમાં સરી ગઈ  
તે મહાત્વનું ખરું ?**

(અનુ. પ્રદીપ ખાંડવાલા)

બીજું વચન છે :

**બૂખ માટે નગરમાં લિક્ષાના  
તરસ માટે ફુડ-વાવ-નીક  
શયન માટે મંદિરનાં ખાંડિયેર  
આત્મના સંગ્રામ માટે તમે  
ઓ ચેન મલિકાર્જન !**

(અનુ. પ્રદીપ ખાંડવાલા)

હવે આપણે ત્રીજાં એક સંત કવયિત્રી - આપણા ગુજરાતનાં ગંગાસતી વિષે થોડું જોઈશું. ગંગાસતી તો છેક અંગણીસમી સરીમાં થઈ ગયાં. ગુજરાતમાં રવિભાગ સંપ્રદાયની પરંપરા ઉપરવાસ જતાં કબીર સુધી પહોંચે. ૧૮મી સદીમાં થઈ ગયેલા ભાષસાહેબ શાનમાર્ગી કવિ હતા, જે કબીરનો અવતાર ગણાતા. ભાષસાહેબના શિષ્ય રવિસાહેબથી જે પંથ ચાલ્યો તે રવિભાગ સંપ્રદાયમાં કબીરના શાનમાર્ગની ઉપાસનાપદ્ધતિ છે. એ પંથમાં બીજા સંતો સાથે ગંગા સતી આવે છે. એમનાં પદો પાનબાઈ નામે એમની સેવિકાને સંબોધીને રચાયાં છે. તેમનું એક જાણીતું બઢું બઢું ઉદ્ઘૂત થતું અને ગવાતું પદ અહીં વાદ કરી લઈએ :

**વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ  
નહિતર અચાનક અંધકાર થારો...**

S S S

**ભાઈ રે ! નિરમળ થઈને આવો મેદાનમાં પાનબાઈ !  
જાણી લિયો જીવની જાત,  
સજીતિ વિજાતિની જુગતી બતાતું ને  
બીબે પાડી દઉ બીજા ભાત...  
ભાઈ રે ! પિંડ બલાંડથી પર છે ગુરુ, પાનબાઈ,  
તેનો દેખાડું હું તમને દેશ**

## ગંગા રે સતી અને બોકિયાં રે, ત્યાં નહિ માયાનો જરીયે લેશ...

એમના આ પદમાં જીવ, પિંડ, બ્રહ્માંડ, માયા આહિ આપણી દાર્શનિક પરંપરાની પદાવલિ એક પરમ આત્મવિશ્વાસ અને આત્માનુભૂતિની ભૂમિકા પરથી થઈ હોવાનું અનુભવાય છે.

આપણે કવિતા અને દર્શનના સંબંધની વાત કરતાં કરતાં મુજબતે કવિતા અને ભક્તિની વાત કરીએ છીએ. જે સંત-ભક્ત કવિઓની વાળીનું આપણે પરિશીલન કરવાના છીએ, તે પારિભ્રાષ્ટક અર્થમાં દાર્શનિકો નથી, ભક્તો છે – એવા ભક્તો જે કોઈની કોઈ આપણા દેશની ધાર્મિક – દાર્શનિક પરંપરા સાથે જોડાયેલા છે. કઈ નહિ તો આપણને એમની એવી દર્શનપરંપરા કે પંથપરંપરા સાથે જોડીને ચર્ચા કરવાનું ફાંચે છે. અખો એટલે જ્ઞાનમાર્ગ વેદાન્તી, કબીર તો નિર્ગૃહ્ણોપાસક, સુરદાસ તો પુષ્ટિમાર્ગ વૈષ્ણવ, યશોવિજયજ્ઞ જેણ ધર્મવિલંબી, લલ્યેશ્વરી કાશ્મીર શૈવ તો અક્કા વીર શૈવ પંથી એ રીતે.

ખરેખર, તેમ હોવા છતાં આ સૌ ભક્તકવિ કે કવિયત્રીઓ છે, અને તેમની વિશેષતા એ તેમની પોતાની આત્માનુભૂતિની અભિવ્યક્તિ છે. પ્રેમભક્તિ સાધના કરતાં કરતાં થયેલી સાક્ષાત્કારની ક્ષાળોની એ અભિવ્યક્તિ છે, આત્માનુભવની અભિવ્યક્તિ છે. એ અનુભૂતિને કોઈ દર્શનના માણખામાં ગોડવવાનો ભલે આપણે પ્રયાસ કરીએ, પણ તેમની અનુભૂતિ તાકિક પ્રમાણોની આશ્રિત નથી, એ તો હદ્દગત છે. તેમાં જ્ઞાનચર્ચા છે, પણ એ જ્ઞાન તો આંધી રૂપે આવે છે, જેમ કબીર કહે છે – ‘સંતો ભાઈ, આઈ જ્ઞાન કી આંધી.’ જ્ઞાન પણ અનુભૂતિમૂલક. આ ભક્તોની વાળીમાં ભગવદ્ પ્રેમના સંસ્પર્શ સાથે વૈરાગ્યનો ગેરુરંગ છે. એટલે એ સૌ વિભિન્ન પંથમાર્ગના અનુયાયી કે અનુસરનાર હોવા છતાં આ ભક્ત કવિઓની પ્રેમવાણી આજે પણ આપણને કાવ્યઆનંદની સાથે એક પરમના આનંદનો પણ સંસ્પર્શ કરાવી જાય છે.

અહીં હું આ પરિસંવાદનું આવું રૂં આયોજન કરનાર શ્રીમદ્ રાજયંદ આશ્રમ અને ગુજરાતી સાહિત્ય પરિષદ્ધને ધન્યવાદ આપું છું. અને મને એમાં વક્તવ્ય આપવા નિમંત્રણ આંધું, એ માટે આભાર માનું છું.

શ્રીમદ્ રાજયંદ આશ્રમ, ધરમપુર

૧-૧૨-૦૭

## ગુજરાતી સંતસાહિત્ય : મૂળ અને કુળ | નરોત્તમ પલાશ

ભારતની કોઈ પણ પ્રાદેશિક ભાષાના સંતસાહિત્યની ચર્ચા ભારતીય સંસ્કૃતના સમગ્ર પરિશ્રેષ્ટમાં જ થઈ શકે. પૌરાણિક માન્યતા અને પ્રાપ્ત પુરાવશોષોના પ્રકાશમાં છેલ્યાં પાંચ હજાર વર્ષની સમૃદ્ધ પરંપરા ભારત પાસે છે. આ પરંપરાની મુજબ ખાસિયત એ છે કે તેણે પ્રમાણેલાં જીવનમૂલ્યોમાં સહન કરવું, સમન્વય કરવો, વ્યક્તિ માત્ર તરફ સદ્ગ્રાવ અને સતત ઊંચું નિશાન અથવા વધારે બહેતર જીવન પ્રાપ્ત કરવાનો દાર્શનિક અભિગમ.

ભારતીય જીવનસાધનાનું આ ‘સનાતન સત્ય’ આજે સહીઓ પછી પણ બિન્ન મણકાઓમાં રહેલા સૂત સમું એકધારું અને અસ્ક્રુષ્ય છે. આ સૂત્રને કાયમ રાખતી પરંપરામાં સ્થળકાળ મુજબ અનેકાનેક ઉપપરંપરાઓ ઉદ્ભવી છે અને તેણે સંસ્કૃત, પ્રાકૃત, અપભંશ તથા પ્રાદેશિક ભાષાઓને સમૃદ્ધ બનાવેલ છે.

સંસ્કૃત સામે પ્રાકૃત, પ્રાકૃત સામે અપભંશ, અપભંશ સામે પ્રાદેશિક ભાષાઓ તથા પ્રાદેશિક ભાષાઓ સામે લોકબોલી છે. આ પ્રત્યેક ઉત્તરતી કક્ષા, બિન્ન સાહિત્યસરવાળીની જનેતા છે. પ્રાકૃતમાં બૌદ્ધ અને જૈનોની વાણી, અપભંશમાં આલવાર, નાયન્માર અને નાથવાણી, પ્રાદેશિક ભાષાઓમાં અક્ક મહાદેવી, રામાનંદ, કબીરવાણી, નાનકવાણી, તુકારામના અંબંગો અને લોકબોલીમાં આપણી ભજનવાણી છે. સંત સાહિત્યને સમજવા માટે આટલી પૂર્વીઠિકા નજરમાં રાખવી આવશ્યક છે.

સંત સાહિત્યનાં મૂળિયાં અતિ પ્રાચીનકાળમાં છે, પરંતુ જેણે ‘સંત સાહિત્ય’ એવી સંજ્ઞા મળેલી છે તે મધ્યકાળનું સર્જન છે. આ સર્જન પાછળનાં પરિબળોમાં વિધર્મી આકમણો, તીવ્ર બનેલી આભદ્રાણીની ભાવવના અને વારેવારે આવતા કુદરતી તથા માનવસર્જિત દુકાળો મુજબ છે. સામાન્યતા: આકમણો આવતાં અને ચાલ્યાં જતાં, પરંતુ બારમી સરીના અંતમાં પૃથ્વીરાજ યૌધાણીની હાર થતાં દિલ્હીમાં વિધર્મી શાસનનો પ્રથમ વાર પાયો નંખાયો. જરા હિતિસ જુઝો, તેરમી સરીના આરંભથી કમશા: ઘોરીવંશ, ગુલામવંશ, ખીલજવંશ, તુલબુકવંશ અને લોદીવંશ છે. આ લોદીવંશના શાસનકાળ દરમિયાન સ્વામી રામાનંદ અને કબીર છે. આ સંતોની વાળીને સમજવા માટે તુલબુક અને લોદીવંશની વચ્ચે તેમૂર લંગનું જે આકમણ થયું તેની એક નાનકડી પણ સંતસાહિત્યની પ્રકૃતિને ઘડનારી અને ચાવીરૂપ થઈ પડે તેવી ઘટના ધ્યાનમાં લેવા જેવી છે. સમરકંદનો કુર અને કંડર મુસ્લિમ શાસક તેમૂર, ચૌઢીના ઉત્તરાર્ધમાં અફઘાનિસ્તાન થઈને ભારત ઉપર ચડી આવ્યો. રસ્તામાં તેણે હજારો લોકોની હત્યા કરી અને દિલ્હીના તુલબુક શાસનનો પરાબવ કરી તેણે અદારમી ડિસેમ્બર ૧૯૮૮માં દિલ્હીમાં પ્રેશા કર્યો. માત્ર પંદર દિવસના શાસનમાં તેણે પકડાયેલા પચાસ હજાર કેદીઓમાં જે મૂર્તિપૂજક હોય તેની કતલ કરવાનો આદેશ આપ્યો. દિલ્હીમાં રહેતો મુસ્લિમ, મૂર્તિપૂજકની કતલ નહિ કરે તો તેની પણ કતલ થશે આવા ફરમાને બન્ને કોમોમાં હાહાકાર વરતાવી દીધો. મૌલાના નસરુર્રીન જેણે આખી જિંદગીમાં એક કબૂતર પણ માર્યું નોંધું તેણે પંદર હિન્દુઓનાં માથાં ઉડાડ્યાં !

આ ઘટનાએ હિન્દુ-મુસ્લિમ બન્ને પક્ષના સંતસાહિત્યને પોતાના ધર્મનો મર્મ સમજવાની ફરજ પાડી અને આજે જેણે આપણે સંતસાહિત્ય તરીકે ઓળખીએ છીએ અનો ચેતનવંતો પ્રવાહ દેશને પૂણેખૂણે વહેતો થયો. નાનામોટા અનેક સંતો સમન્વયને ગાતા રહ્યા અને જીવારે બહુ થયું ત્યારે મહારાષ્ટ્રના સંત સ્વામી રામદાસે શિવાજીના હાથમાં અને સૌરાષ્ટ્રના સંત સ્વામી પ્રાણનાથે ઇત્રસાલના હાથમાં હથિયારો પણ પકડાવ્યા ! સંત સાહિત્યનો આ મિજાજ પણ માર્યું નોંધવા જેવો છે.

સંતસાહિત્યની બીજી લાક્ષણિકતા ઊચનીયના ભેટ સામેનો સંઘર્ષ છે. વિધર્મી આકમણકારોએ સત્તા હાંસલ કરી કે તુરત આપણો ઉચ્ચવર્ગ એમના પક્ષે બેસી ગયો છે. મધ્યમ અને નિમન વર્ગની કેવી સ્થિતિ હતી તેનો ચિત્તાર સંતસાહિત્યમાં મળે છે :

તુલસીદાસ 'વિનયપત્રિકા'માં કહે છે કે ખેડૂતો ખેતી અને વણિકો વેપાર કરી શકતા નથી, માર્ગી ભીખ – પણ ક્યાંય મળતી નથી. 'જીવિકાવિહીન લોક શોચમાન, કહે એક ઐકન સોં કહાં જઈ? ક્યા કરે?' દારિદ્ર રૂપી દશાનન તૃઠી પડ્યો છે. ગુજરાતી સંત કવિયિત્રી અમરરમા કહે છે : 'કાળિઓ આખ્યો છે આતપાતનો.' મોરારસાહેબ તો મહંત મુલ્લાને સ્પષ્ટ સંભળાવી દે છે : 'કાચા ભડાં કામ ને આવે, જીરવ્યાં કેમ જિરવાશે?' સાચો ધર્મ સમજો ભાઈ, સાચો ધર્મ સમજો. જાતિપાતિ ભૂલો, ભૂખ્યાને ઓટલો અને રોટલો આપો. 'દીવાસ સરખું દાન અન્નનું, દર્દી શકો તો દો.'

સંતસાહિત્યનું આ સમગ્ર ચારિત્ર જોવા જેવું છે. પરંપરાગત ધર્મસાધનાના કર્મકાંડોથી એકદમ મુક્ત અને ઈહજીવનનાં દુઃખદર્દોમાં સહભાગી બનીને ઈશ્વર અલ્લાહને આરાધો. દિક્ષિણા સંતકવિ વેલ્વાલ (અઘ્યા)ની શિવકીર્તન કરતાં કરતાં થતી દિનચર્યાનોંધવા જેવી છે. વેલ્વાલ બૌદ્ધ હતા, જૈન હતા અને શૈવ પણ હતા. કહે છે કે દેવમંદિરમાં અંદર જવાના બદલે મંદિરની આજુભાજુના કાંટા-કસ્તર અને ખડ સાફ કર્યા કરતા, ખડ કાપતા વેલ્વાલનો જૈનોએ વિરોધ કર્યો : 'જીવિસા થાય છે.' વેલ્વાલ કહે : 'હું તો આપને કેઈ અડયાણ ન થાય એટલા માટે પ્રવૃત્ત છું.' કળને જાણીને અકળને ઓળખવાનું દર્શન સંતસાહિત્યની ધોરણનું છે.

સંતસાહિત્યના, સાહિત્યની નજરે પણ લેખાંજોખાં માંડવા જેવાં છે. ભારતની પ્રત્યેક પ્રાદેશિક ભાષાના ઉદ્ભવવનું એક કારણ ધર્મધારિત સાહિત્ય રહેલું છે. આ સાહિત્યમાં ભાવપક્ષે અને કલાપક્ષે કમશાઃ જે સૂક્ષ્મતા સિદ્ધ થઈ તેનાં દર્શન સંતસાહિત્યમાં થાય છે. ધર્મધારિત સાહિત્યમાં મનોરંજનાર્થે રચાયેલાં પૌરાણિક આખ્યાનોનો વર્ગ પ્રમાણમાં વિશાળ છે, જ્યારે સંતસાહિત્ય, જે માત્ર અને માત્ર પરમતત્ત્વની આરાધનાર્થે છે, તે પ્રમાણમાં અલ્ય અને સાહિત્યિક ગુણવત્તાની દસ્તિએ ઉત્તમ સાહિત્ય છે. સંતસાહિત્ય મૂલતઃ નિર્ણયધારાનું સાહિત્ય છે, પરંતુ આચાર્યાની માફક સંતોમાં મતમંડન કે મતમંડનની પ્રવૃત્તિ નથી એટલે નિર્ણય સાથે સગુણ ઉપાસના પણ જોડાજોડ વણાતી આવી છે. અહીં એક પણ સાધનાપદ્ધતિનો વિરોધ નથી. ભગવો, લીલો, કાળોકે સફેદ દરેક વાવટો અહીં સ્વીકાર્ય છે અને એમાંથી જ, આજે આપણે જેને સંતસાહિત્યના 'કુળ' કહીએ છીએ તે નાથ, દશાનમી, રામાનંદી, કબીરિયાં, મહાપંથી, રવિભાગ, માર્ગી અને નિરોત્તી વગેરે અસ્તિત્વમાં આવ્યા છે. અમુક કુળ પ્રાચીનકાળથી હતાં જે મધ્યકાળમાં સંત પરંપરામાં ભણ્યાં છે. ગુજરાતી સંત સાહિત્યમાં નાથ પાયારુપ છે. દશાનમીનું ઉદ્ભવરસ્થાન આદ્ય શંકરાચાર્યજી અને રામાનંદીનું ઉદ્ભવ સ્થાન આચાર્ય રામાનુજ છે, હરિયાળી આદિ આચાર્ય નિમબાઈની પરંપરામાં છે, જ્યારે મહાપંથ નાથનું પ્રાદેશિક સ્વરૂપ અને રવિભાગ રામાનંદીનું પ્રાદેશિક સ્વરૂપ છે.

આ દરેક કુળમાં 'ભજન' કેન્દ્રસ્થાને છે. ભજન સાંજથી સવાર સુધી ગાવાનો કાવ્યપ્રકાર છે, તેની પાછળ પણ આમ વર્ગ રહેલો છે. રોજનો રોટલો રોજ રળતી પ્રજા સવારથી સાંજ સુધી તો કામ ઉપર હોય, નિરોત્તની જે કેઈ વેળ મળે તે રાત્રિ દરમિયાન જ હોય. આ સામાજિકતાએ ભજનના કાવ્યસ્વરૂપને ઘાટ આખ્યો છે. ભજનમાં તળપદા શબ્દો, તળપદા લય-લહેકા-લઢણ અને ઢાળ તેમજ તળપદી રજૂઆત છે. રાત્રિના પ્રહર

મુજબના રાગઢાળ તો ભજનમાં ફછળના કમે આવ્યા છે. 'સ્તોત્ર' આદિ સંસ્કૃતસ્વરૂપો વેદવાણીમાંથી નિષ્પન્ન થયેલાં છે, જ્યારે 'ભજન' લોકવાણીથી ઉદ્ભવવેલું સ્વરૂપ છે. ભજનના રચનાર ગોરખ, કબીર, તોરલ, મૂળદાસ, મેચરણ, ભાણસાહેબ, રવિસાહેબ, હોથી, મામદ, દાસીજીવણ, લોયણ, વેલનાથ, ગંગાસતી વગેરે સંતકવિઓ ગુજરાતી સંતસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, એમની રચનાઓ પણ કાવ્યતત્ત્વથી ભરપૂર અને પોતપોતાની સાધના- પરંપરાને સુપેરે પ્રગત કરનાર છે. 'એરાજ અજબ બનાયા' / 'મુખડા ક્યા દેખે દરપન મે' / 'પાપ તારું પરકાશ' / 'સુંદરવરની ચૂંદાંડી' / 'વરસે ધરતી, ભીજે આસમાન' / 'અમૃત બુંદ સે પુરુષ જાયા' / 'સેવા મારી માની વેજો સુંદાણા, ખોલો મારા રૂદ્ધિયાના તાણાં, તોળો મારા કબુલિના જાયા' / 'મૂળ રે વિનાનું કાયા ઝડાવું' / 'જ સોહાગણ જા, ગણમાં જોપોત જલત હે, જા !' / 'જ રે લાખા, હેત રે વધારો તો પરને પમાય' / 'વીજળીના ચમકારે મોતીંડ પરોવો, પાનબાઈ !' આદિ ગુજરાતી સંતસાહિત્યની અમર રચનાઓ છે.

હિન્દીની જેમ ગુજરાતી અને રાજસ્થાની ભાષાનું આરંભનું સાહિત્ય સંતસાહિત્ય (નાથવાણી) રહેલું જાયાય છે. ઘણા અભ્યાસીઓ કબીરના પ્રભાવે ગુજરાતી સંતસાહિત્યને ગણાવે છે, પરંતુ ગુજરાતી સંતસાહિત્ય ઉપર જોવા મળતો ગણેશપ્રભાવ આ વાતનું સ્પષ્ટ સૂચન કરે છે કે કબીર નહિ, ગોરખ ગુજરાતી સંતસાહિત્યના પ્રેરક છે. ગુજરાતી સંતસાહિત્યના આધારભૂત રચમાપિર તો સીધા જ નાથ પરંપરાના અનુયાયી છે. મેચરણ પણ પોતાને મધુંદરનાથના બેટા તરીકે ઓળખાવે છે.

ગુજરાતી સંતસાહિત્ય પરનો ગણેશપ્રભાવ, એક સાવ નૂતન તથનો નિર્દેશ પણ માંનું જેમ ગણેશવંદનાનથી, તેમ આપણા વેદસાહિત્યમાં પણ ગણેશવંદના શવંદનાની આ સરવાણી નાથવાણીમાંથી છે અને નાથવાણી સંભવત: પ્રાચીન ગાનું સંતાન છે. રવીન્દ્રનાથે 'હું ત્રાત્ય છું' કહીને વેદવિરોધી ગણાતી વિચિત્ર એવી રાનો પુરસ્કાર કરેલો છે. માં, સંતકવિ મેચરણ કહે છે તેમ સંતસાહિત્ય તે 'સવરી વાણી' છે, એમાં રહેલો પણ ધરતીથી ઊઠીને આકાશને ભીજેંબે છે.<sup>5</sup>

<sup>5</sup> સાહિત્ય અકાદમી, દિલ્હી પ્રેરિત તા. ૩૦ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ સોમનાથ મુકામે યોજાયેલા 'ગુજરાતી સંતસાહિત્ય' પરિસંવાદનું બીજભાષણ.




### કેફિયત

(૧૧૩) નવલકથા અને હું (નવલકથાકારોની કેફિયત):  
સંપા. હર્ષદ નિવેદી, ૨૦૦૮, પ્રકા. ગુજરાત સાહિત્ય અકાદમી,  
ગાંધીનગર, પૂ. ૧૦૪૩૪૮, રૂ. ૧૬૦/-



## સમીક્ષા/ગ્રંથાવલોકન

### વર્ષ ૨૦૦૬ ની ગુજરાતી કવિતાનો ચહેરો | સ્થિલાસ પટેલિયા



**ગુજરાતી કવિતાચયન : ૨૦૦૬ :** સંપા. વિનોદ જોશી, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્ર. આ. ૨૦૦૮, પૃ. ૧૧૬, ડિ. ૩. ૭૦/-]

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી કવિતાચયન’ ગ્રંથમાળાના સોળમા મજાકાનું સંપાદન વિનોદ જોશીએ ‘ગુજરાતી કવિતાચયન ૨૦૦૬’ કાવ્યગ્રંથ રૂપે કર્યું છે.

જુદા જુદા સ્વરૂપમાં રચાયેલી ૬૨ રચનાઓ આ સંચયમાં છે. ગીત, ગઝલ, સૌનેટ, લાંબી રચના, દીર્ઘ રચના, અછાંડસ આદિ સ્વરૂપમાં

વિવિધ વિષયોને વ્યક્ત કરતી રચનાઓ અહીં છે. સાત દીર્ઘ કાવ્યો છે. ત્રીસેક જેટલી ગજલો છે. દસ ગીતો છે. દસ જેટલી અછાંડસ રચનાઓ છે. એકબે સૌનેટ ને અન્ય રચનાઓ છે.

‘તુષ્ટિકર કાવ્યસિદ્ધિ’ શીર્ષક અંતર્ગત સંપાદક વિનોદ જોશીએ જે કેફિયત રજૂ કરી છે એ એકદમ સ્પષ્ટ તથા તટસ્થ ભાવકની તો છે જ, એમાં સંપાદકીય વિલક્ષણ સૂઝ તથા સંપાદક સ્વયં કવિ હોવાને કારણે કાવ્યસર્જનપ્રક્રિયા દરમિયાન જન્મતા સર્જકીય પડકારોનો કેવો મુકાબલો થયો છે ને શું નીપજી આવ્યું છે એનો ચોખ્યો હિસાબ પણ અહીં છે. માટે જ સંપાદક કહી શક્યા છે : ‘કશુંક ચિદયાતું લાગ્યું હોય તો તે જરૂર ન કરવાની લાલચે લગીર કચાશવાળાં કોઈ કાવ્યો પણ અહીં લીધાં છે.’ (પૃ. ૪) સંપાદકનો અભિગમ કાવ્યતત્ત્વની સાથે સાથે સૌન્દર્યસ્થાન શોધવાનો પણ રહ્યો છે એનો પરિચય આમાંથી મળે છે. આમ છતાં ‘પસંદગીનું ધોરણા’ એમજો ઢીલું પડવા દીધું નથી. સંપાદક સ્વીકાર્ય જ છે કે બધાં જ ઉત્તમ હોવાનું નહીં કહી શકાય છતાં આ કાવ્યો પર સંપાદકની ‘પસંદગીની મહોર’ અવશ્ય છે જ ! એનો પ્રતીતિ થાય જ છે. રૂચિભેદના પક્ષનો સંપાદકે સ્વીકાર કર્યો જ છે ને એવો ભેદ તો રહેવાનો જ છતાં સોનું અને કથીરનો ભેદ તારવવો ને જે સારું-સાચું છે એ સારવી લેવું એમાં જ સંપાદકર્મ છે, જે અહીં ખંડિત થયો નથી. બહુ મોટા ઢગલામાંથી સુવર્ણકણ વીણી લેવા, દુષ્કર કર્મ છે. અધ્યાત્મ રચનાઓના ખડકલામાંથી આવાં ને આટલાં કાવ્યો વીણવાનું સાહિત્યક કર્મ પણ અવશ્ય કર્સોટી કરનારું હોય જ !

આ સંચયમાં ગજલો વધારે છે એ બતાવે છે કે દરેક વર્ષની જેમ, વર્ષ ૨૦૦૬ દરમિયાન પણ ગજલો વધારે પ્રમાણમાં રચાતી આવી છે.

પુષ્ટ ગજલોમાંથી તારવેલી થોડીક ગજલો ખરેખર ભાવસંતર્પક છે. ગંભીર અને ઊંડી છે. વિષયનું વૈવિધ્ય ઓછું જ્ઞાય પણ ગજલના પ્રત્યેક શેરનું તંતોતંત નિર્વહણ કલાત્મક પ્રતીત થાય છે. શિષ્ટ કાવ્યબાની, નાટ્યાત્મકતા, વંગકટાક્ષના સૂરો અને સ્વ સાથેના સંવાદમાંથી

જન્મતી આત્મખોજ અહીં છે. કેટલીક ગજલો સંવેદનસિક્ત છે જે સ્પર્શી જાય છે.

**‘આવ, ને આવીને કઈ રક્જક ન કરો’** (પૃ. ૦૨)

સાવ ખાલી આંખને ભરયક ન કરો’ (પૃ. ૦૨) માં અંકિત નિવેદીએ જે નાટ્યાત્મકતા પ્રગટાવી છે એ પ્રભાવક છે. ‘નીકળ’ રચનામાં મનહર જાનીએ પણ આવી નાટ્યાત્મકતા રચી છે. એમાં જાત સાથેનો હિસાબ પણ છે. ઉત્થનન છે. એટલે એમાં ઊડાણ પણ છે. કિરણ ચૌહાણની ‘સાહેબ’, ગૌરાંગ ઠકરની ‘થાય છે’, ચાંદેશ વ્યાસની ‘એક માણસ’ આદિ ગજલોમાં વંગકટાક્ષ છે. જમાનાનું ચિત્ર પણ છે. ‘સાહેબ’ રચનામાં સત્તા સામે વંગ છે.

**‘શિખર પર આપ પહોંચા છો, હવે પહોંચીને કરશો શું ?**

**તળે સંભળાય એવી બૂમ તો પાડી જુઓ સાહેબ !’** (પૃ. ૧૭)

કેટલીક ગજલોમાં જાત સાથે વાતચીત છે. એ સંવાદાત્મક લાગે. એમાં આત્મખોજ પણ છે. ખુમારી પણ છે. વળી, કશીક સંબંધરૂત ક્ષણ સાથે મુકાબલો હોવાથી એ પ્રતીતિકર પણ બની રહે છે. ગુણવંત ઉપાધ્યાયની ‘સાચવજે’, ગુલામ અભિસાસની ‘કરગરવું...’, રવીન્દ્ર પારેખની ‘ગઝલ’, રિષ્ભ મહેતાની ‘આંખોમાં...’ કે સુરેન્દ્ર કિરિયાની ‘ગઝલ’માં આ તત્ત્વ અનુભવવા મળે છે. એકાદ ઉદાહરણ :

• ‘ક્યાં તો તું જળ વચ્ચે જુવાળ ન કર

યા પછી જળની ફરતે પાળ ન કર.’ (પૃ. ૭૬)

• ‘જગરણ આંખોમાં લઈને જાઉં ક્યાં ?

**તપ્ત રણ આંખોમાં લઈને જાઉં ક્યાં ?** (પૃ. ૮૫)

અનુક્રમે રવીન્દ્ર પારેખ તથા રિષ્ભ મહેતાની ગજલોના આ બે નમૂનામાં જ નહીં, સંંગ ગઝલમાં ઉપર્યુક્ત વલણ પ્રતીત થાય છે. હનીક સાહિલની ‘મરણને જળવજો’ ગઝલ કે દાન વાદેલાની ‘ગઝલ – ધાણાં વર્ષો પછી’માં આપણા હેઠાને આર્દ કરી મૂકે તેવી ઘેરી ને તીવી વેદનાસિક્ત પળોનું કલાત્મક પ્રગટીકરણ થયું છે. આમ, લંબાણભયે વધારે ઉદાહરણ ટંકી શક્યા એમ નથી. પરંતુ એટલું તો કહેતું જ પડે કે આ ગજલો ભાવ અને ભાવાભિવ્યક્તિ – બંનેના સંદર્ભમાં નોંધપાત્ર છે. આદિલ મન્સૂરી, રાજેન્દ્ર શુક્લ જેવા આપણા પ્રતિભાવંત ગજલકારોની ગજલો પણ અહીં છે, તો નવા ચહેરાઓની ઓળખ પણ અહીં છે.

પ્રમાણમાં લાંબાં ને દીર્ઘ કાવ્યો પણ આ. સંચયમાં છે. ઊર્મિલા. ઠાકર- રચિત ‘ક્લિબ... ડિલીટ... ડિલીટ’ રચનામાં ફીન, મોબાઇલ, ફેક્સ, ઈ-મેઈલ, આઈડી, પાસવર્ડ, વેબ સાઈટ, કમ્પ્યુટર આદિ યંત્રયુગના આધુનિક ઉપકરણોમાં કેવી રીતે સાચો શબ્દ લુપ્ત થઈ ગયો છે ને કેવી રીતે માનવસંબંધમાંથી સ્નોહ ને સચ્ચાઈ ગુમ થઈ ગયાં છે, એનું આલેખન છે. પ્રયોગશીલતા પ્રભાવક બની છે. બે સમયને અથડાવ્યાં છે ને કરુણવક સ્થિતિ રચી છે. ‘કોણ છું હું ? ક્યાં છે મારો ચહેરો ?’માં આ સ્થિતિની પરાકાણ જેવા મળે છે. ‘ધરજુચાપો’માં વતનવિચ્છેદ છે. વિદેશમાં રથ્યા રથ્યા જે રીતે ઘર-વતન નાયકને વળગે છે એનું જફસ્ટાપોઝ વેદક છે. ૧૦ બંડમાં વહેંચાયેલી આ રચનામાં લોકગીત – લોકકથા, ગ્રામેચેતના, ધૂળિયા ગામનાં સ્મરણો, પાત્રસુષ્ટિ આદિનું સુંદર સંયોજન થયું છે. ફિલ્મની ટેકનિકનો અહીં વિનિયોગ છે. નાટ્યોર્ભિ તથા આત્મખોજાંથી જન્મેલો નાયકનો અવાજ

હદ્યસ્પર્શ છે. બાબુ સુથારની આ રચના અનેક રીતે નોંધપાત્ર છે. યજોશ દવેની ‘હેલો’માં ચમદ્દેવપીરના ડેલોનો ભાવસંદર્ભ વિસ્તરતો રહ્યો છે ને આજના સમયના માનવચહેરને પ્રગટાવનારો બન્યો છે. વ્યાગકટાક્ષ પણ કલાત્મકતાથી આવ્યો છે. વિવિધ કાફુંઓ અને ટિપ્પિકલ હિંદ્યો ભાષાનો પ્રયોગ આ રચનાને સુંદર બનાવવામાં ભારે ભાગ ભજે છે. હરીશ મીનાશ્રુની ‘પંખીપદારથ’માં પંખી પ્રતીકાત્મક સંદર્ભ રહ્યો છે. તેજ, ગતિ, આકાશ અને અંતે જતા વિશાળતાનો સંદર્ભ પંખીમાંથી ફૂટો આવ્યો છે એ વિસ્મિત કરી દે છે. ‘દૂધ’ નામની સિતાંશુ વશશંકની દીર્ઘ રચનામાં ગાંધીજી અને બકરી કેન્દ્રસ્થ છે. બોલીના લયલહેકા-કાફુંઓમાં જ આખુંય કાવ્ય ચાલે છે. હાસ્યવ્યંગકટાક્ષની સેર સમાંતરે ચાલે છે. બકરી બચાવતા ગાંધી જે રીતે ચિનિત કર્યા છે અની અહીં મજા છે.

મૌચકે બેઢા છે મા’રાજા, ને ભેળા વાઈશર-ગવર્ડર,

એમ્હી બોમ્હી, શીયેમ-પીયેમ, વર્લ-બેન્ક તવંગર

શધુ શમજ્યો – શમજ્યા પણે અટકે તો ગાંધી શેનો ?’ (પૃ. ૮૮)

આ છે રોચક કાવ્યબાની ! આખુંય કાવ્ય સંવાદાત્મક, ઉદ્ભોધનાત્મક અને નાટ્યાત્મક શૈલીથી રચાયું છે.

‘શ્રી પુરાત્ત જાજસો’ પણ લાંબું કાવ્ય છે. કવિ રાજેન્દ્ર પટેલે સમયપટનાં વિવિધ તુપોની ભીતરમાં શક્તસ્તુત મન અહીં મૂર્ત કર્યું છે. એ મનનાં મૂળ પરંપરા સાથે કેવી રીતે જોડાયેલાં છે એના નિરૂપણની સમાંતરે એનું ઉત્ભનન પણ ચાલે છે. મનની આવી લીલા અહીં આસ્વાદ બની છે અનેક કલ્યાણશૈલીને લીધે !

ગીતરચનાઓનું ચચન પણ ટકોરાબદ્ધ છે. કેટલીક રચનાઓમાં અધ્યાત્મરંગ ઘૂંઘાયો છે. નિરંજન રાજ્યગુરુની ‘શરત’ રચના આવી છે. ‘નથી હાટ કે ઘાટ, માટ / છે વાટ અજબ વેરાગો’ (પૃ. ૩૪) સૂર્યી ભજનનો પ્રલંબ લય અહીં પ્રતીત થાય છે. છૂટતા તીર જેવી ભાવસ્થિતિને જે રીતે બાંધી છે એ પ્રક્રિયા આસ્વાદ છે. મધુમતી મહેતાની રચના ‘એક તારો તૂટેલો’માં પણ રહસ્યવાદનું મૂર્ત રૂપ છે. ‘એક તારો તૂટેલો સંધાઈ ગયો રે / મારો સાંવરિયો એમાં બંધાઈ ગયો રે’ (પૃ. ૬૧) સાંવરિયા સાથેનું ઐક્ય કેવા આનંદમાં લઈ જાય છે એનું નિરૂપણ મજાનું છે. હરિશ્ચંદ જોશીની ‘અવધૂગાન’માં પણ અકળ પરમતત્ત્વ પામવા માટેના ઉધામાનું બયાન છે. બંગ પણ એમાં છે. આખાનું સ્મરણ સહજ થાય !

કટલાંક ગીતોમાં કવિના મિજાનું આદેખન જોવા મળે છે. ચન્દ્રકાન્ત ટોપીવાળાની રચના ‘સામો કાંઠો’માં પડકારને ઝીલવાની ખેવના છે. ખારવાઓનાં ગીત અને ટાગોરનું ગીત.... એકલો જાને રે... આદિનું સ્મરણ આ ગીત કરાવે છે. એવો જ મસ્તરંગી મિજાજ પ્રગટ કરતી રચના મણિલાલ હ. પટેલની ‘અલકમલકથી આવ્યો’ છે. ‘અલકમલકથી આવ્યો છું અલકમલકમાં જઈશ... / બીજાતીજની ચન્દ્રકલાઓ વચ્ચે હસતો રહીશસ...’ (પૃ. ૬૦) વનવગડો-નીમાયેતર ને પ્રકૃતિનાં તત્ત્વો વચ્ચે વિહરવાની મુક્ત જંખના આમાં છે જે કવિની આંતરાઓળાની ધોતક છે. ‘ઘટના એવી’માં પણ હરિકૃષ્ણ પાઠકે નિજમનલીલાનું ચિત્રાંકન કર્યું છે. કટલાંક ગીતોમાં ગ્રામપરિવેશનું ચિત્ર વિવિધ ભાવો સાથે સાંપદે છે. ઊજમશી પરમારકૃત ‘વરસે ખાંડાધાર’, ગલ્બરુ ભડિયાદરાની રચના ‘ભાઈ, મારે આંગણો...’, રત્નલાલ સથવારાનું ગીત ‘અવસરિયો’ આદિયાં આ જોવા મળે છે.

કેટલીક અછાંદસ રચનાઓ આ સંચયમાં છે. બહુધા આ રચનાઓ પ્રતીકધર્મ બની છે. ‘બસ હવે’માં ગીતા નાયકે વહી ગયેલા સમયનું ચિત્ર પાંચીકા વડે પ્રગટ કર્યું છે. ને સાંજે’માં બે ભાવ, બે ચિત્રો સામસામે મૂરીને કવિ જ્યાદેવ શુક્લ સાંજ પાસેથી જે સર્જકીય કામ લે છે એ પ્રક્રિયા આખીય રસાળ છે. પ્રદ્યુમન તન્નાની રચના ‘જળ’ આખેઆખી રચના પ્રતીક છે આંતરમનની વિવિધ લીલાનું ! ‘વિભેરાઈ જાય’માં રમણીક સોમેશ્વરે સમુદ્ર, જળ અને ચંદ્ર તથા અંતે કોડી – સાંકળીને જે લઘુકાવ્ય રસ્યું છે એ મોતી જેવું છે. અર્થાંભીર પણ છે. એનાં સ્કુલિંગો વિસ્તાર પામે છે. આ પણ સંકુલ પ્રતીકાત્મક રચના જ છે. ‘એક આવરણ’માં છિનેન આનંદપરાએ આધુનિક માનવનિયતિને તાકી છે. માણસે કેવાં કેવાં આવરણો રચીને જીવવાનું પસંદ કર્યું છે યા અને કરવું પડ્યું છે એનું બંગાત્મક આદેખન આમાં છે. આવરણ પણ પ્રતીક બની રહે છે. ‘એક આવરણ / વિસ્તરંતું રણ...’ (પૃ. ૧૦૪) આમાં કરુણ વિપર્યાસ છે.

સમ ખાવા પૂરતી એક સોનેટરચના ! ઉશનસૂની ‘લીલોતરીની ગૂંચમાં’, વૃક્ષની લીલપભીની લીલા અંકિત કરે છે. વૃક્ષ અહીં જીવની લીલપનું પ્રતીક બની રહે છે. નવિન ચાવળની રચના ‘મનોમયિ’ અને રાજેન્દ્ર શાહની રચના ‘જમાદિને’ બંનેમાં મન કેન્દ્રમાં તો છે જ, બંને રચના સંસ્કૃત કાવ્યબાનીના સંદર્ભમાં ધ્યાનાર્હ છે. ૨૦૦૬ માં આવી રચનાઓ વિરલ છે. એક સમય હતો સોનેટ – સોનેટમાણા રચાતાં હતાં ને કોઈ છંદ, કવિનો આગવો વિશેષ ગણાતો. આ વર્ષમાં આ એક જ સોનેટ, સોનેટસ્વરૂપમાં દુકાળ સૂચ્યે છે. ‘બૃહ્દ છંદોલય’થી આધુનિક ગુજરાતી કવિતપ્રવાહમાં ‘માઈલસ્ટોન’ સમું સ્થાન ધરાવતા કવિ નિરંજન ભગતની રચના ‘મારા પ્રેમમાં’ એમની આગળની રચનાઓથી જુદી જ રચના છે. સ્નેહ અને વ્યાપક માનવસંબંધના સંદર્ભમાં આ કૃતિ ગંભીર છે. ‘ન એના જેવો’ શબ્દપ્રયોગનું આવર્તન ને સમાંતરે પ્રિયજનને થતું ઉદ્ભોધન – આવી રીતે પ્રભાવક બની છે. આમ, આધુનિક અને અનુાધુનિક કવિઓની રચનાઓ અહીં છે. પ્ર્યોગશીલ કાવ્યબાની અને આધુનિક માનવચહેરો પણ અહીં છે. પરંપરા સાથેનું અનુસંધાન પણ ગીત આદિયાં છે.

૧૧ સામયિકોમાંથી આ રચનાલોક પસંદગી પામ્બો છે. કેદ્ધિયતમાં સંપાદકે કર્યું છે : ‘જેમાં કંઈક ઉત્તમ નીપજી આવ્યું છે તે જ આપણી રિદ્ધિ છે અને તે જ આ વર્ષની કવિતાનો ચહેરો છે તેમ માનવું યોગ્ય છે.’ જે કંઈ છે તે સંપાદકની આંખે આ છે ને ૨૦૦૬ના કાવ્યપ્રવાહના સંદર્ભમાં આ આપણી રિદ્ધિ છે !

## સઘન અભ્યાસનો પ્રસાદ : ‘ગિરનાર’ | ભારતી રાણે

**ગિરનાર :** સંજ્ય ગૌધરી, રંગદ્વાર, તેમી પૃ. ૨૭૨, ૨૦૦૮, રૂ. ૧૬૦]

ગુજરાતની ગરિમાનું સર્વોચ્ચ શિખર ગિરનાર. હિન્દુ, જૈન, બૌદ્ધ ત્રણેય મુખ્ય પરંપરાનું આ તીર્થસ્થાન. જેની ગોદમાં અહીં હજાર વર્ષનો ઈતિહાસ ધરાવતું પુરાણ-પ્રસ્તીદ્વ ગિરિનગર – જૂનાગઢ સમાયું છે, તે ગિરનાર. મૌર્ય સમાટ અશોક, મહાકન્તપ રૂદ્રામા, અને ગુપ્તસમાટ સ્કંદગુપ્તના શિલાદેખોથી શોભતો આ પ્રદેશ. આ જ જૈન મહાતીર્થ



ઉજ્જ્વયન્તગિરિ; સિદ્ધ નાથ અને હત્ય સાધુકળોના ઉપાસકોની ભૂમિ, ઔષધિઓનો બંડાર, મુક્તાત્માઓનું વતન, સનાતન સંસ્કૃતિકેન્દ્ર - ગિરનાર.

શ્રી સંજ્ય ચૌધરીએ આ ભૂમિમાં વારંવાર બ્રમજા કરી, અના ઈતિહાસનો, એના પૌરાણિક સંદર્ભોનો, એના ભૂસ્તરશાસ્ત્રીય વિજ્ઞાનનો, એની વન્યસંપત્તિનો, એના લોકસાહિત્યનો, એના પર લખાયેલ સાહિત્યનો, વગેરે અનેક પાસાંઓનો સમગ્રલક્ષી અભ્યાસ કર્યો અને તેના પરિપાક રૂપે જે પુસ્તક પ્રાપ્ત થયું, તે આ પુસ્તક 'ગિરનાર.' સંજ્ય ચૌધરીએ કમ્પ્યુટરવિજ્ઞાનમાં ડોક્ટરેટ કરેલું છે. પોતાના વિષયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં અનેક પેપરો રજુ કરનાર પ્રોફેસરની પ્રતિભા તો ખરી જ, ઉપરાંત તેઓ સંગીતવિશારદ પણ છે. સાહિત્ય, વાદસંગીત, વન્યજીવન, પર્યાવરણ વગેરે પ્રત્યેનો એમનો લગાવ; તથા ગિરનારના પ્રકાંડ અભ્યાસી શ્રી નરોત્તમ પલાણ જેવા મૂર્ધન્ય સાહિત્યકારની નવલક્ષ્ય 'હુલુ'નું અવલોકન કરતાં લેખકને થઈ આવેલ ગિરનારના આકર્ષણમાંથી 'ગિરનાર' પુસ્તકનું સર્જન થયું.

પુસ્તકની શરૂઆતમાં લેખક ગિરનારનાં પૌરાણિક સંદર્ભોનું રસપ્રદ આચમન કરાવે છે. મૃગચર્મ ઓઢી બેઠેલા ૨૨ કરોડ વર્ષની ઉમરના યોગીની વાત કરતાં તેઓ સ્કેંડપુરાણ, વિષ્ણુપુરાણ વગેરે અનેક પૌરાણિક સંદર્ભો તરફ લઈ જાય છે. રામાયણના કિર્કિધાકંડમાંથી પસાર થતાં શ્રીકૃષ્ણ અને યાદવોની આ પ્રિયભૂમિમાં પ્રવાસ કરાવે છે, અને જૈન સાહિત્યના કલ્પસૂત્રમાં ઉત્તેખાયેલ આગમ પ્રતિષ્ઠિત મહાગિરિ ઉજ્જ્વયન્તગિરિનું આરોહણ પણ કરાવે છે. આ વિભાગમાં એ પણ જાણવા મળે છે કે, આજે સૌરાષ્ટ્ર એક દ્વીપકલ્પ છે, પરંતુ આદિકાળમાં તેની ચારેય બાજુ પાણી હતું, અને છેક કચ્છના રણ સુધી અરબી સમુદ્ર હતો, જે ઇ.સ. બીજી સદી સુધી નૌકાગમનને યોગ્ય હતો ! ગિરનાર તથા એની પરિક્રમા વિશેની લોકમાન્યતાઓ તથા તેના મહાત્મ્યની વાત પણ અહીં આવે છે.

બીજા વિભાગમાં લેખકે બે વખત કરેલ ગિરનાર પરિક્રમાના અનુભવનું વર્ણન કરતાં ડાયરીનાં પાનાં તથા એનાં અઢાર રંગીન ફીટોટ્રેચાફ પણ પ્રાપ્ત થાય છે. એ નોંધપાત્ર છે કે, પરક્રમા દરમિયાન લેખકને શ્રી મનોજ ખંડેરિયાની કાવ્યપંક્તિઓ 'આખું વન મહેકરું રૂહેશે પછી સદ્ય, વૃક્ષનાં થડોમાં નામ લીલું કોતરી જઈશા'; તો ક્યાંક શ્રી રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ : 'મનો ગોતવામાં જ ખોવાયો છું આ, પત્રે પરક્રમા આખરે હું મળીશ જ' ....યાદ આવે છે. ગિરનાર પરિક્રમા વિશે લેખક નોંધે છે કે - 'મોટા ભાગના શહેરી યાત્રાળુંઓ જિજ્ઞાસાથી જાય છે, જ્યારે ગ્રામીણ યાત્રાળુંઓ શક્ષાથી જાય છે.' આપણા પ્રવાસી શહેરી છે, પરંતુ પરિક્રમણમાં આધ્યાત્મિકતાથી અનાયાસ રંગાતા દેખાય છે. એમના એક સાથી જ્યસુખભાઈ છૂટ્યા પડી ગયા, એ વિશે તેઓ લખે છે : 'અમે તો એમ માનતા હતા કે, જ્યસુખ એમની ઝડપને કારણે આગળ હશે, અને નણપાણીનો ઢાળ ચડી ઉપર ટેકરીએ અમારી રાહ જોતા મળશે. અમને કચ્ચાં ખબર હતી કે, પરિક્રમાના બાકીના માર્ગમાં અમે હવે મળવાના નથી. જીવનમાં પણ ક્યારેક ક્યારેક આવું નથી બનતું ?' ....તો ક્યારેક લેખક લખે છે : 'ગાઢ અંધારું અને ચાલવામાં તકલીફ હોવા છતાં શાંત ગિરનારનાં પગશિયાં ઊતરતી વખતે લાગે છે કે, કદાચ આવી શાંતિ વારંવાર ન મળે ! સાથેસાથે વન્યસંપત્તિનો

નાશ કરી, ત્યાં પ્લાસ્ટિકનો બેશુમાર કચરો ફેંકી જઈ પર્યાવરણનો નાશ કરતા લોકને જોઈને શિંતા અને જવાનિ પણ લેખક અનુભવે છે. પરિક્રમા પછી સફાઈ અભિયાન કરતી શાળાની વિદ્યાર્થીનોની વાત પણ તેઓ કરે છે. પરિક્રમા બાદ વારંવાર પરિક્રમા કરનાર વ્યક્તિઓને પણ લેખક મળે છે, ને પર્યાવરણ અંગે તેમના વિચારો પણ અહીં યંકે છે.

પુસ્તકના મધ્યભાગમાં ગિરનાર આરોહણની માહિતી છે. એની ટૂંકો, દેરાં, જાણકુંડો વગેરે પછી ગિરનારનાં વૃક્ષ, છોડ, વન્ય સંપત્તિ, પશુધન વગેરેની વાત પણ લેખક કરે છે. ખાસ કરીને વૃક્ષોની વિશેષતાઓ વિશે કોઠો બનાવી વિગતે વાત થઈ છે. ત્યારબાદ એક સમૃદ્ધ પ્રકરણ લેખક આપે છે : તે છે - 'સાહિત્યમાં ગિરનાર'; જેમાં કવિશ્રી ન્હાનાલાલથી માંડીને શ્રી નીતિન વડગામા સુધીનાં કવિઓએ રચેલાં ગિરનારવિષયક કાબ્યો તો છે જ; ઉપરાંત લોકસાહિત્યમાં ગિરનારની ભૂમિકાની અમૂલ્ય વાતો અહીં સંચિત થઈ છે. જાહલની ને સમશેરાની વાતાંઓ, શિવરાત્રીના મેળામાં ત્રણ ત્રણ દિવસ-રાત ચાલતા મીંયા ને મેરાણીના દુખસંગ્રામની વાતો, મોતી મહેલા વાંસની સાખે ગમગામ વચ્ચે થતી દુહાની હરીકાઈઓ, બધું અત્યંત રસપ્રદ છે. આ વિશે લખતાં લેખક એક હદ્યસ્પર્શી વાત કરે છે : 'એકાદ પચ્ચીસી ઉપર વરસોવરસ ત્યાં આ મુલ્લા ને મેરાણીનું મસ્ત જોડલું સોરઠની કસણીણી ને તેથી રસણીણી બનતી જતી માનવમેદનીને સોરઠી દુખાકાયના નિયોડ ત્રણ ત્રણ દિવસ ને ત્રણ ત્રણ રાત ઘોળીઘોળીને પાતું : એ વાત મેં વારેવારે સાંભળી છે. સમજણો નહોતો થયો, ત્યારથી સાંભળતો આવ્યો છું. તે દિવસે બાળદિનોમાં તૈતુક હતું, પણ આજે અનુભવ થયે, દુખાના મર્મ સમજવાની સાન પાચ્યે, અંતરનાર્દદની ઓળખ આવે પારખી શકાયું છે કે - દુહો દસમો વેદ, સમજે તેને સાલે, વિયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે ?'

પુસ્તકના અંતના પ્રકરણોમાં ગિરનારના ઈતિહાસની વાતો આવે છે. મૌર્ય, શક અને ગુપ્તયુગથી શરૂ કરેલ એ ઈતિહાસમાં રજ્યપૂત્યુગ, મોગલયુગ, બાબી વંશ વગેરેની વિગતોમાં આગળ જતી ગઈ તેમ તેમ અનેક અજાયાં પાત્રો વચ્ચે જાણીતાં પાત્રોની મુલાકાત થતી ગઈ. દેવાયત આહીને ત્યાં ઉચ્છરેલ રાનવધાણ, ને એનો જીવ બચાવવા પોતાના પુત્ર વાહણોનો ભોગ આપી દેતી આદિરાણી; 'ખરડી ખાંગો નવ થિયો...' કહીને પોતાનું અપહરણ થતું જોઈ રહેતા ગિરનારને રાણકદેવીએ મારેલ પેલો ટોણો; અને હાડોહાડ લાગી આવતાં શિલાઓ જેરવવા લાગતા ગિરનારને વારતી રાણકના શબ્દો : 'મા પડ મુજ આધાર, ચોસલાં કોણ ચડાવશે ? ગિયા ચડાવણાધાર, જીવતાં જાતર આવશે.' બધું તાદશ થઈ ગયું. ભાગલા વાતે ભારત સાથેના જોડાણની પણ કેટકેટલી અજાણી વાતો જાણવા મળી, અને જેમના દેશપ્રેમની ને ત્યાગની વાતો ઈતિહાસમાંથી બાકાત કરી દેવામાં આવી, તે લોકસેનાની વાતો વાંચી મન ઉદ્દ્વિન થઈ ગયું.

પુસ્તકમાં મેં કરેલ પ્રવાસને અંતે ગિરનાર સાથે બાબરિયો, ખોડિયાર, લાખામેડી, કાબરો, ગદ્દાકોટ, લાંબધાર, ટકટક્યો, ભેંસલો, જોગણીનો પહાડ, અચ્છત્યામાનો કુંગર, હંદ્રકુંડ, તુલસીવિન અને સુવાણરિખા નદી, બધું પરિશિત લાગવા લાગ્યું છે. ગિરનારને સમગ્રતાથી ચાહી, એને લગતા તમામ સંદર્ભોમાં ઊડા ઉિતરી, તેનો મહત્તમ ચિત્તાર આપવાની કોશિશમાં શ્રી સંજ્ય ચૌધરીની નિસબત, પ્રતિબદ્ધતા અને શ્રમને સાંદ્રંત અનુભવી શકાય છે.

## પત્રસેતુ

### સાહિત્ય અકાડેમી / સાહિત્ય અકાદમી : એક નોંધ

૧૨મી માર્ચ ૧૯૮૪ના રોજ સંસદભવનમાં સાહિત્ય અકાદેમીનું ઔપचારિક ઉદ્ઘાટન થયું હતું. એક લેખક તરીકે, અને નહિ કે વડાપ્રધાનની ડેસિયતથી, જવાહરલાલ નેહરુ એના પ્રમુખપદે નિમાયા હતા. આ ઔપचારિક ઉદ્ઘાટનની પહેલાં ઘણા સમયથી – જ્યારે બ્રિટિશ અમલ હતો ત્યારીથી સાહિત્યની આવી એક સંસ્થા સ્થાપવાની વિચારણા શરૂ થઈ હતી, પરંતુ પછી સ્વતંત્રતા મળ્યા બાદ ૧૫ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ ભારત સરકારે એક ઠરાવ કરી National Academy of Leffers જેવી સંસ્થા સ્થાપવાનો નિર્ણય લીધો, જેનું ‘સાહિત્ય અકાદેમી’ અંગ્રેજમાં પણ Sahitya Akademi એવું નામ રાખ્યું. એ પછી સંગીત નાટક અકાદેમી, લિલિત કલા અકાદેમી જેવી સંસ્થાઓ સ્થપાઈ, જેમાં અકાદેમી – AKADEMI સંશો રખવામાં આવી છે.

AKADEMI મૂળ ગ્રીક અને પછી અંગ્રેજ શબ્દનું ભારતીયકરણ છે, આ શબ્દ ખાસ ઘડી કાઢવામાં આવ્યો છે, જેમાં એનો ગ્રીક વ્યુત્પત્તિગત અર્થ સચવાય. તેમ છતાં એ ભારતીય શબ્દ બને, એ રીતે Sahitya Akademi એ વિવિષ્ટ એવું સંસ્થાનું વિશેષ નામ બન્યું. અકાદેમીના બધા જ ઔપचારિક વ્યવહારમાં આ સંશો વપરાય છે. દીપકજ્યોત દર્શાવતી ‘સાહિત્ય’ શબ્દ સાથેની એની મુદ્રા સત્યજિત રાયે કરેલી છે.

સાહિત્ય અકાદેમીનાં બધાં પુરસ્કારો, પ્રકાશનો કે પત્રવ્યવહારમાં એ જ નામ વપરાય છે. ‘સાહિત્ય અકાદેમી પુરસ્કાર’ કે ‘સાહિત્ય અકાદેમી પ્રકાશિત ગ્રંથ’ વર્ગે, અને ભારતની બધી ભાષાઓમાં પણ આ પ્રમાણે અનુસરવામાં આવે છે.

પરંતુ ગુજરાતીમાં અકાદેમી અને અકાદમી એ સંશોધોમાં ભેણસેળ થઈ ગઈ છે. ઈ. સ. ૧૯૮૪માં ગુજરાતમાં સાહિત્ય અકાદેમીના ધોરણો ગુજરાતમાં એ વખતની સરકારે રાજ્ય અકાદેમી સ્થાપવાનો નિર્ણય લીધો. તેનું અંગ્રેજ નામ Gujarat Sahitya Academy એમ છે, અને ગુજરાતીમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ છે. ગુજરાત સાહિત્ય અકાદેમીની મુદ્રામાં પણ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ છે. ગુજરાત સાહિત્ય અકાદેમીનું ‘અકાદમી’ શબ્દ ન તો ભારીયકરણ થયેલ શબ્દ Akademiનો ઉચ્ચાર છે અને ન તો અંગ્રેજ Academy – એકેડેમીનો ઉચ્ચાર છે. એક નવું જ ગુજરાતી રૂપ ‘અકાદમી’ સ્વીકારવામાં આવ્યું છે અને તે વર્ષથી પ્રચલનમાં છે. ગુજરાત સાહિત્ય ‘અકાદમી’ પછી જે હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત આદ્ય અકાદમીઓ બની, તેમાં પણ ‘અકાદમી’ સંશો જ રૂઢ થઈ છે.

આપ મૂળે તો એક છતાં ‘અકાદેમી’ અને ‘અકાદમી’ બે સંશોધો અલગ અલગ રીતે પ્રચલનમાં છે. પરંતુ સાહિત્ય અકાદેમી (દિલ્હી)નો જ્યાં જ્યાં નિર્દેશ આવે છે ત્યાં પણ આપણે ત્યાં મોટે ભાગે ‘સાહિત્ય અકાદમી’ સંશો વપરાય છે, જે ખોટો પ્રયોગ ગણી

શકાય. ‘સાહિત્ય અકાદેમી’ એ એક વિશેષ નામ છે. એટલે સાહિત્ય અકાદેમીનો જ્યાં નિર્દેશ કરવાનો હોય ત્યાં ‘અકાદેમી’ શબ્દ જ વાપરવો જોઈએ. આપણે ગુજરાત સાહિત્ય અકાદમીથી જુદી પાડવા એ અકાદેમી માટે ‘કેન્દ્રીય સાહિત્ય અકાદમી’ કે ‘સાહિત્ય અકાદમી (દિલ્હી)’ એવો પ્રયોગ કરીએ છીએ, કરવો પડે છે. તે પણ ખોટો પ્રયોગ છે. ‘સાહિત્ય અકાદેમી’ – ‘સાહિત્ય અકાદેમી’ છે, તેની આગળ ‘કેન્દ્રીય’ કે પાછળ ‘દિલ્હી’ એવો પ્રયોગ માત્ર આપણી સગવડ માટે કરીએ એટલું, બાકી તે બરાબર તો નથી. સાહિત્ય અકાદેમી શબ્દનો જ પ્રયોગ કરવો જોઈએ.

ગુજરાતની ગુજરાત સાહિત્ય અકાદમી કે વિવિધ ભાષાની અકાદમીઓ ‘અકાદમી’ તરીકે રૂઢ છે, તો ભલે ત્યાં ગુજરાત સાહિત્ય અકાદમી લખાય, અકાદમી પ્રકાશન કે અકાદમી પુરસ્કાર એમ પ્રયોગ થાય; પરંતુ સાહિત્ય અકાદેમી માટે આપણે અકાદેમી શબ્દનો ઉપયોગ કરીએ.

૧૫-૪-૨૦૧૦

અમદાવાદ

S

લોગોભાઈ પટેલ

પાકા કેદી નં. ૮૮૫૬  
નરેન્દ્રસિંહ વંગેસિંહ રાઠીડ  
અમદાવાદ મધ્યસ્થ જેલ  
તા. ૫-૫-૨૦૧૦

પ્રતિ,

ગુજરાતી સાહિત્ય પરિષદ

સાબરમતી જેલના અંતેવાસીઓ પ્રત્યે લાગણીસભર અભિપ્રાય બદલ આપના ખૂબ આભારી છીએ.

કેદીઓમાં વૈચારિક પરિવર્તન, હંદ્યપરિવર્તન, તથા જીવનપરિવર્તન થાય તેવા શુદ્ધ આશ્રય થકી જેલ પુસ્તકાલયમાં પુસ્તકો ભેટ આપવા બદલ જેલના સાહિત્યરસિક બંદીવાનો આભાર બ્યક્ત કરીએ છીએ.

હતાશાની ગર્તમાં ધકેલાઈ ગયેલા મનને એ ગર્તમાંથી બહાર લાવી પ્રસન્નતાના ગગનમાં વિહરતા કરી દેવાનું આપના ભેટ આપેલાં પુસ્તકો કરી રહ્યા છે. સાહિત્યનાં પઠન-ચિન્તન બાદ થોડાં સકારાત્મક પરિવર્તનો મહેસૂસ કર્યા. ભવિષ્યમાં શક્ય હોય તો વધારે સાહિત્ય ભેટ આપવા વિનંતી છે.

અમો બંદીવાનોના ઉત્થાન માટે પરમ કૃપાળું પરમાત્મા સદ્ગય ઉમદા વિચારો આરો...  
પ્રશ્નામ.

નરેન્દ્રસિંહ વી. રાઠીડ

r



## પરિષદ્વત્ત

સંકલન : રાજેન્દ્ર પટેલ

### ‘હે નૂતન’ રવીન્દ્રનાથનો છેલ્લો જન્મદિવસ

જ્યો મે-૨૦૧૦ના દિવસે રવીન્દ્રનાથ વાગ્મેરની દોઢ્સોમી જન્મજથંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન ‘પરિતોષ’ કૃષ્ણકોલોનીમાં કરવામાં આવ્યું હતું. શ્રી નિર્ણજન ભગત, શૈલેષ પારેખ અને સુજ્ઞા શાહે રવીન્દ્રનાથના અંતિમ (જ્યો મે-૧૯૪૧) જન્મદિવસને ધ્યાનમાં રાખી એ વખતના એ સમયે રચાયેલી કવિતા ‘હે નૂતન’ અને એ સમયની રવીન્દ્રનાથની માનસિકતા વિશે તૈયાર કરેલ દર્શય-શ્રાવ્ય કાર્યક્રમની પ્રસ્તુતી કરી હતી. પ્રસ્તુતીના આરંભે ગીત શરૂ થતાં ‘પરિતોષ’ના મધ્યરોચે ડેકા કરી જાણે પ્રતિધોષ આયો અને ભાવકોએ પ્રસન્નતાથી આયો કાર્યક્રમ માણ્યો હતો.

S

### ખંડિત તૃષ્ણાફૂર્ની સોનેરી ઝંય

અંખો મેં કોઈ ખ્યાલ સુનેહરા નહીં આતા,  
ઇસ જીલ પે અબ કોઈ પરીના નહીં આતા.  
હાલાતને ચેહરે કી ચમક છીન લી વરના,  
દો ચાર બરસ મેં તો બુગાપા નહીં આતા.

શાલ્લીર ફુરેન ફુરેનમીયા

વિશ્વપુસ્તક દિવસે (૨૩ એપ્રિલ) ગુજરાતી સાહિત્ય પરિષદે ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત સાબરમતી જેલમાં એક વિશિષ્ટ કાર્યક્રમો આરંભ કર્યો. ગુજરાતની તમામ ૨૫ જેલમાં પુસ્તકો ભેટ આપવાં તથા દરેક જેલમાં એક કવિસંમેલન યોજાવું, જેમાં નીવડેલાં કવિઓ સાથે બંદીવાન સર્જકો પણ કાવ્યપાઠ કરે એમ આયોજન થયું.

ઉપરની કાવ્યપંક્તિઓ સાબરમતી જેલના એક બંદીવાન બંધુની છે. એ ઘેર ગયો ને પતીએ પૂછ્યું, જેલનું જીવન કેવું હોય છે? ત્યારે તેના જવાબમાં એમનાથી ઉપરની કાવ્યપંક્તિઓ રચાઈ ગઈ. આ કવિસંમેલનનું સંચાલન પ્રસિદ્ધ ગળજાકાર રાજેશ વાસે કર્યું. એમની સાથે ભાવેશ ભણ, અનિલ ચાવડા, હરદ્વાર ગોસ્વામી, કૃષ્ણ દવે, મનીષ પાટક તથા રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા. જ્યારે બંદીવાન ભાઈ-બહેનોમાંથી દસ સર્જકોએ પોતાની રચનાનું પઠન કર્યું! પરિષદ વતી પુસ્તકાલયમાંથી ગંગારામ વાધેલા તથા દીપિ શાહ ઉપસ્થિત રહ્યાં અને જેલ અધિકારી શ્રી પી. સી. ઠાકુરને પુસ્તકો અર્પણ કર્યો.

બીજો કાર્યક્રમ વડોદરા જેલમાં તા. ૧૪-૫-૧૦ના રોજ યોજાયો. આ કાર્યક્રમમાં જેલના સાત સર્જકો સાથે વડોદરાના આઈ કવિઓએ કાવ્યપાઠ કર્યો. કવિ શ્રી જયદેવ શુક્લ, મકરંદ મૂસળે, વિરંચિ ત્રિવેદી, રાજેશ પંચા, ભરત ભણ, દિનેશ ડોંગરે, દુર્ગેશ ઉપાધ્યાય, ગુલામ અખ્બાસ ‘નાશાદ’ સાથે રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જેલમાં એક બંદીવાન બંધુએ અદ્ભુત અભિવ્યક્તિ રજુ કરતી રચના રજુ કરી, એ આ મુજબ હતી.

“મારી દોળાયેલી સુવર્ણ સ્મૃતિઓના ખંડિત તૃષ્ણાફૂર ખોળું છું.”

ત્રીજો કાર્યક્રમ તા. ૨૩-૫-૧૦ના રોજ સુરત જેલમાં પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો. અગાઉ ૫૦૦ પુસ્તકો સુરત જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. આ કવિસંમેલનમાં રઈશ મણિયાર, રવીન્દ્ર પારેખ, બજુલેશ દેસાઈ, મુકુલ ચોકરી, કિરણ ચૌહાણ, ગૌરંગ ઠાકર, યામની વ્યાસ તથા જનક નાયક પોતાની ફૂતિનું પઠન કર્યું હતું. બંદીવાન બંધુઓની પ્રસન્નતા જાણે અંકે થઈ.

વડોદરા જેલમાં કાર્યક્રમની અધિવચ્ચે કેદીઓમાંથી એક ચિહ્ની આવી હતી. એ આ મુજબ હતી.

૮th May ૨૦૦૮

સાહેબ,

હું મારી એક જ ગળજા રજૂ કરવા માંગું છું. જો આપ પરવાનગી આપો તો. નમ સૂચન :

શાનપીઠ એવાઈ વિજેતાઓની રચનાઓનું સંકલન ઉપલબ્ધ છે ?

શેખ સાદી અને મૌલાના રૂમની મટાનવીનું ગુજરાતી ભાષાંતર જો ઉપલબ્ધ હોય તો મોકલાવવા નમ્ર વિનંતી.

– ઈમરાન ભિર્જ ‘શમ્શા’

(કાચા કામના કેટી)

આપણા કવિઓએ ઘણાં કવિસંમેલનોમાં, મુશાયરામાં ભાગ લીધો હશે. કયાંય કાલ્યપઠનથી રૂદ્ધ કરતાં શ્રોતાઓ જોવા મળ્યા છે ? સાબરમતી જેલમાં શ્રોતાઓને રડતાં અમે જોવા છે !

‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત આખું વર્ષ ચાલનારો આ કાર્યક્રમ હવે પણી, ૨૦ જૂને રાજકોટ જેલમાં તથા ૨૭ જૂને ભાવનગર યોજાયે. પરિષદ ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત એક બીજા કાર્યક્રમો આરંભ કરશે. એ છે “મને ગમતું પુસ્તક વાર્તાલાપ” સમગ્ર ગુજરાતમાં સોશી અધિક આ વાર્તાલાપ ગોઠવાય એવો હાલ પ્રયત્ન ચાલી રહ્યો છે. જે કોઈ સંસ્થા કે વ્યક્તિને આ કાર્યક્રમમાં ભાગ લેવો હોય એ પરિષદના કાર્યાલયમાં તરત જાણ કરે.

S

### લેખિકાસત્ર – અહેવાલ

ગુજરાતી સાહિત્ય પરિષદ અને અભિયાન હિંદુ મહિલા પરિષદ બૃહદ, વાચકમંચ – સુરતના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬-૫-૧૦ અને ૧૭-૫-૧૦ના રોજ લેખિકાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બેઠકની ભૂમિકા પરિષદમંત્રી શ્રી રાજેન્દ્ર પટેલે વર્ણિનિયા તુલ્ફને યાદ કરીને બાંધી આપી હતી. સાહિત્ય પરિષદ પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્માને દીપ-પ્રાગટ્ય કરી. લેખિકાસત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમની વિશે ઉપસ્થિતિ હતી તેવા ધ્રુવતાબહેન પારેખને તેમણે નારીનું ગૌરવ કહી બિરદાવ્યા હતા. રવીન્દ્ર પારેખે મહત્વનું કહત્વ આવ્યું હતું. સત્રના પ્રમુખ હિમાંશીબહેને નારીની સર્જકતાની નોંધ ઓછી લેવાય છે તે તરફ અંગુલિનિર્દેશ કર્યો હતો.

પ્રથમ બેઠક ‘સાહિત્યમાં સ્ત્રી’ના અધ્યક્ષપદેશી શરીરકા વીજળીવાળાએ તેમણે ઈ. પૂ.ની મીડિયાથી શરૂ કરી સાંપ્રદ્યત સમય સુધીનાં નારીપાનો વિશે વિવેચનાત્મક છણાવટ કરી હતી. લેખકો દ્વારા સાહિત્યમાં નારીનિરૂપણમાં શ્રી ભરત મહેતાએ પિતુસત્તા તરફી અને વિરોધી એમ બંને વલણો રજૂ કર્યા હતાં. દક્ષા વાસે લેખિકાનું પ્રમાણ ઓછું છે તેના કારણમાં સ્ત્રીઓને ઓછી મોકળાશ મળે છે તેમ જણાવ્યું હતું. બેઠકનું સંચાલન શ્રી પ્રફુલ્લ રાવલે કર્યું હતું.

બીજી બેઠક ‘ગુજરાતી નિબંધમાં લેખિકાઓનું યોગદાન’ અંગે હતી. સર્વશ્રી ભારતી રાણે, અવંતિકા ગુણવંત, સ્વાતિ મેઢ, કલ્યાન દેસાઈ, આમ્રપાલી દેસાઈએ કેદ્ધિયત રજૂ કરી હતી. અધ્યક્ષ શ્રી દર્શના ધોળકિયાએ નર્મદને ટંકતા નિબંધ લખવા એ જેવીતેવી વાત નથી તેમ કહી નિબંધસાહિત્યમાં લેખિકાઓના યોગદાનની વાત કરી હતી. સંચાલન ઋજુતા ગંધીનું હતું.

બીજી બેઠક ‘ગુજરાતી કવિતામાં લેખિકાઓનું યોગદાન’ વિશે હતી. શ્રી રક્ષા દવેએ (લખવાની) ખંજવાળ ઉપઽડ છે એટેલે લખું છું તેમ કહી કેદ્ધિયત રજૂ કરી તો રીના મહેતા અને રીતા ભાવે હોવાની અનુભૂતિ એ જ કવિતા છે તેમ સ્પષ્ટ કર્યું હતું. ‘સર્જનાત્મકતા અંદરથી આવતો ધક્કો છે’ એવી કેદ્ધિયત સંસ્કૃતિરાણી દેસાઈએ આપી હતી. સત્ય અને જાતને ઓળખવાની વાત પ્રજ્ઞા પટેલે કરી હતી. અધ્યક્ષ શ્રી ઉષા ઉપાધ્યાયે યશવંત શુક્લને ટંકતા કર્યું હતું કે સર્જકતામાં સ્ત્રી-પુરુષના બેદ હોતા નથી તો પણ નારી વધુ સૂક્ષ્મતાથી લખે છે. સંચાલન સંધ્યા ભણ્ણનું હતું.

તે જ દિવસની રાત્રિબેઠકમાં સ્મિતા પારેખના બાળવાર્તાસંગ્રહ ‘કીડી પહેલવાના’નું અને મુ. ધૂલતા પારેખના પુસ્તક ‘ઋતારૂજ-૨’નું લોકાર્પણ શ્રી શ્રદ્ધા ત્રિવેદીએ કર્યું હતું. અધ્યક્ષ શ્રી ભગવતીકુમાર શર્માએ ધૂલતાબહેનના પુસ્તક ‘ઋતારૂજ-૨’ વિશે વાતો કરી હતી. સંચાલન અનંતા પરીએ કર્યું હતું. અંતે કવાયિત્રી સંમેલનમાં સહુએ કવિતાનું રસાપાન કર્યું હતું. સર્વ શ્રી રક્ષા દવે, સ્મિતા પારેખ, એષા દાદાવાળા, સંસ્કૃતિરાણી દેસાઈ, પ્રજ્ઞા પટેલ, સંધ્યા ભણ, લક્ષ્મી ડેબારિયા, રીતા ભણ, દિવ્યા મોદી, હર્ષવી પટેલ, પ્રજ્ઞા વશી, રીતા ત્રિવેદી અને ઉષા ઉપાધ્યાયે તેમની કવિતાઓ પ્રસ્તુત કરી હતી. સંચાલન ઉષાબહેને તથા અધ્યક્ષીય પ્રવચન દક્ષાબહેન વાસે કર્યું હતું.

તા. ૧૭-પના રોજ ચોથી બેઠક ‘ગુજરાતી નવલકથામાં લેખિકાઓનું યોગદાન’ અંગે હતી. તેમાં સર્વશ્રી કાજલ ઓઝા-વૈદ્ય, ભાવના વડીલ, વર્ષા પાઠક અને રેખા શાહે કેદ્ધિયત આપી હતી. અધ્યક્ષ બિંદુ ભાવે, “કેદ્ધિયત એ વર્કશોપમાં ડોક્ટર્યું કરવાની વાત છે.” તેમ કહી લોકપ્રિય અને કવાસ્વરૂપ બંને પ્રવાસોની વાતો કરી હતી. તેમના સંચાલનમાં સાહિત્ય લોકો સુધી પહોંચી શકે તે માટેના ઉપકમની તરફેણ કરી હતી.

પાંચમી બેઠક – ‘ગુજરાતી વાર્તામાં લેખિકાઓનું યોગદાન’માં ભારતી ર. દવે, આશા વીરેન્દ્ર, પારુલ કર્દાર્પ દેસાઈ, દીના પંડ્યા અને પના ત્રિવેદીએ તેમની કેદ્ધિયતો રજૂ કરી હતી. ભારતી દવે અને પારુલ દેસાઈએ ‘પાણી’નું વાર્તાવર્તુળ વાતાવેખનમાં નિમિત્ત બન્યું હોવાનું જણાવ્યું હતું. અધ્યક્ષીય પ્રવચન ભારતી દવાલે કર્યું હતું.

હિમાંશીબહેન શેવટે સમાપનબેઠકમાં, “પૂરી સર્જતા કિના સાહિત્યના ક્ષેત્રમાં


પ્રવેશવું એ અપરાધ છે” તેમ કહી, ઉત્કૃષ્ટતાની સાધના કોઈ પણ ભોગ છોડાય નહીં કે સમાધાન પણ કરાય નહીં, તેવી લાલબત્તી ધરી હતી. તો ભગવતીકુમાર શર્માએ સત્રની ઉપયોગિતા સ્વયં સ્પષ્ટ હોવાનું જગ્ઘાવી, વાર્તાપિંડન પણ સર્જનાત્મકતાનો પ્રશ્ન હોઈ ભવિષ્યમાં તેવા કાર્યક્રમો વોજવાનું સૂચાવ્યું હતું.

અંતમાં સંસ્થા વતી અનંતા પરીએ અને ગુજરાતી સાહિત્ય પરિષદ વતી પારુલ દેસાઈએ સૌનો આભાર માન્યો હતો. આ રીતે દોઢ દિવસનું લેખિકાસત્ર સંઘન અને સર્જતા રદ્દું હતું.

- કાલિન્દી પરીએ

r

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત વિવેચક-કવિ તથા ‘એતદ્દાના સંપાદક નીતિન મહેતાનું તા. ૧-૬-૨૦૧૦ના રોજ અવસાન થયું છે. તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ.



રેખાંકન : સવણ છાયા

# સાહિત્યવૃત્ત

સંકલન : પ્રકુલ્લ રાવલ

## કવિ સર્જકોને નિમંત્રણ

સર્વ કવિ - સર્જક મિત્રોને નિમંત્રણ આપવામાં આવે છે કે સ્વાર્થિમ ગુજરાત ઉજવણી વર્ષ-૨૦૧૦ના સંદર્ભે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષામાં 'સ્વાર્થિમ ગુજરાત કાવ્યગ્રંથ' પ્રગત કરવામાં આવશે કવિ સર્જકોએ ગુજરાતની અસ્મિતા, સંસ્કૃત અને પરંપરા મૂલ્યોનું પ્રાગટ્ય અને જૌરવગાન થતું હોય એવા મૌલિક અને અપ્રગત કાવ્યો તારીખ : ૩૦ જૂન ૧૦ સુધીમાં ફૂલ્સકેપ કાગળની એક બાજુએ સ્વચ્છ, સુવાચ્ય અક્ષરે કે ટાઈપ કરીને નીચેના સરનામે મોકલી આપવા જણાવવામાં આવે છે. કૃતિ નીચે કવિનું નામ-સરનામું તથા શૈન નંબર અવશ્ય લખવા વિનંતિ.

કાવ્યોની પસંદગી સાહિત્યિક મૂલ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. પસંદ થયેલ કાવ્યોને નિયમ મુજબ પુરસ્કાર તથા કાવ્યગ્રંથની નકલ મોકલવામાં આવશે.

કાવ્યો મોકલવાનું સરનામું : ગુજરાત સાહિત્ય અકાદમી, પ્રકાશન વિભાગ, અભિવેખાગાર ભવન, સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭. વધુ વિગત માટે સંપર્ક : ૦૭૯-૨૩૨૫૬૭૮૭

## સાહિત્યસૂચિના ઉપકમે વાર્તાવાપ

ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ. પ્રેરિત 'સાહિત્યસૂચિ'માં અરુણાબહેન લાખાડીએ 'પરિવર્તનનો પ્રાણ - જનજગૃતિ' પર વાર્તાવાપ આપ્યો હતો.

## પ્રેમાંદ સાહિત્ય સભાના ઉપકમે નાટકનો કાર્યક્રમ

પ્રેમાંદ સાહિત્ય સભાના ઉપકમે 'સ્વાર્થિમ ગુજરાત ઉત્સવ' નિમિત્તે ૮ મેના રોજ લાભશંકર ઠાકર લિખિત 'કાહે કોયલ શોર મચાયે' નાટકનો કાર્યક્રમ યોજાયો હતો. એ પછી ડૉ. લવકુમાર દેસાઈને ડૉ. મહેશ ચંપકલાલે આસ્વાદન કરાવ્યું હતું.

## નિસબ્બત ૨૦૧૦નો લોકાર્પણ કાર્યક્રમ

"ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન" સંસ્થાના વાર્ષિકી ગ્રંથ 'નિસબ્બત-૨૦૧૦'નો લોકાર્પણ કાર્યક્રમ તા. ૧૪-૪-૧૦ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. 'નિસબ્બત-૨૦૧૦'નો લોકાર્પણવિષિ સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ભોળાભાઈ પટેલના હસ્ત થયો હતો. શ્રી ભોળાભાઈ પટેલે 'નિસબ્બત-૨૦૧૦'ની કૃતિઓ અને દલિત સાહિત્ય સંદર્ભે મનનીય પ્રવચન આપ્યું હતું. તો સમારંભના અધ્યક્ષ જાણીતા વિવેચક કવિશ્રી ચંદ્રકાન્ત વોપીવાલાએ 'નિસબ્બત-૨૦૧૦'ની એમને ગમતી કવિતા અને વાર્તાની વાત કરી, ગુજરાતી દલિત સાહિત્યની આબોહવા વિશે તાત્ત્વિક ચર્ચા કરી હતી. અતિથિ વિરોધ તરીકે જાણીતા વિવેચક શ્રી ભરત મહેતા અને જાણીતા કવિ-કર્મશીલ ડૉ. સરૂપ ધ્રૂવ ગુજરાતી દલિત સાહિત્ય વિશે વિસ્તૃત વક્તવ્યો આપ્યા હતા. સ્વાગત પ્રવચન સંસ્થાના

પ્રમુખ શ્રી મોહન પરમારે આપ્યું હતું. કાર્યક્રમની ભૂમિકા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નીરવ પટેલે બાંધી હતી. આભારદર્શન સંસ્થાના બીજા ઉપપ્રમુખ શ્રી ભી. ન. વણકરે કર્યું હતું. લોકાર્પણ સમારંભમાં મોટી સંખ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

## મેધારવ : જામનગરમાં યોજાયેલ ગૌરવ પંડ્યા કૃત 'એક હતી તમના'નો રસપ્રદ વિમોચન કાર્યક્રમ

જામનગરના ધારાશાસ્ત્રી અને યુવા લેખક એવા શ્રી ગૌરવ પંડ્યાનાં પ્રથમ પુસ્તક 'એક હતી તમના' (સતત લઘુનવલકથાઓનો સંગ્રહ)નો જામનગરનાં હાર્દસમા યાઉનહોલમાં તા. ૧૦ એપ્રિલના શનિવારની રાતે વિમોચન કાર્યક્રમ 'મેધારવ' સંપન્ન થયો.

## હાસ્યકાર-કાર્ટૂનિસ્ટ નિર્મિત ઠાકરનો રેકોર્ડ 'લિમ્કા બુક-૨૦૧૦'માં

સુપ્રસિદ્ધ હાસ્યકાર-કાર્ટૂનિસ્ટ શ્રી નિર્મિત ઠાકરના પટ્ટણ-બિહાર ખાતે વર્ષ ૨૦૦૮માં યોજાયેલ કાર્ટૂન પ્રદર્શનમાં વિભિન્ન ભારતીય ભાષાઓના મહત્વના ૨૫૪ જેટલા સાહિત્યકારોનાં ઠણ્ણીચિત્રો પ્રદર્શિત થયેલાં અને એ પ્રદર્શનનું ફિલ્મ અભિનેતા શ્રી શત્રુંદ્ર સિંહાએ ઉદ્ઘાટન કરેલું. આ વિશિષ્ટ પ્રદર્શન સમગ્ર ભારતનું પ્રથમ પ્રદર્શન સિદ્ધ થતાં, નિર્મિત ઠાકરના આ વિકાને 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ-૨૦૧૦'માં સ્થાન આપાયું છે.

## બેંગલોર ખાતે નિર્મિત ઠાકરનું ભવ્ય બંગચિત્ર-પ્રદર્શન

નિર્મિત ઠાકરનાં બંગચિત્રોનું પ્રદર્શન 'ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયુટ ઓફ કાર્ટૂનિસ્ટ્સ' (બેંગલોર) દ્વારા યોજાયું, જેનું ઉદ્ઘાટન શાન્દીઠ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર અને ફિલ્મ અભિનેતાશ્રી જિરીશ કનર્ટે અનેક કલાકારો, સાહિત્યકારો અને કલાચાહકોની હાજરીમાં તા. ૧૦-૦૪-૧૦ને રોજ કર્યું, ૧૨૫ જેટલાં વિવિધ પ્રતિભાઓનાં (સાહિત્યકારો, સંગીતકારો, ચાંકારણીઓ, ખેલાડીઓ, ફિલ્મ કલાકારો વ.) નિર્મિતો દોરેલાં ઠણ્ણીચિત્રો તા. ૧૦-૦૪-૧૦થી તા. ૨૪-૦૪-૧૦ દરમિયાન પ્રદર્શિત થયાં અને અનેક કલાચાહકોએ એનો ભરપૂર આનંદ લીધો. રાષ્ટ્રીય સતરનાં અંગેજ અભિભારો અને સ્થાનિક કન્ડ અભિભારોએ એની તસવીરો સાથે સવિસ્તર નોંધ લીધી.

## 'સ્વનશિલ્પીઓ' ગ્રંથનું વિમોચન

૪ એપ્રિલના રોજ શ્રી અરિહંત પ્રકાશન ભાવનગર પ્રકાશિત અને વરિષ્ઠ સંપાદક શ્રી નંદલાલ દેવલૂક દ્વારા સંપાદિત દેશવિદેશ પ્રતિભા સંપન્ન પુરુષાર્થીઓની અનુપમ ગૌરવ ગાથા કરતો ઐતિહાસિક માહિતીસભર અભિવાદન ગ્રંથ 'સ્વનશિલ્પીઓ'નું વિમોચન અગ્રણી ડેળવણીકારને કાર્યક્રમના અધ્યક્ષશ્રી જિજુબાઈ ભરાડના હસ્તે પાઈક સ્કૂલ્સ ચાંકોટના મધ્યસ્થ ખંડમાં કરવામાં આવ્યું. અતિથિવિશેષ તરીકે ડૉ. ચંદ્રમૌલી જોણી, પ્રાચાર્ય પી.રી.સી. કોલેજ અને કવિશ્રી ઉમેશ જોણી હતા. આભારવિષિ પાઈક સ્કૂલ્સના સંચાલક શ્રી વસંતકુમાર પાઈક કરેલ.

## "લીલી આદિવાસી લોકગીત" : નિર્દર્શન અને રસદર્શન - પરિસંવાદ

સાહિત્ય અકાદમી અને ગુજરાતી ટ્રાયબલ ફાઉન્ડેશન દ્વારા - ભીલી આદિવાસી

**લોકગીત :** નિર્દર્શન અને રસદર્શન પરિસંવાદ અંબાજીમાં તા. ૨૧-૩-૨૦૧૦થી તા. ૨૨-૩-૨૦૧૦ સુધી યોજાયો હતો. આ પ્રસંગે સાહિત્ય અકાદમી ગુજરાત વિભાગના અધ્યક્ષ ડૉ. વિનોદ જોણી, પ્રોગ્રામ ઓફિસર અને ઉર્દૂ ભાષાના સર્જક-વાર્તાકાર ખુરશીદ આલમ ખાસ ઉપસ્થિત રવ્યા હતા.

ભીલી આદિવાસી લોકગીત વિષેનું બીજ ભાષણ ડૉ. બળવંત જાનીએ રજૂ કર્યું હતું. આ પ્રસંગે ડૉ. હસુ યાચિક, ડૉ. નિર્ંજન રાજ્યગુરુ, ડૉ. ભગવાનદાસ પટેલ, ડૉ. નાથાલાલ ગોહિલ, ડૉ. જ્યાંનંદ જોણી, ડૉ. અંબાદાન રોહિયા, વીરચંદ પંચાલ, કનુભાઈ આચાર્ય દીપક રચણ વગેરે ઉપસ્થિત રવ્યા હતા.

ડૉ. ભગવાનદાસ પટેલને શિવશંકર ચુનીલાલ જોણી ટ્રસ્ટ દ્વારા ‘શિવમ્’ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

### રીસર્ચ પ્રોજેક્ટ - જ્યેશ ભોગાયતાને

મહારાજા સચાજીચાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. જ્યેશ ભોગાયતાને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ન્યૂ ડિલ્હીએ બે વર્ષ માટે મેજર રીસર્ચ પ્રોજેક્ટ એનાયત કર્યો છે. મેજર રીસર્ચ પ્રોજેક્ટનો વિષય છે : ‘A Critical study of the History of Gujarati Short-story with special reference to the various changes had been found in the area of the subject matter and in the style of depiction.’ – ‘ગુજરાતી ટૂંકી વાર્તાના ઈતિહાસનો વિષયસામગ્રી અને નિરૂપશરીરિતના ક્ષેત્રમાં જોવા મળતાં વિવિધ પરિવર્તનો સંદર્ભે સમીક્ષાત્મક અભ્યાસ.’

### ગજલકાર આશીત હૈદરાબાદીનું અભિવાદન

‘અંકન’ આર્ટ ફાઉન્ડેશન ગેલેરી તરફથી મુંબઈ (અંગેરી)માં તા. ૧૭ એપ્રિલના રોજ એક સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં શ્રી આશીત હૈદરાબાદીને ગજલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે ‘શહીદ ગજલ’ સામયિક તરફથી વર્ષ ૨૦૦૮નો ‘અમૃત ઘાયલ’ ગજલ એવોર્ડ એનાયત થયો તે નિમિત્ત અભિવાદન અને દ્વિભાગી મુશાયરાનું આયોજન થયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી ઠન્ડટેવ ‘આચાર્ય’ શાનગમત સાથે તેમનું અભિવાદન તથા તેમના પુસ્તક ‘ધૂકૃધૂકૃ ઘા’નું લોકાર્પણ કર્યું હતું. મુશાયરામાં સર્વશ્રી કીર્તિ વાધેલા, રવિ યાદવ, નવીન શેઠિયા, ત્રિલોચનસિંગ અને અરોરા, આશીત હૈદરાબાદી સાથે સર્વ શ્રીમતી જ્યોતિ હિરાણી, પુષ્પા પારેખ, રેખા કિંગરે સ્વરચિત ગજલો રજૂ કરી શ્રીતાઓને આનંદિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યા શ્રી ચેતન ફેમવાલાએ પોતાની ગજલો સાથે રસમય બનાવ્યું હતું. ફાઉન્ડેશનના નિર્દેશક શ્રી કનુ નાયકે ‘આકારભારતી’ની કલા પ્રવૃત્તિનો ટૂંક પરિચય આપી ગેલેરીમાં રજૂ થયેલ કલાશિબિરનાં ચિત્રો અવલોકવા અનુરોધ કર્યો હતો. તેમણે સ્વરચિત ‘અંકન’ કાબ્યો રજૂ કરી, પોતાના કાબ્યોની ‘સીડી’ ‘સ્વર લહેરી’ સૌને ભેટ આપી હતી.

### જૂનાં સામયિકો જોગ વિનંતી

નિર્દિયાદના ડાહીલક્ષ્મી પુસ્તકાલય ખાતે ગુજરાતી સાહિત્યનાં અમૂલ્ય સામયિકોના સંપાદન-સંશોધનનું કામ હાથ ધરાવ્યું છે. જેમાં ‘હસાહસ’, ‘રમતારામ’, ‘રવિવાર’, ‘બે ઘડી


મોજ’, ‘આરામ’, ‘ચાંદની’, ‘મુંબઈ સાત્તાહિક’, ‘આવાજ’ જેવા અનેક સામયિકોની કોઈ ભાગ મળતી નથી; એટલે કે આ સામયિકોના અંકો જોવા મળ્યા નથી. જે કોઈની પાસે આ કે આવા બીજાં કોઈ પણ સામયિકો વિશે જે કોઈ માહિતી હોય, તેના અંકો ક્યાં છે તેની ભાગ હોય, તો તેની જાગ નીચેના સરનામે પત્ર-ઝોન-ઠમેઠલથી કરવા વિનંતી છે.

અમો માત્ર તે જોવા-જાણવા, શક્ય હોય તો તેનું ડીજિટલાઈઝેશન કરવા, શક્ય હોય તો તેને જાણવા માંગીએ છીએ. આશા છે અભ્યાસના આ યજ્ઞમાં સહકાર મળી રહેશે.

**સંપર્ક :** હસિત મહેતા, માનદંમંત્રી, અ. સૌ. ડાહીલક્ષ્મી, નિર્દિયાદ-૨૮૭૦૦૧ ફોન : મો. ૮૮૮૮૦૬૧૮૭૦ (૦૨૬૮) ૨૫૨૬૧૧૧ (સવારે ૬થી ૮, રાત્રે ૮થી ૧૧) E-mail : hasitlimisha@gmail.com

### શ્રી હિનેશ ડૉંગરે ‘નાદાન’ને રસકવિ રઘુનાથ બલભદ એવોર્ડ

જાણીતા ગજલકાર હિનેશ ડૉંગરે ‘નાદાન’ને નિર્દિયાદસ્થિત હ્યુમન સોસાયરી ઓફ ઇન્ડિયા દ્વારા તેમના ગજલસંગ્રહ ‘થીજી ગયેતી કાણ’ માટે સુરેન્ડનગર મુકાને વારિઝ ગજલકાર ચિનુ મોદીના વરદ હસ્તે ‘રસકવિ રઘુનાથ બલભદ એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે ચિનુ મોદીને ‘નાદાન’ની ગજલો વિશે માંડીને વાત કરી હતી. ઉપરોક્ત પ્રસંગે ચિનુ મોદી ઉપરંત સાહિત્યકાર રત્નલાલ બોરીસાગર, લોકસાહિત્યકાર શાહબુરીન રાઠોડ, પ્રા. યશવંત મહેતા સહિત અનેક ગણમાન્ય સાહિત્યરસિકો હાજર રવ્યા હતી.



રેખાંકન : સવણ છાયા


## આ અંકના લેખકો

ઈન્ડુ પુવાર	: ૨, મલબાર હિલ, રોહાઉસીસ, પ્રેમચંદનગર રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫
કાજલ ઓળ વૈદ્ય	: ૩૦૮, સુપર પ્લાઝ, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૧૫
કિશોરસીંહ ગોવંકી	: 'રૂદ્ર' ૪૩, તીર્થનગર વિ. ૧, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨
ગંભીરસીંહ ગોહિલ	: 'ઠિશાવાસ્યમુ', ડી-૧૪૦, કાણવીલોડ, ભાવનગર-૩૬૪૦૦૨
Jay Gujjar	: P. O. Box 367, Stn. "A", Mississauga Ontario Canada L 5B 3C6
દેવન્દ દવે	: બી/૪૫, ધરતી બંગલોજ, વિસનગર રોડ, માનવ આશ્રમ પાસે, મહેસૂસા-૩૮૪૦૦૧
નરોત્તમ પલાશ	: દર્શન, ૩, વાડી લોટ, પૌરબંદર-૩૬૦૫૭૫
પરાગ નિવેદી	: ૭૦૫, અક્ષરધામ એપાર્ટમેન્ટ, ગિરિરાજ મેઠન રોડ, જૂનાગઢ- ૩૬૨૦૦૨
પ્રફુલ્લ રચવલ	: ૩, રાજમહેલ ફ્લોટ, આઈઓસી કોલોની રોડ, વીરમગામ ઉત્તર્ભૂતિ-૩૮૨૧૫૦
પ્રવીષસીંહ ચાવડા	: ૨૧૨, વૃંદાવન ભા. ૨, સેટેલાઈટ, રિંગરોડ, અમદાવાદ-૩૮૦૦૧૫
ભગવતીકુમાર શર્મા	: ઉર્ભી, પવિત્રા રોહાઉસ, ગેટ નં. ૨, સહજ સુપર સ્ટોરની ગલીમાં, આનંદમહલ રોડ, અડાજાણ, સુરત-૩૮૫૦૦૮
ભાનુપ્રસાદ પંડ્યા	: ૨૪/અ૧, સૌરભ બંગલોજ, સત્યસાંઈ હોસ્પિટલ માર્ગ, રાજકોટ-૫
ભારતી રાણે	: સેંબંજલિ હોસ્પિટલ, લાલબહાદુર શાસ્ત્રી રોડ, બારડોલી- ૩૮૪૬૦૧
ભોગભાઈ પટેલ	: ૩૨, પ્રોફેસર કોલોની, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮
મનોજ જોશી	: ૮, પટેલ કોલોની, બેનીબંદર રોડ, જીમનગર-૩૬૧૦૦૮
મંગળ રાડો	: ૫, કસ્તુરભાનગર, ટેકરાવાળા સ્કૂલ, પાલનપુર પાટ્ટિયા, રાંદેર રોડ, સુરત-૩૮૫૦૦૮
યશોશ દવે	: સદ્ગુરુ વંદનાધામ-૩, બી/૩૦૨, ૫૦ ફૂટ રિંગ રોડ, રૈયા ટેલિ. એક્સ. રાજકોટ-૩૬૦૦૦૭
રાજેન્દ્ર પટેલ	: ૭૮, નિહારિકા બંગલોજ, ડિમતલાલ પાર્ક સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫
રાજેશ વ્યાસ શિસ્કીન	: ૧, સરસ્વતી સોસાયટી, જૈન મરચન્ટ સોસા. પાટ્ટણ, પાલકી, અમદાવાદ-૩૮૦૦૦૭
રાહેશયામ શર્મા	: ૨૫, ભુવાભાઈ પાર્ક, ગીતામંહિર માર્ગ, અમદાવાદ-૩૮૦૦૨૨
રામચંદ્ર પટેલ	: ચોતરા બજાર, ઉમતા, જિ. મહેસૂસા-૩૮૪૪૩૨૦
વિષ્ણુ પટેલ	: ૧, કલ્યવૃક્ષ સોસાયટી, ચાણસ્મા રોડ, પાટણ-૩૮૪૨૬૫
સિલાસ પટેલિયા	: ઈ/૧૧, સૂર્ય ફ્લેટ-૩૦૧, સ્વામીનારાયણનગર સામે, નિઝામપુરા, વડોદરા ઉત્તર્ભૂતિ-૩૮૦૦૦૨

## કવિ શ્રી સુન્દરમ્ભના નવા કાવ્યસંગ્રહો

૧. પલલવિતા	૧૯૯૫	૮૪૩૫૬	૩. ૧૬૦
૨. મહાનદ	૧૯૯૫	૭૧૧૮૩	૩. ૮૦
૩. પ્રભુ-પદ	૧૯૯૭	૧૩૪૪૧	૩. ૨૨૫
૪. અગમ નિગમા	૧૯૯૭	૧૧૨૮૨	૩. ૧૫૦
૫. પ્રિયાંકા	૧૯૯૭	૧૧૩૬૭	૩. ૧૫૦
૬. નિત્યશ્લોક	૧૯૯૭	૧૨૧૮૮	૩. ૧૦૦
૭. નયા પૈસા	૧૯૯૮	૧૩૩૩૩	૩. ૧૭૫
૮. વરદા	૧૯૯૮	૧૬૫૨૮	૩. ૨૫૦
૯. ચક્કદૂટ	૧૯૯૮	૮૨૨૫૮	૩. ૧૨૫
૧૦. લોકલીલા	૨૦૦૦	૧૩૨૪૨	૩. ૧૦૦
૧૧. દક્ષિણા-૧	૨૦૦૨	૧૭૩૨૩	૩. ૫૦
૧૨. મનની મર્મર	૨૦૦૩	૧૦૪૩૮	૩. ૫૦
૧૩. ધૂવયાત્રા	૨૦૦૩	૧૨૩૪૫	૩. ૫૦
૧૪. ધૂવચિત્ત	૨૦૦૪	૧૭૨૭૪	૩. ૫૦
૧૫. ધૂવપદે	૨૦૦૪	૧૧૨૪૩	૩. ૫૦
૧૬. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૧	૨૦૦૪	૧૬૧૨૦	૩. ૨૦૦
૧૭. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૨	૨૦૦૪	૧૬૩૭૦	૩. ૨૦૦
૧૮. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૩	૨૦૦૬	૩૨૩૧૭	૩. ૨૫૦
૧૯. મંગળા-મંગળિકા	૨૦૦૭	૨૮૨૩૮	૩. ૧૫૦
૨૦. તું ક્યાં... હું ક્યાં !?	૨૦૦૮	૨૮૩૦૪	૩. ૨૫૦
૨૧. સ્વાગતમું ગીતવાહીને	૨૦૦૮	૧૬૨૦૭	૩. ૧૫૦
૨૨. 'સાવિત્રી'ના કાવ્યખંડો	૧૯૯૫	૨૪૪૭૩	૩. ૩૦૦
(અનુવાદ : શ્રી અરવિન્દના મહાકાવ્ય Savitriમાંથી, મૂળ અંગ્રેજ સાથે.)			
૨૩. દક્ષિણા-૨	૨૦૦૨	૧૮૬૭૬	૩. ૫૦
(અનુવાદ : શ્રી અરવિન્દના Last Poems, More Poems, Collected Poemsમાંથી, મૂળ અંગ્રેજ સાથે.)			
<b>આ તમામ સંગ્રહોનાં પ્રાપ્તિસ્થાન :</b>			
૧. ગ્રંથાગાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમમાર્ગ, રાઠમસ ઓફ ઇન્ડિયા પાટ્ટણ, અમદાવાદ-૩૮૦૦૦૮			
૨. ગૂર્જર ગ્રંથરલ કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧			

## ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત તદ્દન નવાં પ્રકાશનો



[‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૬’] : સંપાદક : વિનોદ જોશી, પ્ર.આ. ૨૦૦૮, ડિમાઈ, કાચું પૂર્કું, પૃ. ૧૦+૧૦૬, કિ. રૂ. ૭૦/-]

કવિશ્રી કાન્ત શતાબ્દી સમિતિ અને શ્રી બ. ક. ઠાકોર શતાબ્દી સમિતિ તરફથી પરિષદને વર્ષનાં ઉત્તમ કાવ્યો પ્રગટ કરવા માટે રૂ. ૧૫,૦૦૦/-નું દાન મળ્યું હતું. એમાંથી ‘નવમા દાયકાની કવિતા’ શીર્ષક હેઠળ ૧૯૮૧થી ૧૯૯૦ સુધીના એક દાયકાનાં પ્રતિનિધિ કાવ્યોનો સંચય પ્રગટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૯૧થી ૨૦૦૭ના વર્ષ સુધી નિયમિત રીતે પ્રતિ વર્ષ ‘ગુજરાતી કવિતાચયન’ પ્રગટ થતાં રહ્યા છે. કાન્ત-બ.ક. ઠાકોર ગ્રંથમાળાના ૧૬મા મણકો રૂપે આ ચયન પ્રકાશિત થાય છે.

વરસોવરસ પ્રગટ થતાં રહેતાં આ ચયનનો ગુજરાતી કવિતાના ચાહકો-ભાવકો તરફથી સારો પ્રતિભાવ મળતો રહ્યો છે. વર્ષ દરમ્યાન પ્રગટ થયેલાં ગુજરાતી સામયિકોમાંથી પસાર થઈને આ ‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૬’નું સંપાદન શ્રી વિનોદ જોશીએ કરી આપ્યું છે. વિનોદભાઈ કાવ્યમર્મજી છે અને તેમનું કવિતા અને વિવેચનક્ષેત્રે પ્રદાન છે. ભાવકો આ સંચયને આવકારશે એવી અપેક્ષા છે.

[‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૭’] : સંપાદક : સંજુ વાળા, પ્ર.આ. ૨૦૦૮, ડિમાઈ, કાચું પૂર્કું, પૃ. ૧૪+૧૩૦, કિ. રૂ. ૮૫/-]

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૧૯૯૧થી શરૂ થયેલી ગુજરાતી કવિતાચયનની કાવ્યયાત્રામાં કાન્ત-બ.ક. ઠાકોર ગ્રંથમાળાનો આ ૧૭મો મણકો છે. ‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૭’ના સંપાદક શ્રી સંજુ વાળા છે. એક વર્ષનું સંપાદન વ્યાપક રીતે કાવ્યસર્જનની પ્રવૃત્તિનું નિર્ણાયક પરિબળ ભલે ન બને; પરંતુ એવું સંપાદન સર્જતી કવિતાનો આણોપાતળો ચહેરો જરૂર ઉપસાવી શકે છે. એ દાખિએ જેતે વર્ષના કવિતાચયનનું મૂલ્ય સ્વીકારવું ઘટે. વરસોવરસ પ્રગટ થતાં આ ચયનનો ગુજરાતી કવિતાના ચાહકો તરફથી સારો પ્રતિભાવ મળતો રહ્યો છે.

આ ચયનના સંપાદક શ્રી સંજુ વાળાના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. આ ઉપરાંત તેમણે કવિતાનાં સંપાદનો પણ કર્યા છે.

ભાવકો આ સંચયને ઉભાભેર આવકારશે એવી આશા છે.

## ગુજરાતી સાહિત્ય પરિષદ

નદીકિનારે, ‘થઈમ્સ’ પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮. ફોન : ૨૬૫૮૭૯૪૭

## ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત તદ્દન નવાં પ્રકાશનો



[‘કથા-કલરવ’] : સુમંત રાવલ, પ્ર.આ. ૨૦૦૮, ડિમાઈ, કાચું પૂર્કું, પૃ. ૧૦+૧૬૨, કિ. રૂ. ૧૦૦/-]

ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી ગ્રંથશ્રેષ્ઠીના ઉપમા પુસ્તક તરીકે ‘કથા-કલરવ’ વાર્તાસંગ્રહ પ્રગટ થઈ રહ્યો છે. આ સંગ્રહના લેખક સુમંત રાવલની ૧૮ નવલકથાઓ અને છ વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા છે. એમના ‘ધારનાલય’ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેઓ જારી વાચક પણ છે. ‘ચાંદની’ અને ‘આરામ’ જેવાં વાર્તા-સામયિકોએ તેમને વાર્તાલેખનની દિશામાં પ્રેર્ય છે. ઉપરાંત ‘નવનીત-સમર્પણ’, ‘શિત્રલેખા’, ‘શબ્દસૂચિ’, ‘પરબ’ ઈત્યાદિ સામયિકોમાં એમની વાર્તાઓ સતત છાપાતી રહી છે. સુરતી મોઢ વણિકશાસ્ત્રના મુખપત્ર ‘જ્યોતિર્ધર’ના સૌજન્યથી આ પુસ્તકનું પ્રકાશન થઈ રહ્યું છે. વાર્તારસિક ભાવકો આ સંગ્રહને ઉખાભેર આવકારશે એવી આશા છે.

[‘નહિ વીસરાતા ચહેરા’] : પ્રકુલ્પ રાવલ, પ્ર.આ. ૨૦૦૮, ડિમાઈ, કાચું પૂર્કું, પૃ. ૧૨+૧૮૪, કિ. રૂ. ૧૧૦/-]



‘નહિ વીસરાતા ચહેરા’ એ પ્રકુલ્પ રાવલના ચરિત્રનિબંધોનો સંચય ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આચાર્ય કાકાસાહેબ કાલેલકર ગ્રંથાવલિ પ્રકાશન સમિતિના સૌજન્યથી પ્રકાશિત થઈ રહ્યો છે. શ્રી પ્રકુલ્પ રાવલ નિબંધલેખનમાં - વિશેષ ચરિત્રનિબંધો અને ચરિત્રોના લેખનમાં તેમજ લઘુકથાના સર્જનમાં માહિર છે. આ પુસ્તકમાં સાહિત્યકારોનાં ચરિત્રો છે, તો ચામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે સક્રિય વ્યક્તિઓનાં ચરિત્રો પણ છે. ચિત્રકાર કે પક્ષીવિદ કે વિજ્ઞાનીનો સમાવેશ પણ અહીં થયો છે. ચરિત્રાત્મક સાહિત્યનો તત્કાલીન સમાજના ઘડતરમાં મહત્વનો ફાળો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી ગ્રંથશ્રેષ્ઠીનું આ ઉદ્મું પુસ્તક છે. સહદયો આ પુસ્તકને ઉમળકાભેર આવકારશે એવી અપેક્ષા.

## ગુજરાતી સાહિત્ય પરિષદ

નદીકિનારે, ‘થઈમ્સ’ પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮. ફોન : ૨૬૫૮૭૯૪૭